

લઈને બંને સમાંતર રેખાઓને જોડતી ચાપ મારવી જેથી વળાંકવાળી અટકપહ્ણી તૈયાર થાય છે. આ પછીની પહોળાઈ 7 સેમી હોય છે. ફોરિથી 8.07 મી ની બીજી ચાપ મારવાથી 7 સેમી પહોળી અટકપહ્ણી તૈયાર થાય છે. અટકપહ્ણી સમાંતર રેખાને કાટખૂંણે બહારની તરફ 1.5 મીટર લંબાવવામાં આવે છે. સામાન્ય રીતે આ મેદાન દક્ષિણથી ઉત્તર તરફ દોરાય છે. ફેંકરેખા મેદાનની બહાર ગણાય છે. ચાપ લાકડાનું અથવા ધાતુનું હોય છે. તેના ઉપર સર્કેટ રંગ લગાડવામાં આવે છે. જો આવી સુવિધા ન હોય તો સર્કેટ ચૂના વડે તે જ માપનો ચાપ દોરવામાં આવે છે. મેદાનની દરેક રેખા 5 સેમી પહોળી હોય છે.

સાધનો :

- (1) બરછી (2) માપપહ્ણી (3) દોરી (4) ચૂનો (5) ડોલ (6) ખીલા (7) ઝંડીઓ

બરછી :

વાંસ, નેતર અથવા ઓલ્યુમિનિયમની બનાવવામાં આવે છે. પરંતુ સ્પર્ધામાં ઓલ્યુમિનિયમની બરછી હોવી જોઈએ. સ્ત્રીઓ અને પુરુષો માટે બરછીનાં માપ નીચે મુજબ છે :

બરછીનાં માપ વજન તથા અન્ય વિગત :

ક્રમ	વિગત		પુરુષ (Men)	સ્ત્રી (Women)
1.	નવા આંક માટે	ન્યૂનતમ વજન	800 ગ્રામ	600 ગ્રામ
2.	સ્પર્ધા માટે વજન	ન્યૂનતમ અધિકતમ	805 ગ્રામ 825 ગ્રામ	605 ગ્રામ 625 ગ્રામ
3.	બરછીની કુલ લંબાઈ	ન્યૂનતમ અધિકતમ	2.60 મીટર 2.70 મીટર	2.20 મીટર 2.30 મીટર
4.	ધાતુની અણીવાળા ભાગની લંબાઈ	ન્યૂનતમ અધિકતમ	25 સેમી 33 સેમી	25 સેમી 33 સેમી
5.	બરછીની લાકડીનો વ્યાસ	ન્યૂનતમ અધિકતમ	2.5 સેમી 3 સેમી	2.0 સેમી 2.5 સેમી
6.	અણીથી પકડ સુધીની લંબાઈ	ન્યૂનતમ અધિકતમ	0.90 મી 1.06 મી	0.80 મી 0.92 મી
7.	દોરીની પકડની લંબાઈ	ન્યૂનતમ અધિકતમ	15 સેમી 16 સેમી	14 સેમી 15 સેમી

ક્રૌશલ્યો :

- (1) પકડ (2) બરછી વહન (3) પેશકદમી (4) ફેંક (5) છૂટ (6) પગબદલ (સમતોલન)

પકડ :

બરછી ફેંકવા માટે બરછીની મધ્યમાં દોરી વીઠાળીને બનાવેલ દોરીબંધ ઉપરથી જ પકડ લેવી ફરજિયાત છે.

બરછી પકડના ત્રણ પ્રકાર છે : (1) ફિનિશ પકડ (2) અમેરિકન પકડ (3) હંગેરિયન પકડ

(1) **ફિનિશ પકડ** : આ પકડમાં બરછીને દોરીબંધના પાછળના ભાગથી પકડવામાં આવે છે. આમાં પહેલી આંગળી છુટી તથા વળેલી, બીજી આંગળી દોરીબંધના કિનાર ઉપર ગોળ વાળેલી, ત્રીજી તથા છેલ્લી (ટચલી) આંગળી બીજી આંગળીથી દૂર દોરીબંધ ઉપર ગોઠવી અંગૂઠાને બીજી આંગળીઓનો સ્પર્શ થાય તેમ ગોઠવવામાં આવે છે.



ફિનિશ પકડ

(2) **અમેરિકન પકડ** : આ પકડમાં પહેલી આંગળી દોરીબંધના પાછળના ભાગ ઉપર તથા બાકીની ત્રણ આંગળીઓ દોરીબંધ ઉપર રાખવામાં આવે છે. અંગૂઠાને પહેલી આંગળીથી સહેજ દૂર દોરીબંધ ઉપર મૂકવામાં આવે છે.



અમેરિકન પકડ


(3) **હંગેરિયન પકડ** : આ પકડ અમેરિકનપકડ પ્રમાણે જ લેવાય છે ત્રણ આ પકડમાં પહેલી આંગળી દોરીબંધ ઉપર સીધી લંબાવવામાં આવે છે. બીજી આંગળીઓ વડે બરછીને ધકેલનો વેગ મળે છે. અંગૂઠો આંગળીઓની બાજુમાં ટેકો આપે છે.



હંગેરિયન પકડ

બરછી હાથમાં પકડીને દોડવામાં અનુકૂળતા અને સરળતા રહે તે રીતે બરછીને રાખવાની કિયાને બરછીવહન કહેવામાં આવે છે. બરછી વહનની નીચે પ્રમાણે ત્રણ રીતો પ્રચલિત છે :

- (1) બરછી ખભાથી સહેજ ઉપર આડી ઊંચે (આકૃતિ A પ્રમાણે)
- (2) બરછી ખભાથી ઉપર અને આડી નીચે (આકૃતિ B પ્રમાણે)
- (3) હાથ પાછળ જમીન તરફ અને બરછી બગલમાં (આકૃતિ C પ્રમાણે)



સામાન્ય રીતે તાલીમી વિદ્યાર્થીઓ માટે A પ્રકારનું બરછીવહન સરળ રહે છે. ઉચ્ચકક્ષાની તાલીમ લીધા પછી C પ્રકારના બરછીવહનમાં ફુશળતા પ્રાપ્ત કરી શકાય છે.

પેશકદમી :

બરછી લઈને ફેંકવા માટે જે દોડવાની કિયા કરવામાં આવે છે તેને પેશકદમી કહે છે. આ કિયામાં અંતિમ પાંચ પગલાંનું ઘણું જ મહત્વ છે. જેના આધારે બરછી કેટલી વધારે દૂર ફેંકી શકાય તે નક્કી થાય છે. પેશકદમીમાં ઝડપ અને અંતર જેવી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. બરછી ફેંક વખતે સ્પર્ધક વધારેમાં વધારે ઝડપ પ્રાપ્ત કરી શકે તેટલું અંતર પેશકદમીમાં રાખવું જોઈએ. સામાન્ય રીતે આ અંતર 30 મીટરથી 36.5 મીટર જેટલું રાખવામાં આવે છે.

ફેંક અને છૂટ :

નિશ્ચિત કરેલા નિશ્ચાનથી સ્પર્ધક ફેંક કિયાની શરૂઆત કરે છે. બધી જ ફેંક પદ્ધતિઓમાં શરૂ કરતાં પહેલાં શરીરને વિવિધ ગતિવિધિઓ(Warm up)થી તૈયાર કરાય છે. બરછી ફેંકમાં અંતિમ પગ ડાબો (જમણોરી માટે) મૂકવામાં આવે છે અને પૂરા શરીર, ખબા, કોણી, કાંદુ તથા આંગળીઓના લયક વડે બરછી ફેંકવામાં આવે છે. બરછીવાળો હાથ માથા અથવા ખબા ઉપર આગળ સીધો થતા હાથમાંથી આશરે 45° ના ખૂંઝે છોડવામાં આવે છે. સામાન્ય રીતે ફેંકતી વખતે બરછીનો જમીન સાથે ખૂંઝો 35°થી 40°નો હોય છે.

પગબદલ (સમતોલન) :

શરીરની અગ્રગતિને નિયંત્રિત કરવા અને આ ગતિને કારણે થતી ભૂલોમાંથી શરીરને રોકી સમતોલન જાળવવા માટે જમજા પગને ફેંકેખા નજીક મૂકી, શરીરનું વજન તેના ઉપર લઈ ડાબા પગને પાછળની બાજુએ ઊંચો કરવાનો હોય છે. આ કિયા કરવાથી શરીરનું સમતોલન જાળવી શકાય છે.

બરછી ફેંક સ્પર્ધાના નિયમો :

- (1) બરછી ફેંકમાં કમ નક્કી કરવા માટે ચિંકી ઉપાડ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
- (2) સાધન-ચકાસણી સમિતિએ નક્કી કરેલી બરછી જ સ્પર્ધક સ્પર્ધામાં ઉપયોગ કરી શકશે.
- (3) સ્પર્ધક સ્વચ્છ, ભીના થવા છતાં પારદર્શક ન બને તેવા ખૂલતાં કપડાં પહેરવાં જોઈએ.
- (4) સ્પર્ધક છાતી તથા પીઠ ઉપર સ્પષ્ટ દેખાય તે રીતે તેને આપવામાં આવેલા નંબર લગાડવા જોઈએ.
- (5) સ્પર્ધા શરૂ થતા પહેલાં દરેક સ્પર્ધકને નિર્ણાયકની હાજરીમાં કમ પ્રમાણે બે તક મહાવરા (Trial) માટે આપવામાં આવશે.
- (6) સ્પર્ધા શરૂ થયા પછી દોડમાર્ગ કે મેદાનનો ઉપયોગ કોઈ પણ સ્પર્ધક કરી શકશે નહિ.
- (7) સ્પર્ધક બરછી ફેંકવા માટે પકડ દોરીબંધથી લેવી જરૂરી છે.
- (8) ફેંકની શરૂઆતમાં અથવા તો દોડમાર્ગમાં બરછી જમીનને અદે તો તક નિષ્ફળ (ફાઉલ) ગણાશે.
- (9) સ્પર્ધક ખુલ્લા પગે, એક કે બને પગે સ્પાઇક પહેરીને સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
- (10) સ્પર્ધક સતત ગ્રાસ કે છ તકની માગણી કરી શકે નહિ.
- (11) સ્પર્ધકને તેની તકનો ઉપયોગ કરવાનો સમય 1 મિનિટનો રહેશે. સ્પર્ધક જાણી જોઈને વધારે સમય લેશે તો તક નિષ્ફળ ગણાશે.
- (12) બરછી ફેંકમાં જો 8થી વધુ સ્પર્ધક હોય તો દરેકને ગ્રાસ તક તથા 8થી ઓછા હોય તો દરેકને 6 તક આપવામાં આવશે.
- (13) આઠ કરતા વધુ સ્પર્ધક હોય તેવા સંજોગોમાં દરેકને ગ્રાસ તક આપી ઉત્તમ આંકવાળા આઠ પસંદ કરી તેને ફાઈનલ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવશે. આઠમા નંબર માટે સમાન આંકવાળા એકથી વધારે હોય તો ગાંઠ ઉકેલના નિયમ લાગુ પાડી જોલાડીની પસંદગી કરવી. પસંદ થયેલા આઠ સ્પર્ધકોને વધારાની ગ્રાસ તક ઊંચાટા કરું માંથી આપવાની રહેશે.
- (14) ઉત્તમ આંકવાળા પ્રથમ આઠ સ્પર્ધકોને ફરીવાર ગ્રાસ તક અપાશે તથા અંતિમ નિર્ણય કુલ 6 તકમાંથી ઉત્તમ આંક પ્રમાણે વિજેતા નંબર અપાશે.

- (15) સ્પર્ધક ફેંક પ્રદેશમાં રૂમાલ કે કોઈ પણ નિશાની મૂકી શકશે નહિ.
- (16) બરછી જમીન ઉપર પડ્યા પછી જ સ્પર્ધક અટકપડ્યીની પાછળની દિશામાંથી બહાર જઈ શકશે.
- (17) બરછી ફેંકરેખાને અદે તો તક નિષ્ફળ ગણાશે.
- (18) બરછી ફેંકમાં બરછીની અણી સૌપ્રથમ જમીન પર અડવી ફરજિયાત છે અન્યથા તક નિષ્ફળ ગણાશે.
- (19) બરછી જો હવામાં તૂટી જાય તો ફરીથી તક આપવામાં આવશે. જમીન પર પડ્યા પછી તૂટે તો સાચી તક માની આંક ગણતરીમાં લેવાશે.
- (20) સ્પર્ધામાં જે-તે સ્પર્ધાનો રેકોર્ડ તથા વર્લ્ડ રેકોર્ડ દર્શાવતી બે ઝંડી ગ્રાઉન્ડ ઉપર રોપવામાં આવશે.
- (21) બરછી ફેંકમાં જો ગાંઠ (ટાઇ) પડે તો તે પછીના ઉત્તરતા ઉત્તમ આંકને ગણતરીમાં લઈને ગાંઠ ઉકેલાશે. જો છ તકોમાં ઉત્તરતા આંક સરખા હોય તો અને પ્રથમ નંબર માટે ગાંઠનો ઉકેલ ન આવે ત્યાં સુધી એક-એક વધારાની તક અપાશે. ગાંઠ બીજા કે ત્રીજા નંબર માટે હોય તો સમાન નંબર અપાશે.
- (22) જ્યાં સુધી બરછી જમીન પર ન પડે ત્યાં સુધી સ્પર્ધક દોડમાર્ગ છોડીને બહાર જઈ શકશે નહિ.
- (23) હાથમોંનો ઉપયોગ કરી શકાશે નહિ.
- (24) સારી પકડ માટે યોગ્ય પદાર્થ લગાડી શકાશે.
- (25) કમર તથા કરોડના સંભવિત નુકસાનથી બચવા સ્પર્ધક ચામડા કે કોઈ પદાર્થનો પછો પહેલી શકશે.
- (26) દોડમાર્ગનો ફેંક પ્રદેશ તરફનો ઢોળાવ 1:1000 કરતા વધુ ન હોવો જોઈએ.
- બરછી ફેંક વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :**
- (1) જમણા હાથે બરછી ફેંકનાર બેલાડીએ દોડમાર્ગમાં પોતાનો ડાબો પગ પહેલા મૂકવો.
 - (2) દોડમાર્ગ ઉપર મહત્તમ ગતિશી દોડવું.
 - (3) દોડમાર્ગ ઉપર બરછી પાછળ બેંચી રાખીને દોડવું.
 - (4) ફેંકતી વખતે ખબા ઉપરથી બરછી ફેંકવી.
 - (5) છૂટની કિયા વખતે શરીરનું પૂરું વજન ફક્ત એડી ઉપર ન મૂકતા પૂરા પગ ઉપર મૂકવું.
 - (6) છૂટ થતાંની સાથે જ પાછળનો પગ આગળ લઈને શરીરને સમતોલનમાં લાવવાનો પ્રયત્ન કરવો.
 - (7) વધારે સારી ફેંક કરવા માટે અંતિમ કદમ વખતે શરીરનું સંતુલન કાબૂમાં રાખવું.
 - (8) બરછી ફેંકમાં વધારે સારો આંક મેળવવા માટે અંતિમ કદમ મોટું લેવામાં આવે છે.
- નોંધ :** બરછી જમણા હાથે ફેંકનારને ધ્યાને રાખી માહિતી આપી છે. ડાબે હાથે ફેંકનાર માટે આથી વિરુદ્ધ હાથ-પગની કિયા થશે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો :

- (1) બરછી ફેંકના મેદાનની નામનિર્દેશવાળી આકૃતિ બનાવો.
- (2) બરછી ફેંકના કોશલ્યો જણાવી પકડ કોશલ્ય સમજાવો.
- (3) બરછી ફેંકની સ્પર્ધાના નિયમો જણાવો.

2. નીચેના પ્રશ્નોનાં એક-બે વાક્યોમાં જવાબ આપો :

- (1) બરછી શાની બનેવી હોય છે ?
 - (2) બરછી ફેંકનું મેદાન કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે ?
 - (3) બરછી ફેંકમાં પકડની રીતનાં નામ આપો.
 - (4) બરછી ફેંકમાં બરછીનું વહન કેટલી રીતે થાય છે ?
 - (5) સ્ત્રીઓ માટે બરછીનું વજન કેટલું હોય છે ?

3. સાચો વિકલ્પ પસંદ કરો :



ઈતિહાસ

વોલીબોલ આંતરરાષ્ટ્રીય રમત છે જે ખુલ્લા મેદાનમાં રમતજ ઊંચી છતવાળા મોટા હોલની અંદર (ઇન્ડોર) એમ બંને સ્થાને રમી શકાય છે. ઈ.સ. 1895માં વોલીબોલની રમતની શરૂઆત કરવાનું શ્રેય અમેરિકાના પ્રો. વિલિયમ જી. મોર્ગનને ફાળે જાય છે. શરૂઆતમાં આ રમતનું નામ ‘મિન્ટોનેટ’ રાખવામાં આવ્યું. ત્યારબાદ શ્રી મોર્ગનના સહકાર્યકર્તા શ્રી એ. ડી. હેલસ્ટર્ટની સલાહ મુજબ આ રમતનું નામ બદલીને ‘વોલીબોલ’ રાખવામાં આવ્યું. કારણ કે આ રમતમાં દડાને હવામાં અદ્વાર રાખીને જ રમવાનું હોય છે અને દડાને હવામાં અદ્વાર રમવાનાં કૌશલ્યને અંગ્રેજીમાં વોલી કહેવામાં આવે છે. એટલે આ રમતને ‘વોલીબોલ’ નામ આપવામાં આવ્યું.

ભારતમાં વોલીબોલની રમત શરૂ કરવાનું શ્રેય ચેનાર્થ (મદાસ)ની ધંગ મેન્સ કિશ્ચિયન એસોસિયેશન (Y.M.C.A.) સંસ્થાને જાય છે. ખૂબ જ ઓછી જગ્યામાં, ઓછાં સાધનોથી ઓછા ખર્ચ રમી શકાય એવી રમત હોવાને કારણે તે ભારતમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ છે. આજે શાળા-કોલેજોમાં વોલીબોલના મેદાનની સગવડ હોવાથી શહેરો ઉપરાંત ગામડાંઓમાં પણ આ રમત રસપૂર્વક રમાય છે. ઈ.સ. 1953માં વોલીબોલ રમતના નિયમો મુજબ શ્રી આર. એસ. કિરપાનારાયણની અથાગ મહેનતથી પ્રથમ ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ રમતનું રાષ્ટ્રીયક્ષાએ સંકલન કરવા માટે વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના સન ઈ.સ. 1951માં કરવામાં આવી.

આ રમતની હરીકાઈઓ જિલ્લા, રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. ઈ.સ. 1936માં ઓલિમ્પિક રમતોત્સવ વખતે બર્લિનમાં આ રમતનું નિર્દર્શન ગોઠવવામાં આવ્યું. ઈ.સ. 1939માં વર્લ્ડ યુનિવર્સિટી રમતોત્સવમાં વોલીબોલનો સુમાવેશ થયો અને ઈ.સ. 1947માં ‘ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન’ની સ્થાપના થઈ અને સ્વર્ધાના નિયમો ઘડવામાં આવ્યા. ભાઈઓ માટે પ્રથમ ‘વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપ’ ઈ.સ. 1949માં ઝેકોસ્લોવેકિયામાં યોજવામાં આવી હતી. તેમાં રશિયા વિજયી બન્યું હતું. ઈ.સ. 1954માં ‘એશિયન વોલીબોલ ફેડરેશન’ની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1955માં પ્રથમ ‘એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ’ જાપાનમાં ટોકિયો મુકામે યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપ ભારતે જતી હતી. ઈ.સ. 1958માં ટોકિયો મુકામે આયોજિત ત્રીજા એશિયન રમતોત્સવમાં વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતે સૌ પ્રથમ વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ઈ.સ. 1964માં ઓલિમ્પિક રમતોત્સવમાં પણ ત્રણ દેશો અનુકૂળે રશિયા, ઝેકોસ્લોવેકિયા અને જાપાન વિજેતા બન્યા હતા.

વોલીબોલ રમતનું મેદાન

(1) મેદાન : વોલીબોલ રમતનું મેદાન 18 મીટર લાંબું અને 9 મીટર પછોળું હોય છે તથા ફરતે 3 મીટર મુક્ત પ્રદેશ હોય છે. ઉપરની બાજુ 7 મીટર જેટલી ઊંચાઈ સુધી ખુલ્લી જગ્યા હોવી જોઈએ.

આંતરરાષ્ટ્રીયક્ષાએ મુક્ત પ્રદેશ બાજુરેખાથી 3 મીટરથી 5 મીટર અને અંતરેખાથી 3મી થી 8 મીટર સુધી હોવો જોઈએ અને ઉપરનો બાગ 12.5 મીટર ઊંચાઈ સુધી ખુલ્લો હોવો જોઈએ. મેદાનની બધી જ રેખાઓ 5 સેમી પછોળી હોવી જોઈએ.


(2) મધ્યરેખા : નેટની બરાબર નીચે મેદાનની મધ્યમાં 5 સેમી પછોળી રેખા દોરવામાં આવે છે જેથી મેદાનના 9 x 9 મીટરના બે સરખા ભાગ થાય છે.

(3) આકમણરેખા : મધ્યરેખાની બંને બાજુ મધ્યરેખાથી 3 મીટર દૂર મધ્ય રેખાને સમાંતર બે આકમણરેખા દોરવામાં આવે છે. મેદાનની બહારની બાજુ તેને 1.75 મીટર તૂટક તૂટક લંબાવવામાં આવે છે. 20 સેમી જગ્યા છોડી 15 સેમી રેખા દોરીને લંબાવવામાં આવે છે.

(4) હદરેખા : બે બાજુ રેખાઓ તથા બે અંતરરેખાઓથી રમવા માટેનું મેદાન દોરવામાં આવે છે. આ રેખાઓ મેદાનના ભાગરૂપ હોય છે.

(5) સર્વિસપ્રદેશ : અંતરેખાથી પાછળથી સર્વિસ કરવામાં આવે છે. તેને સર્વિસપ્રદેશ કહેવામાં આવે છે.

વોલીબોલનું મેદાન :



સાધનોનો પરિચય

(1) થાંભલા : વોલીબોલમાં નેટને બાંધવા માટેના થાંભલા મધ્યરેખાની સીધમાં અને બાજુરેખાથી 1 મીટર દૂર રાખવામાં આવે છે. જે જમીનથી 2.55 મીટર ઊંચાઈના ગોળ અને લીસા હોવા જોઈએ.

(2) નેટ : 9.50 મીટર લાંબી અને 1 મીટર પહોળી 10×10 સેમીના ચોરસ ખાનાવણી હોય છે. નેટની ઉપરની બાજુ બે ગણા જાડા કેનવાસના કપડાથી 5 સેમી પહોળો પહોળો રહે તે રીતે સીવી લેવામાં આવે છે. જેથી તેમાંથી જાડો તાર અથવા દોરડું પસાર કરી શકાય. નીચેના છેદે કેનવાસ વગર ચોરસ ખાનામાંથી પસાર થાય તેમ બંને થાંભલા સુધી દોરડું લગાવવામાં આવે છે.

(3) દર્શકપણી : નેટ ઉપર બંને બાજુરેખા અને મધ્યરેખાને કાટખૂણે બે દર્શકપણીઓ વચ્ચે 9 મીટર અંતર રહે તેમ રાખવામાં આવે છે. જે 1 મીટર લાંબા અને 5 સેમી પહોળા સફેદ રંગના હોય છે. જે નેટના બાગરૂપ ગણાય છે.

(4) એન્ટેના : એન્ટેના 1.80 મીટર લાંબી અને 10 મિલિમીટરના વ્યાસવણી ગોળ ફાઇબર જલાસ અથવા તેના જેવા પદાર્થની બનાવટવણી હોય છે. એન્ટેના દર્શકપણીની બહારની ધાર પર નેટ ઉપર બંને છેદે વિરુદ્ધ બાજુએ એવી રીતે લગાડવામાં આવે છે જેથી 80 સેમીના એન્ટેના નેટની ઉપર રહે. એન્ટેનાને 10-10 સેમીના અંતરે બે તિનું રંગથી રંગવામાં આવે છે. એન્ટેના નેટનો જ ભાગ ગણાય છે.

(5) દડો : નરમ ચામડાની બજાવટવાળો 4 નંબરનો હોય છે. જેમાં અંદરની બાજુ રબરની બ્લેડર રાખવામાં આવે છે. દડાનો રંગ આઇઓ અને એક જ પ્રકારનો હોવો જોઈએ.


દડાનો ઘેરાવો : 65 સેન્ટિમીટરથી 67 સેન્ટિમીટર અને વજન 260 ગ્રામ હોય છે.

(6) મુખ્યપંચ માટે સ્ટેન્ડ (7) લાઈનીગ મશીન (8) ગુણપત્રક (9) બિસલ (10) દોરી (11) હવા માપવાનું ધ્યાન (12) ચૂનો (13) હવા ભરવાનો પંપ (14) સ્ટોપવોચ (15) ટેબલ-બુશ્ટી વગેરે સાધનો હોય છે.

કૌશલ્યો :

(1) સર્વિસ : પોતાના મેદાનની અંતરેખાની બહારથી એક હાથ વડે દડાને હવામાં ઉછાળી બીજા હાથની મૂકી કે હથેળીના કોઈ પણ ભાગથી ફટકારી નેટ ઉપરથી સામા પક્ષના મેદાનમાં મોકલી રમત શરૂ કરવાના કૌશલ્યને સર્વિસ કહેવામાં આવે છે. સર્વિસના નીચે પ્રમાણે પ્રકારો હોય છે :


(1) સાઢી સર્વિસ : સર્વિસ પ્રદેશમાં ખેલાડી મેદાનની તરફ ઊભો રહી એક પગ આગળ મૂકી એક હાથે દડાને ઉછાળી બીજા હાથને ઝોલો આપી હથેળીના ઉપરના ભાગ વડે નીચેથી ફટકારી નેટ ઉપરથી સામા પક્ષના મેદાનમાં મોકલે છે.



સાઢી સર્વિસ

આ કિયાને અન્ડરહેન્ડ સર્વિસ પણ કહેવામાં આવે છે.


(2) ટેનિસ સર્વિસ : આ પ્રકારની સર્વિસમાં ખેલાડી દડાને માથા કરતાં વધારે ઊંચાઈએ ઉછાળી એક હાથને અરધો



ટેનિસ સર્વિસ

વાળીને માથા ઉપરથી પાછળ લઈ જઈ દડો નીચે આવતાં તે હાથને આગળ લાવી, ખુલ્લી હથેળીથી દડાને ફટકારી નેટ ઉપરથી સામા પક્ષના મેદાનમાં મોકલે છે. આ પ્રકારની સર્વિસને ઓવરહેડ સર્વિસ પણ કહેવામાં આવે છે.

(3) સાઈડ આર્મ સર્વિસ : ખેલાડીએ પોતાનો ડાબો પગ અને ડાબો ખભો નેટ તરફ આવે તેમ રહી દાને ઊંચે ઉછાળી



સાઈડ આર્મ સર્વિસ


નીચે આવતા દાને જમણા હાથને બાજુ પર લઈ જઈ નેટ તરફ લાવી નીચે આવતા દાને ખુલ્લા હાથે ફટકારી સામા પક્ષના મેદાનમાં મોકલે છે.

(4) રાઉન્ડ આર્મ સર્વિસ : ખેલાડીએ જે હાથે સર્વિસ કરવાની હોય તેનાથી વિરુદ્ધ ખભો નેટ તરફ આવે તેમ સર્વિસ એટિયામાં ઊભા રહેવું. એક હાથ વડે દડો હવામાં માથાની ઊચાઈ કરતા થોડો વધારે ઊંચો ઉછાળવો. બીજા હાથને ખભામાંથી નીચેથી ઉપર તરફ ચકગતિ આપી નીચે આવતા દાને ખુલ્લી હેઠળીથી એવી રીતે ફટકારવો કે જેથી દડો નેટ પરથી સામાપક્ષના મેદાનમાં જાય. આ કિયાને અસરકારક બનાવવા મેદાન તરફના પગના પંજા પર સાધારણ ફૂદકા સાથે કિયા કરશે.

પાસિંગ

વોલીબોલની રમતમાં સામાન્ય રીતે સામાપક્ષના મેદાનમાંથી આવેલો દડો પોતાની ટીમના ખેલાડીને દડો પાસ કરવો અથવા દડો સામાપક્ષમાં મોકલવાના કૌશલ્યને પાસિંગ કહેવામાં આવે છે. રમતમાં બે પ્રકારે ખેલાડીને દડો પાસ કરવામાં આવે છે.

(1) અન્ડરહેન્ડ પાસ : રમત દરમિયાન સામા પક્ષમાંથી આવેલો દડો કમર કરતાં નીચો હોય ત્યારે ‘અન્ડરહેન્ડ પાસ’નો




અન્ડરહેન્ડ પાસ

ઉપયોગ કરવામાં આવે છે. આ પાસમાં ખેલાડીના બંને પગ ખુલ્લા ઘૂંઠણમાંથી સહેજ વળેલા રાખી એક હાથની મૂઢીવાળી

તેનાં પર બીજા હાથની હથેળી નીચે રાખવી. બંને હાથને નજીકમાં સીધા રાખી બંને હાથથી દડો કંડાથી કોણી સુધીના ભાગમાં લઈ પાસ કરે છે. આ કિયા વખતે ખેલાડી ઘૂંઠા સીધા કરી દડો પાસ કરશે. આ પાસમાં બે હાથનો ઉપયોગ થતો હોવાથી ‘ટુ હેન્ડ અન્ડર હેન્ડ’ પાસ પણ કહે છે.

(2) ઓવરહેડ પાસ : રમત દરમિયાન સામા પક્ષમાંથી માથાની ઊંચાઈએ કે ઉપરથી દડો આવતો હોય તે સમયે માથા ઉપર બંને હાથના આંગળાઓ વડે રમવાની કિયાને ‘ઓવરહેડ’ પાસ કહેવામાં આવે છે.




આ પાસમાં દડાને રમવા માટે બંને પગ સહેજ વળેલા, કમર સીધી, હાથ કોણીમાંથી વળેલા, અંગૂઠા અંદરની બાજુ અને આંગળીઓ બાજુ પર રાખી દડો જ્યારે કપાળની સામે આવે ત્યારે આંગળીઓના ટેરવાં વડે પસાર કરવામાં આવે છે જેને ‘ટુ હેન્ડ ઓવર હેડ પાસ’ પણ કહેવામાં આવે છે.

સેટિંગ

વોલીબોલની રમતમાં સેટિંગ કરવા સ્મેશર માટે દડાને નેટ પાસે યોગ્ય રીતે ગોઠવવાના કૌશલ્યને ‘સેટિંગ’ અથવા ‘સેટ અપ’ કહે છે.

(1) ઊંચો સેટ-અપ (હાઈ સેટ-અપ) : દડાને ઊંચે ઉછાળીને સેટ કરવાના કૌશલ્યને ઊંચો સેટ-અપ કહેવામાં આવે છે. આ કૌશલ્યમાં સેટ-અપ કરનાર ખેલાડી સેટિંગ કરનાર ખેલાડીની અનુકૂળતા મુજબ નેટથી આશરે 1.25 થી 1.50 મીટર



ઊંચે દડાને સેટ કરવામાં આવે છે.

(2) નીચો સેટ-અપ (લો સેટ-અપ)

આ કૌશલ્યમાં સ્પાઈકિંગ કે સ્મેશિંગ પર કાબૂ ધરાવનાર અને ઝડપી ખેલાડી માટે નેટની ઉપર 2થી 3 ઠંચ ઊંચે



દાને ઓવરહેડ કે અન્ડરહેન્ડથી નેટ ઉપર સેટ કરવામાં આવે છે. યોગ્ય જગ્યાએ ઝડપથી નેટ પર દડો ગોઠવાય કે તરત જ સામાપ્નશનો રોક કરવાની કે વિચારવાની તક ન મળે તેમ, સ્મેશિંગ કરનાર દાને સામાપ્નશમાં ફટકારે છે.


સ્મેશિંગ અથવા સ્પાઈકિંગ :

નેટ ઉપર સેટ કરેલા દાને સ્પાઈકર જમ્ય લઈ હાથ વડે ત્વચિત ગતિથી બળપૂર્વક સામાપ્નશના મેદાનમાં ફટકારે છે તેને સ્મેશિંગ અથવા સ્પાઈકિંગ કહે છે. વોલીબોલ રમતમાં વધુ ગુણ મેળવવા આકમણ કરવા માટેનું અત્યંત ઉપયોગી કૌશલ્ય છે. આ કૌશલ્યનો ઉપયોગ આગળની ડરોળના ખેલાડીઓ મહત્તમ કરે છે. સ્મેશિંગના બે પ્રકાર છે :

(1) વન લેગ ટેક ઓફ (2) દુ લેગ્સ ટેક ઓફ.

(1) વન લેગ ટેક ઓફ : નેટ ઉપર સેટ થયેલા દાને નેટ ઉપરથી ફટકારવા સ્મેશ કરનાર ખેલાડી બે-ગ્રાણ કદમ દૂરથી દોડતા આવી, એક પગે કૂદકો લઈ દાને મજબૂત હથેળી વડે ત્વચિત ગતિથી બળપૂર્વક ફટકારી સ્મેશિંગ કરે છે. દાને ફટકારતાં મધ્યરેખા કે નેટમાં ફાઉલ ન થાય તેનું ધ્યાન રાખવું.


(2) દુ લેગ્સ ટેક ઓફ : નેટ ઉપર સેટ થયેલા દાને નેટ ઉપરથી ફટકારવા સ્મેશિંગ કરનાર ખેલાડી બે-ગ્રાણ કદમ



દૂરથી દોડતા આવી બંને પગના પંજા ભેગા કરી બંને પગ વડે હવામાં કૂદકો લગાવી હથેળી વડે દાને ત્વચિત ગતિથી બળપૂર્વક ફટકારે છે. ગુણ મેળવવા આ કૌશલ્ય ખૂબ અગત્યનું છે.

બ્લોકિંગ (રોખ)

સામાપ્નિકના સ્પાઈકર વડે ફટકારેલા દડાને બચાવપ્કશના નેટ પાસેના આગળની હરોળના બેલાડીઓ દ્વારા હાથના પંજા વડે નેટ ઉપર જ રોકવાના કૌશલ્યને બ્લોકિંગ (રોખ) કહેવામાં આવે છે. આ કૌશલ્યનો ઉપયોગ આગળની હરોળના નેટ પાસેના ત્રણ બેલાડીઓ જ કરી શકે છે. એક બેલાડી વડે રોખ, બે બેલાડીઓ વડે રોખ, ત્રણ બેલાડીઓ વડે રોખ જેવી દડાને નેટ ઉપર રોકવાની પદ્ધતિઓ છે. બ્લોકિંગ કરવા માટે ત્વરિત નિર્ણય, યોગ્ય સમય અને ઊંચો કૂદકો એ મહત્વની બાબત તથા રોખ કરનારનું ધ્યાન સામાપ્ને સેટ થયેલા દડા પર રાખવું અગત્યની બાબત છે. વોલીબોલ રમતનું આ ઉત્તમ રક્ષણાત્મક કૌશલ્ય છે. જેના પ્રકારો : (1) વન મેન બ્લોક (2) ટુ મેન બ્લોક (3) શ્રી મેન બ્લોક છે.




(1) વન મેન બ્લોક : સામાપ્ને તરફથી સ્મેશ થયેલા દડાને નેટ ઉપર જ રોકવા એક બેલાડી નેટની દિશા તરફ મોં રાખી પગ ધૂંટણમાંથી સહેજ વળેલા રાખી, હાથના પંજા ખુલ્લા રહે તે રીતે કૂદકા સાથે પ્રયાસ કરશે. એક બેલાડી દ્વારા થતા બ્લોકને વન મેન બ્લોક કહે છે.

(2) ટુ મેન બ્લોક : સ્મેશિંગ થતા દડાને બે બેલાડીઓ સાથે રહી, કૂદકા સાથે નેટ ઉપર રોકવાના કૌશલ્યને 'ટુ મેન બ્લોક' કહે છે. આ પદ્ધતિમાં સ્મેશ થયેલો દડો રોકાઈ જવાની શક્યતા વધુ હોય છે અને સામેની ટીમના આકમણને રોકી શકાય છે.

(3) શ્રી મેન બ્લોક : સામાપ્નેથી સ્મેશિંગ થતા દડાને નેટ ઉપર જ રોકવા આગળની હરોળના ત્રણ બેલાડીઓ સાથે રહી કૂદકા સાથે હાથના પંજા ખુલ્લા રાખી પ્રયાસ કરશે. આ પદ્ધતિમાં દડો રોકવાની શક્યતા વધુ રહેલી છે. આ કૌશલ્ય સામાપ્નિકા આકમણને રોકવા રક્ષણાત્મક રીતે ખૂબ ઉપયોગી છે.

નેટ રિકવરી

રમત દરમિયાન નેટમાં અથડાતા દડાને કુનેહપૂર્વક ઉઠાવી, તેને રમતમાં પાછો લાવવાના કૌશલ્યને નેટ રિકવરી કહેવામાં



આવે છે. નેટ પાસેના આગળની હરોળના ત્રણ ખેલાડીઓએ નેટમાં અથડાતા દડાને ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. નેટમાં અથડાયેલો દડો નીચે પડે તે પહેલાં બીજા સર્વર્ષ વડે તેને પોતાના મેદાનમાં ઊંચે અથવા સામાપ્ક્ષના મેદાનમાં પાસ કરશે.

વોલીબોલ રમતના નિયમો :

- (1) મેદાનની લંબાઈ 18 મીટર અને પછોળાઈ 9 મીટર, મધ્યરેખાથી આક્રમણરેખા 3 મીટર દૂર હોય છે.
- (2) વોલીબોલ રમતમાં નેટની ઊંચાઈ ભાઈઓ માટે 2.43 મીટર અને બહેનો માટે 2.24 મીટર હોય છે.
- (3) પ્રત્યેક ટુકડીમાં કુલ 12 ખેલાડીઓ હોય છે. 6 રમનાર અને 6 અવેજા.
- (4) વોલીબોલ રમતની શરૂઆત સિક્કા ઉછાળથી થાય છે.
- (5) રાખ્ટ્રીય, આંતરરાખ્ટ્રીયક્ષાએ વોલીબોલની રમત બેસ્ટ ઓફ ફાઇવ (પાંચસેટ)ની, જ્યારે સામાન્ય રમત ત્રણ સેટથી રમતાતી હોય છે. પાંચસેટમાં ત્રણસેટ જીતનાર અને ત્રણસેટની રમતમાં બેસ્ટ જીતનારને વિજેતા જાહેર કરાય છે.
- (6) મેદાનની ફેરબદલી દરેક સેટના અંતે થાય છે. તેમજ નિર્ણાયક સેટ વખતે 8 ગુણો ફેરબદલ કરવામાં આવે છે.
- (7) દરેક સેટ 25 ગુણનો હોય છે. 25 ગુણ પ્રથમ પ્રામ કરનાર ટીમ સેટ જીતી ગણાશે, પરંતુ બંને ટીમના 24-24 સરખા ગુણ થાય તો બે ગુણનો તફાવત ન થાય ત્યાં સુધી રમત ચાલુ રહેશે.
- (8) બંને ટીમો બે-બે મેચ જીતે તો પાંચમો સેટ નિર્ણાયક સેટ ગણાય છે. જે 15 ગુણનો હોય છે.
- (9) દરેક ટીમ એક્સેટ દરમિયાન વધુમાં વધુ છ અવેજકરણ કરી શકે છે. અવેજકરણ એક સાથે અથવા અલગ અલગ સમયે લઈ શકાય છે.
- (10) સામાપ્ક્ષમાં દડાને એક્પક્ષ વધુમાં વધુ ત્રણ પ્રયત્નોથી મોકલી શકશે.
- (11) કોઈ પણ ખેલાડી દડાને સતત બે વખત રમી શકશે નહિ.
- (12) ટાઈમ આઉટ : એક્સેટમાં બે ટાઈમ આઉટ પ્રત્યેક ટુકડીને આપવામાં આવે છે જે 30 સેકન્ડનો હોય છે.
- (13) બેસેટ વચ્ચે વિરામ સમય 7 મિનિટનો હોય છે. નિર્ણાયક સેટ વખતે વિરામ સમય 10 મિનિટનો હોય છે.
- (14) સર્વિસ : ક્રિસ્ટલ વાયા પછી 7 સેકન્ડ સુવીમાં ખેલાડીને સર્વિસ કરવાની રહેશે.
- (15) વોલીબોલમાં રમતનો સમય મુકરર કરવામાં આવેલ નથી.

લિબરો (Libro)

વોલીબોલની રમતમાં ‘ખાસ રક્ષક ખેલાડી’ તરીકે લિબરો રમત રમે છે, જે બ્લોકિંગ, સ્મેશિંગ કે સર્વિસ કરી શકતો નથી. તેમનો ગણવેશ ટીમના બધા ખેલાડીઓ કરતાં અલગ રંગનો હોય છે. તે કેપ્ટન બની શકતો નથી.

દડો મૃત હોય ત્યારે પાછલી હરોળના પોતાની ટુકડીના કોઈ પણ ખેલાડીની જગ્યાએ લિબરો રમતમાં આવી શકે છે. ફેરબદલીની મર્યાદા હોતી નથી પરંતુ એક રેલી પછી ફેરબદલ થઈ શકે છે.

મેચ શરૂ થતાં પહેલાં લિબરો ખેલાડીની નોંધાણી ગુણપત્રકમાં કરવી જોઈએ.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો કમ સામે દોરેલા ચોરસમાં લખો :

- (1) વોલીબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે ?

(A) 16 મીટર	(B) 20 મીટર	(C) 18 મીટર	(D) 21 મીટર	<input type="checkbox"/>
-------------	-------------	-------------	-------------	--------------------------
- (2) નીચેનાં કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી.

(A) ટેનિસ સર્વિસ	(B) સ્મેશિંગ	(C) પાસિંગ	(D) દમ ઘૂંઠવો	<input type="checkbox"/>
------------------	--------------	------------	---------------	--------------------------

(3) વોલીબોલની એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ?

(A) 8

(B) 9

(C) 6

(D) 7

(4) વોલીબોલની રમતમાં સમય કેટલો હોય છે ?

(A) 15 મિનિટ

(B) 20 મિનિટ

(C) 30 મિનિટ

(D) સમય હોતો નથી.

(5) વોલીબોલમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે ?

(A) 2.25 મીટર

(B) 2.50 મીટર

(C) 2.43 મીટર

(D) 3 મીટર

2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં જવાબ આપો :

(1) વોલીબોલના દડાનો ધેરાવો કેટલો હોય છે ?

(2) વોલીબોલમાં અવેજકરણ એક સાથે કેટલા કરી શકાય ?

(3) વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે ?

(4) વોલીબોલમાં સ્મેશિંગના પ્રકારોનાં નામ આપો.

(5) રાખ્યીય વોલીબોલ ફેરેશનની સ્થાપના કયારે થઈ ?

3. નીચેના પ્રશ્નોના સાંબંધિત જવાબ આપો :

(1) સ્મેશિંગના પ્રકારોની સમજૂતી આપો.

(2) પાસિંગના પ્રકારોનાં નામ જણાવી કોઈ એક પ્રકાર વિશે વિસ્તૃત સમજૂતી આપો.

(3) સર્વિસના પ્રકારોનાં નામ જણાવી ટેનિસ સર્વિસની વિસ્તૃત સમજૂતી આપો.



સોફ્ટબોલ અમેરિકાની લોકપ્રિય રમત છે. આ રમતની શોધ શિકાગોની ફરાગુટ બોટ ક્લબ (Farra-gut Boat Club)ના સર્વ્ય જ્યોર્જ ડબલ્યુ હેન્કોકે કરી હતી. રમતની શરૂઆત ઈ.સ. 1887માં થઈ હતી. ઈ.સ. 1920માં જ્યારે આ રમત કેનેડામાં ખુલ્લા મેદાનમાં રમતી થઈ ત્યારથી તેને લોકપ્રિયતા સાંપડી.

ઈ.સ. 1895ના અરસામાં વિવિધ દેશોમાં આ રમત જુદા જુદા નામે રમતી હતી. જેમકે કિટન-બોલ (Kitten Ball), ડાયમણ્ડ બોલ (Diamond Ball), મુશ-બોલ (Mush Ball), ફેટ-બોલ (Fatt Ball), બિગ-બોલ (Big Ball), નાઇટ બોલ (Night Ball), રંજનાત્મક બોલ (Recreational Ball), પ્લેગ્રાઉન્ડ બોલ (Playground Ball) વગેરે.

ઈ.સ. 1900માં સૌપ્રथમવાર આ રમતના અધિકૃત નિયમો જાહેર કરવામાં આવ્યા. ઈ.સ. 1908માં ‘નેશનલ નિયમો’ જાહેર કરવામાં આવ્યા. ઈ.સ. 1908માં ‘નેશનલ એમેચ્યોર પ્લેગ્રાઉન્ડ બોલ ઓસોસિયેશન’ દ્વારા પ્રથમવાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઈ.સ. 1926માં વોલ્ટર હેન્સને, વાય.એમ.સી.એ. અને નેશનલ રિકિઅશન કોંગ્રેસે સોફ્ટબોલ રમતને પ્રમાણભૂત રમત તરીકે જાહેર કરી. ઈ.સ. 1933માં આ રમતના સરળ અને અસરકારક નિયમો ઘડવા માટે આંતરરાષ્ટ્રીય કમિટી બનાવવામાં આવી જેણે આ રમતના પ્રમાણભૂત નિયમો આવ્યા. ઈ.સ. 1950 સુધીમાં આ રમત વધુ પ્રચલિત બની. ઈ.સ. 1956માં મહિલાઓ માટે પ્રથમ વિશ્વ સ્પર્ધા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાઈ. જ્યારે પુરુષો માટે મેક્સિકો શહેરમાં ઈ.સ. 1966માં વિશ્વકક્ષાની પ્રથમ સ્પર્ધા યોજાઈ.


ભારતમાં સોફ્ટબોલ રમતની શરૂઆત કરવાનો યશ રાજસ્થાનના જોધપુર શહેરના શ્રી દશરથમલ મહેતાને ફાળે જાય છે. તેઓ અમેરિકન લાઈબ્રેરીના સર્વ્ય હતા. આથી લાઈબ્રેરીમાંથી સોફ્ટબોલ રમતને લગતાં અમેરિકન પુસ્તકો તથા સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમણે જોધપુરના યુવકોમાં રંજનાત્મક રમત તરીકે સોફ્ટબોલને પ્રચલિત કરી. ઈ.સ. 1954માં આ રમતનો વધુ પ્રચાર-પ્રસાર થયો. દશરથમલ મહેતાએ નવેમ્બર 21, 1961ના દિવસે ‘સોફ્ટબોલ ઓસોસિયેશન’ની સ્થાપના કરી. સોફ્ટબોલ ઓસોસિયેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ઈ.સ. 1967માં પ્રથમ આંતરરાજ્ય સોફ્ટબોલ સ્પર્ધા જોધપુર ખાતે યોજાઈ. જેમાં રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર તથા આંગ્રેપ્રદેશની ટુકડીઓએ ભાગ લીધો હતો. Y.M.C.A.ના પ્રયત્નથી આ રમતનો પ્રસાર ભારતમાં થયો.

ઈ.સ. 1985માં જાપાનમાં યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં ભારતની ટીમે ભાગ લીધો હતો. ઈ.સ. 1997માં ફિલિપાઈન્સમાં પુરુષ તથા સ્ત્રીઓની ટુકડીઓએ ભાગ લીધો હતો.

આ રમતમાં રહેલ રંજનાત્મક તત્ત્વ ઉપરાંત નાનું મેદાન અને ઓછાં ખર્ચાળ સાધનો આ રમતની લોકપ્રિયતા માટે મહત્વની બાબતો ગણી શકાય.

વિશ્વકક્ષાએ આ રમતનું સંચાલન ઈન્ટરનેશનલ સોફ્ટબોલ ફેડરેશન કરે છે. જેની મુખ્ય ઓફિસ લાહોમા (Gklahoma) યુ.એસ.એ.માં છે.

(1) મેદાન : સોફ્ટબોલની રમતનું મેદાન પતંગાકાર હોય છે. ભાઈઓ માટે 225 ફૂટ (68.58 મીટર) તથા બહેનો માટે 200 ફૂટ (60.96 મીટર) વ્યાસના ઘરાવામાં સમતલ અને કોઈ પણ અડચણ વગરની સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેદાન દોરવામાં આવે છે.



(1) સોફ્ટબોલ માટે ખુલ્લા સમતલ મેદાનમાં ધરખૂણા (Home Plate)થી ભાઈઓ માટે 225 ફૂટ (68.58 મીટર) અને બહેનો માટે 200 ફૂટ (60.96 મીટર) જેટલા અંતર સુધીમાં કોઈ પણ જાતની અડયણ હોવી જોઈએ નહિ.

(2) બધી જ વયજૂથના ખેલાડીઓ માટે $60 \text{ ft} \times 60 \text{ ft}$ (18.29 મી \times 18.29 મી)નો સમચોરસ દોરવામાં આવે છે.

(3) સિનિયર અને જુનિયર ભાઈઓ માટે ધરખૂણાથી પીચિંગ ખેટનું અંતર 46 ફૂટ (14.02 મીટર), સિનિયર અને જુનિયર બહેનો માટે 40 ફૂટ (12.19 મીટર) રાખવામાં આવે છે. સબજુનિયર બહેનો માટે પીચિંગ ખેટનું અંતર 35 ફૂટ (10.67 મીટર) રાખવામાં આવે છે.

પીચિંગ ખેટની લંબાઈ 24 ફુટ (60.96 સેમી) તથા પછોળાઈ 6 ફુટ (15.24 સેમી) હોય છે. પીચર્સ ખેટની ધરખૂણાના તરફની ધારના મધ્યબિંદુથી 8 ફૂટ (2.44 મીટર) ત્રિજ્યાનું વર્તુળ દોરવામાં આવે છે.

(4) ધરખૂણા અને પ્રથમ બેઝ વયેની રેખાને સમાંતર 3 ફૂટ (0.91 મીટર)ના અંતરે પ્રથમ બેઝથી ધરખૂણા તરફ 30 ફૂટ (9.14 મીટર) જેટલી લાંબી રેખા દોરવામાં આવે છે. બેટરે ધરખૂણાથી આ 3 ફૂટ રેખાની અંદર દોડી પ્રથમ બેઝ પર પહોંચવાનું હોય છે.

(5) દાવ લેવા આવનાર ખેલાડી (બેટર) માટે બેટર બોક્સની નજીક ખેલાડી બેંચ પૂરી થતાં 76 સેમીની ત્રિજ્યાવાળું 'ડિસ્કલ' બનાવવામાં આવે છે.

(6) દાવ લેનાર ખેલાડીએ સ્લગર સાથે બેટર બોક્સમાં આવી ઊભા રહેવું ફરજિયાત છે. ઘરખૂણા (Home Plate)-ની બંને (ડાબી તથા જમણી) બાજુ, 7 ફૂટ (2.3 મીટર) લંબાઈ તથા 3 ફૂટ (0.91 મીટર) પહોળાઈવાળું 'લેટર બોક્સ' બનાવવામાં આવે છે.


(7) ઘરખૂણા તથા લેટર બોક્સની પાછળ બચાવ પક્ષનાં 'દડો ઝીલનાર ખેલાડી' (કેચર) માટે 10 ફૂટ (3.05 મીટર) લંબાઈ તથા 8 ફૂટ 5 ઈંચ (2.57 મીટર) પહોળાઈવાળું 'કેચર બોક્સ' બનાવવામાં આવે છે.

(8) પ્રથમ બેઝ તથા ત્રીજા બેઝની અંતરેખાથી બહારની બાજુ 8 ફૂટ (2.44 મીટર) દૂર ઘરખૂણા તરફ બેઝરેખાને સમાંતર 15 ફૂટ (4.57 મીટર) લંબાઈનું 'કોચીઝ બોક્સ' બનાવવામાં આવે છે.

(9) ઘરખૂણો (Home Plate) પાંચ ખૂણાવાળી આકૃતિ બને છે. આ પ્લેટની પહોળાઈ 17 ઈંચ (43.18 સેમી), લંબાઈવાળી સીધી રેખા 8 ઈંચ (21.59 સેમી) અને ગ્રાસી રેખા 12 ઈંચ (30.48 સેમી)ના માપની હોય છે.

(10) ઘરખૂણા સિવાયના બીજા બેઝ (પ્રથમ, દ્વિતીય અને તૃતીય બેઝ) 15 ઈંચ (38.10 સેમી) માપના ચોરસ બનાવવામાં આવે છે.

(2) સાધનો : સોફ્ટબોલની રમતમાં નીચેના સાધનોનો ઉપયોગ થાય છે :




(i) સ્લગર (બેટ) : દડાને ફટકારવા સ્લગર (બેટ)નો ઉપયોગ થાય છે. સ્લગર ગોળાકાર દંડા જેવું હોય છે. તેનો આગળનો ભાગ જડો અને પકડ તરફના છેડા તરફ પાતળો હોય છે. સ્લગરની વધુમાં વધુ લંબાઈ 34 ઈંચ હોય છે. સ્લગરનાં જડા ભાગનો વાસ $2\frac{1}{2}$ ઈંચ હોવો જોઈએ. સ્લગર સખત લાકડાનું, નક્કર વાંસ, પ્લાસ્ટિક, ગ્રેફાઈટ, ફાઈબર ગ્લાસ, એલ્યુમિનિયમ વગેરે પદાર્થમાંથી બનાવી શકાય છે. તેની સપાટી સુંવાળી અને ઈજા ન થાય તેવી હોવી જોઈએ. પકડવાળા છેડા પર સલામતી માટે ગોળાકાર મૂઢ રાખવામાં આવે છે. મૂઢ 6 મિમી જેટલી મોટી અને સ્લગરની સપાટીથી કાટખૂણે હોય છે, સ્પર્ધામાં I.S.F. માન્યતા પ્રાપ્ત સ્લગર જ ઉપયોગમાં લેવાય છે.

(ii) દડો (Soft Ball) : સોફ્ટબોલનો દડો ચામડાના કવરનો અંદરથી ટાંકા મારીને સીવેલો હોય છે. દડામાં રેસાઓ, કાર્ડ અને રબરનું મિશ્રણ ઠાંસીને ભરવામાં આવે છે. તેનો વેરાવો $11\frac{7}{8}$ ઈંચથી ઓછો અને $11\frac{1}{4}$ ઈંચથી વધુ હોવો જોઈએ નહિ. તેનું વજન 6 ઔસથી ઓછું અને $6\frac{3}{4}$ ઔસથી વધુ હોવું જોઈએ નહિ. તુંચી ધાર રાખી સીવેલો દડો નિયમસરનો ગણાશે નહિ. દડાનું કવર સિન્થેટિક પદાર્થમાંથી બનાવેલું હોય તોપણ માન્ય રહેશે. સ્પર્ધામાં I.S.F. માન્યતા પ્રાપ્ત દડાનો ઉપયોગ થાય છે.

(iii) ઘરખૂણા પ્લેટ (Home Plate) : આ પ્લેટ રબરની કે બીજી કોઈ અનુકૂળ વસ્તુની બનાવી શકાય છે. તે પાંચ બાજુ વાળી હશે. જેની પહોળાઈ 17 ઈંચ, બેટર-બોક્સને સમાંતર આવતી બાજુની લંબાઈ $8\frac{1}{2}$ ઈંચ અને ગ્રાસી બાજુઓની લંબાઈ 12 ઈંચ રાખવામાં આવે છે.

(iv) પિચર્સ પ્લેટ (Picher's Plate) : દડો નાખનાર માટે લાકડાની કે રબરની પ્લેટ હોય છે. તે 2 ફૂટ લાંબી અને 6 ઈંચ પહોળી હોય છે, તેની ઉપલી બાજુ જમીનની સપાટીએ રાખવામાં આવે છે. તે પુરુષ વિભાગ માટે ઘરખૂણાથી 46 ફૂટ અને બહેનો માટે 40 ફૂટ દૂર રાખવામાં આવે છે.



(v) બેઝ પ્લેટ (Base Plate) : બેઝ પ્લેટ(ધરભૂષા સિવાયની પ્લેટ) 15 ઈંચ ચોરસની હોય છે. તે 5 ઈંચ કરતા વધારે જીવી ન હોવી જોઈએ. આ પ્લેટ કેનવાસ અથવા અનુકૂળ પદાર્થમાંથી બનાવવામાં આવે છે તથા ખૂણા પર મજબૂત રીતે ચોંટાડવામાં આવે છે.

(vi) ગ્લોવ્ઝ : કોઈ પણ ખેલાડી પહેરી શકે છે.

(vii) બૂટ : સૉક્કટબોલ રમતના ખેલાડીઓના બૂટ કેનવાસ કે ચામડાના હોય છે.

(viii) હેડ ગાર્ડ (Helmet OR Mask) : સૉક્કટબોલની રમતમાં બેટર, કેચર, પિચર તથા ધરભૂષા પંચ માથાના રક્ષણ માટે હેડ ગાર્ડ (માસ્ક અથવા હેલ્મેટ)નો ઉપયોગ કરે છે. હેડ ગાર્ડ મોટે ભાગે ચામડા અને જાળીમાંથી બનાવવામાં આવે છે.

(ix) ચેસ્ટ ગાર્ડ (Chest Guard) : આ રમતમાં કેચર ધરભૂષા પંચ તથા મહિલા ખેલાડીઓ ચેસ્ટગાર્ડનો ઉપયોગ કરે છે. ચેસ્ટગાર્ડના ઉપયોગથી ખેલાડીની છાતી તથા પેટના ભાગોને રક્ષણ મળે છે. રૂ, ફોબ, રબર અથવા થરમોકોલ જેવા પદાર્થમાંથી ચેસ્ટગાર્ડ બનાવવામાં આવે છે. તેની ઉપર કેનવાસનું કવર હોય છે અને બાંધવા માટે પણ રાખવામાં આવે છે. ખેલાડીઓ ‘સીન ગાર્ડ’નો પણ ઉપયોગ કરે છે.

(3) કૌશલ્યો : સૉક્કટબોલ રમતનાં મુખ્ય કૌશલ્યો આ પ્રમાણે છે :

શ્રોઠીંગ, કેચિંગ, પીચિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, બાન્ટિંગ, બેઝ રનિંગ. આ પૈકી આપણા અભ્યાસક્રમમાં શ્રોઠીંગ, કેચિંગ અને પીચિંગ કૌશલ્યોનો સમાવેશ થયો છે. જોકે વિદ્યાર્થી જ્યારે રમત રમશે ત્યારે અન્ય કૌશલ્યોનો ઉપયોગ કરશે અને તેની માહિતી મેળવશે. શિક્ષકોએ રમત દરમિયાન આ કૌશલ્યોનો મહાવરો આપવો.

(1) શ્રોઠીંગ : દડો ફેંકવાની કિયામાં સહેજ પણ નબળાઈ કે ચોકસાઈનો અભાવ હોય તો રમતનો આત્મા હણાય છે. દડાને સાચી રીતે યોગ્ય દિશામાં અને પૂરતી ઝડપે ફેંકવો જોઈએ, તે તેની પ્રાથમિક જરૂરિયાત છે. દડો ફેંકવાની વિવિધ રીતો છે. જેવી કે

(i) ઓવરહેડ શ્રોઠીંગ : જમણા હાથ વડે માથા ઉપરથી દડો નાખવા માટે ડાબો હાથ પગ આગળ પવિત્રામાં રાખી, જમણા હાથે બોલ ફેંકવા માટે શરીરના વજનનો ઉપયોગ કરી, ડાબો હાથ આગળ રાખીને જે-તે દિશામાં લાંબે સુધી ફેંકવામાં આવે ત્યારે જમણો પગ આગળ લાવી મૂકવો.

(ii) સાઈડઆર્મ શ્રોઠીંગ : અહીં ફેંકવાની કિયા ઉપરની રીતે જ કરવામાં આવે છે, પરંતુ હાથ માથા ઉપરથી લઈ બોલ નાખવાને બદલે બાજુ ઉપરથી બોલ નાખવામાં આવે છે.

(iii) અન્ડરહેન્ડ શ્રોઠીંગ : બોલ ફેંકવાની કિયામાં બોલને જમણા હાથ વડે પાછળથી આગળ ધૂંટણ પાસે લાવી. ડાબો પગ આગળ રાખી, ડાબો હાથ આગળ રાખી નાખવામાં આવે છે તથા જમણા પગને આગળ મૂકવામાં આવે છે. આ કિયા ઝડપથી તાલમેલ સાથે કરવાની હોય છે.

(2) કેચિંગ : ફટકારાયેલો દડો જમીન પર ટપ્પો પડ્યા વગર ફિદરના હાથમાં જીલાઈ જાય તેને કેચિંગ કહે છે. દાવ લેનાર દ્વારા બેટથી ફટકારાયેલો કે પોતાની ટુકડીના અન્ય કોઈ બેલાડી દ્વારા ફેંકાયેલો દડો ચપળતાથી જીલી લેવાનું કૌશલ્ય રમનાર બેલાડીને બાદ કરવામાં અને વધતા રન અટકાવવામાં અગત્યનું ગણાય છે. આ કૌશલ્યને ફિલ્ડિંગનાં કૌશલ્યોનો એક ભાગ ગણાવી શકાય. દડો જ્યારે હવામાં આવતો હોય ત્યારે તેની ઊંચાઈ અને ગતિ અંગેનું યોગ્ય અનુમાન કરી, યોગ્ય સ્થાને દોરી જવું અત્યંત જરૂરી છે. ઘડી વાર દડો જીલવાની કિયા આગળ કે પાછળ ગતિ કરતાં કરતાં પણ કરવી પડે છે. દડો જીલવામાં શક્ય હોય ત્યાં સુધી બંને હાથનો ઉપયોગ કરવો હિતાવહ છે. બંને હાથની હથેળી નજીક રાખી, બંને હાથના અંગૂઠા અને ટચલી આંગળીઓ જોડાયેલી અને બાકીની આંગળીઓ ખુલ્લી રાખી કપ આકાર બનાવવો, દડાને હાથ સાથે સંપર્ક થતા જ હાથને સહેજ પાછળ તરફ લઈ દડાથી લાગતા ધક્કાને ઓછો કરવો અને દડાને ચપળતાથી પકડી લેવો જોઈએ. ઘડી વાર નીચે નમીને દડો લેવા જતાં કે માથાથી ઉપર જતા દડાને નીચે નમીને કે કૂદીને એક હાથથી જીલી લેવા પ્રયત્ન કરવો પડે છે.

(3) પીચિંગ : દાવ લેનાર ટુકડીમાં બેલાડીઓને બાદ કરવા માટે કિકેટની રમતમાં ‘બોલર’ જેટલું જ મહત્વનું સ્થાન સોફ્ટબોલની રમતમાં પીચરનું ગણાય છે.

પીચિંગ કરનાર બેલાડી પ્લેટ પર ઊભો રહી બેટિંગ કરનાર બેલાડી માટે દડો ફેંકે છે. આ કિયાને પીચિંગ કહે છે. પીચિંગ કરતી વખતે પીચર બંને પગ પીચિંગ પ્લેટ ઉપર રાખી, બંને હાથથી દડો પકડી, બેટિંગ લેનાર બેલાડી તરફ હાથ લંબાવે છે અને દડો ફેંકતી વખતે ડાબો પગ આગળ મૂકી, જમણા હાથ વડે પકડી હાથને પાછળ લઈ જઈ, આગળ લાવી, દડો બેટિંગ કરનારના ધૂંટણ અને ખભા વચ્ચેથી અને ધરખૂણા પરથી પસાર થાય તે રીતે દડો ફેંકે છે.

સોફ્ટબોલમાં દડો નાખવાની કિયા ઘડી જ ચોક્સાઈપૂર્વક કરવાની હોય છે. સાચા અને અસરકારક દડા પીચર ફેંકે તો રમનાર સરળતાથી ફટકો મારી શકતો નથી અને દાવ ગુમાવી બેસે છે. પીચર દડાને ફેંકતાં સ્પીન કરીને કે ઝડપ આપીને રમનારને લુલાવામાં નાખી ફટકો મારવાની કિયામાં અસ્થિરતા લાવવા પ્રયત્ન કરી શકે છે.

(4) સોફ્ટબોલનાં પંચો : સોફ્ટબોલની સ્પર્ધામાં નીચે જગ્ઘાવેલ પંચો ફરજ બજાવે છે :


- (1) ધરખૂણાપંચ (Home Plate Umpire)
- (2) ખૂણાપંચ-2 (Base Umpires)
- (3) ગુણાલેખક (Scorer)

(5) સોફ્ટબોલ રમતના તથા સ્પર્ધાના નિયમો :

બેલાડીઓ અને અવેજીઓ (Players and Substitutes) :

ટુકડી : એક ટુકડીમાં 9 બેલાડીઓ, 6 અવેજી બેલાડીઓ તથા એક વ્યવસ્થાપક (Manager) અને એક ચાહબર (Coach)નો સમાવેશ થાય છે.

ખેલાડીઓનાં સ્થાન અને સ્થિતિ : સોફ્ટબોલની રમતમાં દાવ આપનાર (Fielding) ટુકડીના 9 ખેલાડીઓનાં રમતના મેદાન પર નીચે મુજબના પદ અને સ્થાન ગોઈવવામાં આવે છે. મેદાનના નકશામાં ગાણિતિક અંક દરારા નીચે દર્શાવેલ છે :



- (1) પિચર (Pitcher) પિચર્સ પ્લેટ પાસે સ્થાન લેશે.
- (2) કેચર (Catcher) કેચર બોક્સમાં સ્થાન લેશે.
- (3) ફર્સ્ટ બેઝ્મેન (First Base-man) પ્રથમખૂણા પર સ્થાન લેશે.
- (4) સેકન્ડ બેઝ્મેન (Second Base-man) બીજા ખૂણા પર સ્થાન લેશે.
- (5) થર્ડ બેઝ્મેન (Third Base-man) ત્રીજા ખૂણા પર સ્થાન લેશે.
- (6) શોર્ટ સ્ટોપ (Short Stop) નજીકનો રક્ષક પિચર પ્લેટની નજીક સ્થાન લેશે.
- (7) લેફ્ટ ફિલ્ડર (Left Fielder) ડાબીબાજુનો રક્ષક - ત્રીજા ખૂણાની પાછળના મેદાનમાં સ્થાન લેશે.
- (8) સેન્ટર ફિલ્ડર (Centre Fielder) મધ્યરક્ષક - બીજા ખૂણાની પાછળના મેદાનમાં સ્થાન લેશે.
- (9) રાઇટ ફિલ્ડર (Right Fielder) જમણીબાજુનો રક્ષક પ્રથમ ખૂણાની પાછળના મેદાનમાં સ્થાન લેશે.

લાઈનઅપ શીટ (Line up Sheet) : સોફ્ટબોલ સ્પર્ધાની શરૂઆત થાય તે અગાઉ બંને ટુકડીઓના વ્યવસ્થાપક - રાહબર પોતાની ટુકડીની વિગતો દર્શાવતી લાઈનઅપ શીટ ભરશે અને તેના પર સહી કરશે.

ગણવેશ : સોફ્ટબોલ રમતના ખેલાડીઓએ પોતાની ટુકડી માટે નક્કી કરેલ એક જ રંગનો તથા એક જ પ્રકારનો ગણવેશ ધારણ કરવો જોઈશે. ટુકડીના બધા જ ખેલાડીઓએ એક જ રંગનું ટી શર્ટ અને એક જ રંગનું ફૂલ પેન્ટ અથવા હાફ પેન્ટ (ચક્કી) પહેરવા જોઈશે. ખેલાડીએ બૂટ પહેરવા જોઈએ - બૂટ પહેરવા ફરજિયાત છે. ભાઈઓ માથે ટોપી જ્યારે બહેનો માથે ડેઝેન્ડ પહેરી શકશે. દરેક ખેલાડીના ટી શર્ટના પાછળના ભાગ (પીઠ) પર 15 સેમી (6 ઇંચ) જેટલા મોટા સ્પ્રેડ વંચાય તેવા ખેલાડી નંબર, ટી શર્ટના રંગથી વિરુદ્ધ રંગમાં લખેલા હોવા જોઈએ.

(6) રમત (Play) :

- (1) રમત શરૂ થવાના સમયે દરેક ટુકડીમાં ઓછામાં ઓછા નવ ખેલાડીઓ મેદાન પર હાજર હોવા જોઈએ અને તેમનાં નામ ગુણપત્રકમાં લખાયેલાં હોવાં જોઈએ.
- (2) બંને ટુકડીના કેપ્ટનની હાજરીમાં સિક્કા-ઉછાળ કરી રમતની શરૂઆત કરવામાં આવશે. સિક્કા-ઉછાળમાં વિજેતા ટુકડી પ્રથમ દાવ લેવાનો કે દાવ આપવાની પસંદગી કરશે.
- (3) દાવ લેનાર (બેટિંગ) ટુકડીના ખેલાડીઓ નિયત કરેલ જગ્યાએ બેંચ પર સ્થાન લેશે.
- (4) દાવ આપનાર (ફિલ્ડિંગ) ટુકડીના ખેલાડીઓ મેદાન પર પોતાની સ્થિતિ સંબાળશે. દઢો નાખનાર (પિચર) પિચર્સ પ્લેટ પાસે, દઢો જીલનાર (ક્રેચર્સ બોક્સમાં, પ્રથમ ખૂણારક્ષક (ફસ્ટ બેઝમેન) પ્રથમ બેઝ પર, દ્વિતીય ખૂણારક્ષક (સેકંડ બેઝમેન) બીજા બેઝ પર, તૃતીય ખૂણારક્ષક (થર્ડ બેઝમેન) ત્રીજા બેઝ પર, નજીકનો રોકનાર (શૉર્ટ સ્ટોપ) બેટરની સામે મોં રાખી પિચરની નજીકમાં સ્થાન લેશે. લેફ્ટ ફિલ્ડર ડાબીબાજુના મેદાનમાં, મધ્યનો રોકનાર (સેન્ટર ફિલ્ડર) મેદાનની મધ્યમાં અને જમણી બાજુનો રોકનાર (રાઈટ ફિલ્ડર) જમણીબાજુના મેદાનમાં સ્થાન લેશે.
- (5) સોફ્ટબોલની સ્પર્ધામાં ફૂલ સાતવારીમાં રમાશે. દરેક ટુકડી વારાફરતી સાતવારી રમશે.
- (6) દાવ લેનાર (બેટિંગ) ટુકડીના ત્રણ ખેલાડીઓ બાદ થઈ જાય ત્યારે તે ટુકડીની એકવારી પૂરી થઈ ગણાશે. ત્રણ ખેલાડી આઉટ થાય ત્યાં સુધીમાં પૂરા થયેલા રન નોંધવામાં આવશે.
- (7) જ્યારે ખેલાડી (બેટર) ધરખૂણા પરથી પ્રથમ બેઝ, દ્વિતીય બેઝ અને તૃતીય બેઝ પરથી કમાનુસાર અને નિયમાનુસાર પસાર થઈ વારી પૂરી થાય તે પહેલાં પાછો ધરખૂણા પર પહોંચી જાય ત્યારે એક રન થયેલો ગણાશે.
- (8) દાવ લેનાર (બેટર) ખેલાડીઓને બેટિંગ કરવાનો કમ અગાઉથી નક્કી કરવામાં આવે છે, તે કમાનુસાર બેટિંગમાં બેટર આવશે. બીજી, ત્રીજી ઓમ પછીની એકવારીમાં પણ આ કમ જાળવી રાખવો પડશે. પછીની વારીમાં આગાઉની વારીમાં છેલ્લો (ત્રીજો) ખેલાડી બાદ થયો હોય તે પછીનો બેટર વારીની શરૂઆત કરશે.
- (9) જો કોઈ ટુકડીના ખેલાડીનું અવેજીકરણ કરવાની જરૂર પડે અથવા અવેજીકરણ કરવા માગતા હોય ત્યારે અડ્ધીવારી (Half Inning)માં જ કરી શકાય છે.
- (10) સમગ્ર સ્પર્ધાને અંતે જે ટુકડીના પ્રતિસ્પર્ધી કરતાં વધારે રન થયા હશે તે ટુકડી વિજેતા ગણાશે.
- (11) જો એક ટુકડીએ સાતવારીમાં જેટલા રન કર્યા હશે, તેનાથી વિરુદ્ધ ટુકડીએ છવારીમાં વધુ રન કર્યા હશે, તો તેણે સાતમીવારી રમવાની જરૂર રહેતી નથી. છવારીના રનના આધારે વિજેતા જાહેર થશે.
- (12) જો સાતવારીના અંતે બંને ટુકડીના રન સરખા થાય તો એક-એક વધુ વારી આપવામાં આવશે, અને જેમાં વધુ રન થશે તે વિજેતા ગણાશે. તેમ છતાં ગાંડ રહે તો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી વારાફરતી એક એક વારી રમશે.

(13) આકસ્મિક કારણોસર જેવા કે અંધારું થાય, વરસાદ, આગ અથવા અન્ય કોઈ કારણોસર પંચને રમત બંધ કરવાની ફરજ પડે તેવા સંજોગોમાં ઘરખૂણા પંચ રમત અટકાવી શકશે. આ સ્થિતિમાં બંને ટુકડીમાં પાંચ કે તેથી વધુ વારી પૂરી થઈ હશે તો પાંચ કે એકસરખી વારીના રનના આધારે વિજેતા જાહેર કરી શકશે. બંને ટુકડીની પાંચ કે વધારે રમત બંધ રખાવી પડી હોય ત્યારે જો બંને ટુકડીની પૂરી થયેલી સરખી વારીમાં કુલ રન થાય તો સમગ્ર રમત ફરીથી રમાડવામાં આવશે.

(7) પીચિંગના નિયમો (The Rule of Pitching) :

(1) પિચર પીચિંગ કરતા પહેલાં પોતાના બંને પગ પીચિંગ પ્લેટને અડકે તે રીતે, તથા બંને ખભા પ્રથમ અને તુનીય બેજની સીધમાં રહે તેમ ઊભા રહેવું. બંને હાથ વડે દડો પકડી બંને હાથ બેટર તરફ લંબાવી થોડીક ક્ષણ માટે (ઓછામાં ઓછી એક સેકન્ડ અને વધુમાં વધુ દસ સેકન્ડ સુધી) સ્થિર થવું. પીચિંગ કરવા માટે એક હાથ દડા પરથી ખસેડી લેવો અને બીજા હાથ વડે આગળથી ઉપર તરફ થઈ પાછળ તરફ ગોળાકારે હાથ ફેરવી અન્ડરહેન્ડ સ્થિતિમાં દડો નાખવાનો રહેશે. દડો હાથમાં છૂટે તે સાથે જ પિચર ફક્ત એક પગ બેટર તરફ આગળ મૂકી શકશે.

(2) દડો મીલનાર (કેચર) જો કેર્ચેસ બોક્સમાં ન હોય તો પિચર પીચિંગ કરી શકશે નહિ.

(3) પીચિંગ કરેલો દડો પ્લેટ ઉપરથી તથા બેટરના ખભા અને ધૂંટણ વચ્ચેની ઊંચાઈએથી પસાર થશે તો જ તે સાથો દડો ગાણાશે. અન્યથા ખોટો દડો ગાણાશે.

(4) પિચર પીચિંગ કરતી વખતે તેના હાથ ઉપર, આંગળી પર, પછી, બેનેજ અથવા સ્ટીકર કે ચીપકાવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ કરી શકશે નહિ.

(5) પીચિંગ કરતી વખતે પિચરે દડાને કમરથી નીચેની ઊંચાઈએથી (અન્ડરહેન્ડ) છોડવો જોઈશે, તેમજ હાથનું કંદું તે હાથની કોણી કરતાં ઊંચે જવું જોઈશે નહિ.

(6) જ્યારે બેટર બોક્સમાં પોતાનું સ્થાન લઈ લે અને ઘરખૂણા પંચ પ્લેનો હુકમ આપે ત્યારે પિચરે પીચિંગ કરવાનું રહેશે.

(7) પિચરે પોતાના બંને પગ પીચિંગ પ્લેટને અડકાડી પીચિંગ માટેની સ્થિતિ લઈ લીધી હોય ત્યારે બાદ બેજ તરફ દડો ફેંકી શકશે નહિ.

(8) જ્યારે રમત સ્થગિત કરવામાં આવી હોય તેવા સંજોગોમાં પિચર પીચિંગ કરે તો તે માન્ય ગાણાશે નહિ.

(9) પિચરે પીચિંગ કરવા માટે પોતાના હાથને ઝોલો આપ્યા બાદ ફેરવે અને જો તેના હાથમાંથી દડો છટકી જાય તો બેજ પર ઊભેલા ખેલાડી પોતાની જવાબદારી પર દોડી શકશે.

(10) જો ટુકડીના વ્યવસ્થાપક કે રાહબરને લાગે કે પિચર નિયમાનુસાર પીચિંગ કરતો નથી તો ઘરખૂણાપંચને જાણ કરી પિચરને બદલાવી શકાય છે.

(11) દરેક વારીની શરૂઆતમાં અથવા પિચર દ્વારા બીજા પિચરને બદલવામાં આવે ત્યારે રમત સ્થગિત કરવામાં આવશે. પિચરની ફેરબદ્ધિની પ્રક્રિયા એક મિનિટ દરમિયાન પૂરી થવી જોઈશે.

(8) બેટિંગના નિયમો (The Rules of Batting) :

(1) લાઈનઅપ શીટ તેમજ ગુણપત્રકમાં જણાવેલ કમ પ્રમાણે જ બેટર બેટિંગ કરવા આવશે.

(2) બેટર પ્રમાણભૂત બેટ સાથે જ બેટર્સ બોક્સમાં પ્રવેશ કરશે.

(3) બેટિંગ માટે બેટરે બેટર્સ બોક્સમાં જ સ્થિતિ લેવી.

(4) બેટર બોક્સ કરતી વખતે એક કદમ આગળ લઈ શકશે, પરંતુ બેટર્સ બોક્સની બહાર અથવા ઘરખૂણા પ્લેટને અડકી શકશે નહિ.

(5) જ્યારે કેચર અથવા ફિલ્ડર ફિલ્ડિંગ માટે દડો નાખતા હોય ત્યારે દડાને ફટકારી શકશે નહિ.

(6) પિચરે ખોટો બોલ અથવા ફાઉલ બોલ નાખ્યો હોય ત્યારે બેટરે દડાને ફટકારવો નહિ.

(7) જ્યારે સાચી રીતે પીચિંગ કરેલો દડો સ્ટ્રાઇક જોનમાંથી પસાર થતો હોય ત્યારે બેટરે દડાને ફટકારવો.

(9) નીચેની પરિસ્થિતિમાં બેટર સલામત ગણાશે :

(1) દડો ખોટો મારેલો જાહેર થાય અને બેટર આગળ દોડચો હોય ત્યારે.

(2) દડો ખોટી રીતે રમાયેલો જાહેર થાય ત્યારે.

(3) ફેંકાયેલો દડો રાહભર અથવા વ્યવસ્થાપકથી રોકાય ત્યારે.

(4) બેટરની પાછળ ઊભેલા ઘરખૂણા પંચથી કેચરને કોઈ પણ પ્રકારની અડચણ થઈ હોય ત્યારે.

(5) બેટર દડાને મારવાનું ચૂકી જાય અને દડો તેના શરીરના કોઈ પણ ભાગને અડકે ત્યારે.

(6) અડચણ કરવા બદલ બેટર અથવા બેજ રનરને બાદ કરવામાં અને તેમને પાછા પોતાના ખૂણો પરત જવાનું કહેવામાં આવે ત્યારે.

(10) નીચેની પરિસ્થિતિમાં બેટર બાદ ગણાશે :

(1) ક્રમ પ્રમાણે દાવની વારી આવતાં, પંચ દાવ લેવા માટે હુકમ કરે અને દાવ લેનાર બેટર એક મિનિટની સમયમર્યાદામાં બેટર્સ બોક્સમાં હાજર ન થાય ત્યારે.

(2) ફાઉલ ટીપ ન હોય તેવો ફટકારેલ દડો દાવ આપનાર ખેલાડીથી જીલાઈ જાય ત્યારે.

(3) ગ્રાન્ટ સ્ટ્રાઇક ગણાઈ જાય ત્યારે બેટર બાદ થશે.

(4) બેટરે દડાને ફટકાર્યો હોય ત્યારે પ્રથમ બેજ પર પહોંચે તે પહેલાં દડો પ્રથમ બેજના ખેલાડી પાસે પહોંચે ત્યારે.

(5) બેટરે દડાને ફટકાર્યો હોય અને તે દડો ઊછળો અને દાવ આપનાર ખેલાડી દ્વારા તે કેચ કરી લેવામાં આવે ત્યારે.

(6) દડાને ફટકારવા જતાં કેર્ચર્સ બોક્સની બહાર નીકળી જાય ત્યારે.

(11) રનર આઉટના નિયમો (Rules of Runner Out) :

(1) ફટકારેલ દડો જીલાઈ જાય અને બેજ પર ઊભેલો ખેલાડી બેજ છોડે ત્યારે રનર બાદ થશે.

(2) બેટર દડાને ફટકારી પહેલા બેજ તરફ દોડે અને બેટરના પહેલાં દડો પ્રથમ બેજમેન પાસે પહોંચે જાય ત્યારે રનર બાદ થશે.

(3) ખૂણા પર દોડતાં, આગળ વધતાં, વચ્ચે પસાર થતાં દડાને ઈરાદાપૂર્વક લાત મારે ત્યારે રનર બાદ થશે.

(4) બેજ લાઈન પર દોડનાર ખેલાડી બેજ પર પહોંચે તે પહેલાં બેજમેનના હાથમાં દડો પહોંચે જાય ત્યારે રનર બાદ થશે.

(5) દાવ લેનાર ખેલાડી નિયમાનુસાર બેજને અડક્યો ન હોય ત્યારે રનર બાદ થશે.

(6) ફટકારેલો દડો જીલાઈ જાય ત્યારે આગળ દોડી જનાર ખેલાડી પોતાના ખૂણા પર પરત આવે અથવા આગળના ખૂણો પહોંચે તે પહેલાં દડો ત્યાં પહોંચે જાય અને દાવ આપનાર ખેલાડી બેજલાઈન પર દોડનાર ખેલાડીને દડા સાથે અડકી જાય ત્યારે રનર બાદ થશે.

(7) પિચર પીચિંગ કરે તે પહેલાં, બેજ ઉપર ઊભેલો ખેલાડી દોડવાની શરૂઆત કરે ત્યારે તે બાદ થશે.

(8) બેટિંગ કરનાર ખેલાડી આગળના દોડનાર ખેલાડીને વટાવી આગળ નીકળી જાય તો તેને દડો અડકાડી બાદ કરી શકશે નહિ, પરંતુ તે દોડનારે ત્યાંથી બીજા જ ખૂણો આગળ વધવું હોય તો ફરીથી તે ખૂણાને અડકીને જ આગળ વધી શકશે. જો તેમ ન કરે તો દોડનાર ખેલાડી બાદ થશે.

(12) ખોટો બોલ, ફાઉલ બોલ, તેડ બોલ :

(અ) ખોટો બોલ (No Ball) : પિચર દ્વારા પીચિંગ કરેલો દડો, હોમ પ્લેટ ઉપરથી પસાર ન થવો તથા બેટરના ખભાથી ઉપરની ઊંચાઈએ અથવા ઘૂંઠણથી નીચેની ઊંચાઈએ પસાર થવો, દડો બેટર સુધી પહોંચે તે પહેલાં જમીનને અડકવો, પિચરના હાથમાંથી દડો છૂટે તે દરમિયાન પીચિંગ પ્લેટ પરથી પગ ખસી જવો વગેરે સંજોગોમાં ઘરખૂણાપંચ ખોટો બોલ જાહેર કરશે.

(બ) ફાઉલ બોલ (Foul Ball) :

(1) બેટરે ફટકારેલો દડો ઘરખૂણાથી બહાર લંબાવેલી રેખા�ંની બહારના મેદાનમાં સ્થિર થાય ત્યારે તે ફાઉલ બોલ ગણાશે.

(2) ફટકારેલો દડો પ્રથમ અને ત્રીજા ખૂણાને અડકીને અથવા ખૂણા પર થઈને ખોટો-બહારના મેદાનમાં પડે ત્યારે તે ફાઉલ બોલ ગણાશે.

(3) ફટકારેલ દડો જ્યારે બહારના ખોટા મેદાનમાં પંચ અથવા ખેલાડીને અડકે ત્યારે ફાઉલ બોલ ગણાશે.

(ક) તેડ (મૃત) બોલ (Dead Ball - Not in Play) :

(1) ખોટી રીતે ફટકારેલ દડો તેડ (મૃત) બોલ ગણાશે.

(2) જ્યારે પિચર પીચિંગ કરવા તૈયાર હોય અને બેટર બેટર બોક્સની બહાર નીકળી જાય ત્યારે તેડ બોલ ગણાશે.

(3) જ્યારે Not in Pitch જાહેર કરવામાં આવે ત્યારે તેડ બોલ ગણાશે.

(4) જ્યારે પીચિંગ કરેલો દડો બેટરના શરીર અથવા તેનાં કપડાંઓને અડકે ત્યારે તેડ બોલ ગણાશે.

(5) ફટકારેલ દડો ફાઉલ ઝોનમાં જાય ત્યારે તે તેડ બોલ ગણાશે.

(6) પીચિંગ કર્યા પહેલાં બેઝ ઉપર ઊભેલા ખેલાડી ઢોડવાની શરૂઆત કરે અને તેને બાદ જાહેર કરવામાં આવે ત્યારે તેડ બોલ ગણાશે.

(13) રન ક્યારે થાય ?

(1) ખૂણો દોડનાર અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા ખૂણાને અડકીને ઘરખૂણાને અડકશે તો રન થયો ગણાશે. દોડનાર ઘરખૂણે પહોંચે તે પહેલાં જો ટુકડીનો ત્રીજો ખેલાડી બાદ થાય તો રન ગણાશે નહિ.

(2) બેટ લેનાર પહેલા ખૂણો આવે તે કારણો ખૂણા દોડનારને ફરજિયાત આગળ જવું પડે ત્યારે જો તે આગળના ખૂણો અડક્યા વગર પછીના ખૂણો દોડી જાય અને તે માટે તેને બાદ કરવામાં આવે અને તે ત્રીજો બાદ થનાર હોય તો બીજા દોડનારાઓને પૂરા કરેલા રન પણ ગણાતરીમાં આવશે નહિ.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :

- (1) સોફ્ટબોલની રમતમાં ચેસ્ટગાર્ડનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ? તે શેમાંથી બનાવવામાં આવે છે ?
- (2) સોફ્ટબોલની રમતના શ્રોટિંગ કૌશલ્યની વિગત આપો.
- (3) સોફ્ટબોલનું ડેવિંગ કૌશલ્ય સમજાવો.
- (4) સોફ્ટબોલ રમતમાં પીચિંગ એટલે શું ? તે કઈ રીતે કરવામાં આવે છે ?

2. ટૂંક નોંધ લખો :

- (1) ઘરખૂણા.

- (2) સ્લગર (બેટ).
- (3) દડો (Soft Ball).
- (4) બેઝ પ્લેટ.
- (5) સોફ્ટબોલ ખેલાડીઓનો ગણવેશ.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે વાક્યમાં લખો :

- (1) સોફ્ટબોલ રમતમાં, રમત શરૂ થવાના સમયે દરેક ટુકરીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ ?
- (2) સોફ્ટબોલની સ્પર્ધામાં કુલ કેટલી વારી રમાશે ?
- (3) પિચર પીચિંગ કરતા પહેલાં કઈ રીતે ઊભો રહે છે ?
- (4) સાચું પીચિંગ ક્યારે ગણાય ?
- (5) બેટિંગ માટે બેટરે કઈ સ્થિતિ લેવી જોઈએ ?

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

- (1) સોફ્ટબોલ રમતના મેદાનના સમચોરસનું માપ કેટલું હોય છે ?
 - (A) $40 \text{ ફૂટ} \times 40 \text{ ફૂટ}$
 - (B) $60 \text{ ફૂટ} \times 60 \text{ ફૂટ}$
 - (C) $50 \text{ ફૂટ} \times 50 \text{ ફૂટ}$
 - (D) $55 \text{ ફૂટ} \times 55 \text{ ફૂટ}$
- (2) સ્લગર (બેટ)ની વધુમાં વધુ લંબાઈ કેટલી હોય છે ?
 - (A) 25 ઈંચ
 - (B) 30 ઈંચ
 - (C) 34 ઈંચ
 - (D) 40 ઈંચ
- (3) ઘરભૂષા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે ?
 - (A) પાંચ
 - (B) ચાર
 - (C) ત્રણ
 - (D) બે
- (4) બેઝ પ્લેટ કેટલા ચોરસ ઈંચની હોય છે ?
 - (A) $8 \text{ ઈંચ} \times 8 \text{ ઈંચ}$
 - (B) $10 \text{ ઈંચ} \times 10 \text{ ઈંચ}$
 - (C) $12 \text{ ઈંચ} \times 12 \text{ ઈંચ}$
 - (D) $15 \text{ ઈંચ} \times 15 \text{ ઈંચ}$
- (5) સેન્ટર ફિલ્ડર મેદાનમાં ક્રાંતિકાના સ્થાન લે છે ?
 - (A) બીજા ખૂણાની પાછળના મેદાનમાં
 - (B) બીજા ખૂણા પર
 - (C) ત્રીજા ખૂણા પર
 - (D) પ્રથમ ખૂણા પર
- (6) ખેલાડીએ પોતાના નંબર ક્રાંતિકાના દર્શાવવાના હોય છે ?
 - (A) ટી શર્ટની આગળ
 - (B) ટી શર્ટની ડાબી બાજુ
 - (C) ટી શર્ટની જમણી બાજુ
 - (D) ટી શર્ટ પાછળ
- (7) ખેલાડી કેટલા માપના (સાઈઝ) નંબર ટીશર્ટ પર લખેલા હોવા જોઈએ ?
 - (A) 4 ઈંચ
 - (B) 5 ઈંચ
 - (C) 6 ઈંચ
 - (D) 7 ઈંચ

- (8) સિનિયર ભાઈઓ માટે ઘરખૂણાથી પીચિંગ પ્લેટનું અંતર કેટલું હોય છે ?
(A) 40 ફૂટ (B) 45 ફૂટ (C) 46 ફૂટ (D) 35 ફૂટ

(9) દાવ લેનાર બેલાડી ક્યાં ઊભો રહે છે ?
(A) બેઝ પ્લેટ પર (B) પિચર પ્લેટ પર
(C) બેટર બોક્સમાં (D) ઘરખૂણામાં

(10) પિચર પીચિંગ ક્યારે શરૂ કરે છે ?
(A) ઘરખૂણાપંચ પ્લેનો હુકમ આપે ત્યારે
(B) દાંડા જીલનાર કેચર બોક્સમાં હોય ત્યારે
(C) ટુકડીના વ્યવસ્થાપક સૂચવે ત્યારે
(D) ટુકડીના કેપ્ટન જણાવે ત્યારે

ਪ੍ਰਵਾਨਗ

- સોફ્ટબોલ રમતનું મેદાન દોરી, મેદાન પર ફિલ્ડરોનાં યોગ્ય સ્થાન દર્શાવો.

પ્રાસ્તાવિક


ભારતમાં આજે ભલે સૌથી લોકપ્રિય રમત તરીકે કિકેટ હોય, પણ આપણી રાખ્યી રમત હોકી છે. આ રમતની શરૂઆત ક્યારે થઈ તે અંગે કોઈ ચોક્કસ પુરાવા નથી મળતા, પરંતુ એમ મનાય છે કે પ્રાચીનયુગમાં વાંકી લાકડી અને દાની રમત પર્શીયામાં પ્રચલિત હતી. ત્યાંથી ગ્રીસ અને રોમમાં આ રમતનો પ્રચાર થયો.

હોકી શબ્દ મૂળ ફેન્ચ ભાષાના ‘હોકીટ’ શબ્દ પરથી આવ્યો છે. ‘હોકીટ’નો અર્થ ‘એક છેદથી વળેલી લાકડી’ એવો થાય છે. ભારતમાં આ રમત મહાભારત કાળમાં ‘ગેડી દા’ સ્વરૂપે રમાતી હતી. અમેરિકામાં ‘ઔકા’, જાપાનમાં ‘કાંચી’, સ્કોટલેન્ડમાં ‘શીન્ટી’ નામે ત્યારે ગોળાખાતી રમતો હોકીને મળતી હતી.


જગતને આધુનિક હોકીની રમતની બેટ ઠુંબેને આપી છે. ઈ.સ. 1861માં બ્લેકહીથમાં સૌપ્રથમ હોકી કલબની સ્થાપના થઈ. ઈ.સ. 1875માં ઠુંબેનુમાં પ્રથમ વિશ્વ હોકી ક્રોનિકરન્સનું આયોજન થયું અને તેમાં આ રમતના નિયમો ઘડવામાં આવ્યા. ભારતમાં આધુનિક હોકીની શરૂઆત અંગ્રેજ લશકરી અધિકારીઓએ ઈ.સ. 1885માં કરી. ઈ.સ. 1908માં આ રમત પ્રથમ વખત ઓલિમ્પિક રમતોસ્વવમાં દાખલ કરવામાં આવી. ઈ.સ. 1925-26માં ‘અધિલ ભારતીય હોકી ઓસોસિયેશન’ અસ્તિત્વમાં આવ્યું. ભારતે ઓલિમ્પિક રમતોસ્વવમાં ઈ.સ. 1928 આર્મસ્ટ્રેડમ મુકામે આ રમતમાં ભાગ લઈ સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારથી ઈ.સ. 1956 સુધીની દરેક ઓલિમ્પિક રમતોમાં ભારતે આ રમતમાં સુવર્ણચંદ્રક મેળવીને એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી. આ સમય દરમિયાન ભારતના શ્રી ધ્યાનચંદ કે જેઓ ‘હોકીના જાદુગાર’ તરીકે પ્રખ્યાત થયા હતા તેમણે હોકીની રમતમાં અજોડ ફાળો આપ્યો હતો. ઈ.સ. 1956 પછી ઈ.સ. 1964, ટોકિયો ઓલિમ્પિક અને ઈ.સ. 1980માં મોસ્કો-ઓલિમ્પિકમાં પણ ભારતે હોકીની રમતમાં સુવર્ણચંદ્રકો મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

હોકીનું મેદાન

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના માપવાળું લંબચોરસ આકારનું હોકીની રમત માટેનું મેદાન હોય છે. આંતરરાખ્યી ધોરણોમાં હોકીના મેદાનનું માપ વાર-કૂટ અને ઈચ્ચમાં નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ મેટ્રિક માપ પદ્ધતિ પ્રમાણે મીટર-સેન્ટ્મીટર-મિલીમિટરમાં પણ માપ આકૃતિમાં દર્શાવ્યા છે. મેદાન અંગેની વિગતવાર માપ સહિતની માહિતી દર્શાવ્યા પ્રમાણે છે :



હોકીનું મેદાન (‘મીટર’ તથા ‘વાર’ પ્રમાણેના માપ મુજબ)



શૂટિંગ સર્કલ (આકૃતિ)

(1) હોકીની રમતનું મેદાન 91.40 મીટર (100 વાર) લાંબું અને 55.00 મીટર (60 વાર) પહોળું લંબચોરસ આકારનું હોય છે. મેદાનની સપાઠી સમતલ અને ખાડાટેકરા વિનાની હોવી જોઈએ. મેદાનની લંબાઈવાળા ભાગની રેખાઓને 'બાજુરેખાઓ' (Side Lines) અને પહોળાઈવાળા ભાગની રેખાઓને 'ગોલ રેખાઓ' (Goal Lines) તરીકે ઓળખવામાં આવે છે. મેદાનની આ હદ રેખાઓની પહોળાઈ 7.5 સેન્ટિમીટર (3 ઇંચ) હોવી જોઈએ. તેમજ આ તમામ રેખાઓ મેદાનનો ભાગ ગણવામાં આવે છે. રાખ્યી અને આંતરરાખ્યી કક્ષાએ 'એસ્ટ્રોટર્ફ' જેવા સિન્થેટિક પદાર્થમાંથી તૈયાર કરવામાં આવેલા સપાઠીવાળા મેદાનો ઉપર હોકીની રમત હવે રમાય છે.

(2) મેદાનના મધ્યભાગમાં બંને ગોલરેખાઓને સમાંતર બંને બાજુરેખાઓને જોડતી 'મધ્યરેખા' (Centre Line) દોરવામાં આવે છે. જે મેદાનના બે સરખા ભાગ કરે છે. જે દરેક ભાગને 'આંગણ' તરીકે ઓળખવામાં આવે છે.

(3) બંને ગોલરેખાઓની નજીક 22.90 મીટર (25 વાર)ના અંતરે મેદાનમાં બંને બાજુરેખાઓને જોડતી ગોલરેખાઓને સમાંતર રેખાઓ દોરવામાં આવે છે. જે 25 વારની રેખાઓ તરીકે ઓળખાય છે.

(4) મેદાનના ચારેય ખૂણાઓ નજીકની ગોલરેખા અને બાજુરેખાઓ ઉપર 4.55 મીટર (5 વાર)ના અંતરે 'કોર્નર' માટેનાં નિશાન અંકિત કરવામાં આવે છે.

(5) પ્રત્યેક ગોલ સંભથી 14.63 મીટર (16 વાર)ની ત્રિજ્યા લઈ મેદાનમાં ગોલ સંભની સામે આવે ત્યાં સુધી રેખાઓ દોરવામાં આવે છે. આ રેખાઓને 3.66 મીટર (4 વાર)ની એક સીધી રેખાથી જોડી દેવામાં આવે છે. જેથી અંગ્રેજી 'D' આકારની આકૃતિ બને છે જેને 'સ્ટ્રોટિંગ સર્કલ' અથવા 'શૂટિંગ સર્કલ' તરીકે ઓળખવામાં આવે છે.


(6) પ્રત્યેક ગોલ સંભથી 4.55 મીટર (5 વાર) અને 9.10 મીટર (10 વાર)ના અંતરે બંને ગોલરેખાઓ પર ગોલની બંને બાજુએ 'પેનલ્ટી કોર્નર' માટેનાં નિશાન અંકિત કરવામાં આવે છે.

(7) ગોલરેખાના મધ્યબંદુથી મેદાનમાં 6.40 મીટર (7 વાર)ના અંતરે 'પેનલ્ટી સ્ટ્રોક' બંદું અંકિત કરવામાં આવે છે.

(8) શૂટિંગ સર્કલના સમાંતરે પ્રત્યેક ગોલ સંભથી 19.63 મીટર (21 વાર)ની ત્રિજ્યા લઈ તૂટક રેખાઓવાળાં અર્ધવર્તુળો બંને શૂટિંગ સર્કલની બહારની બાજુએ મેદાનની અંદર દોરવામાં આવે છે. તેમજ મેદાનના ચારેય ખૂણો 1.20 થી 1.50 મીટરની ઊંચાઈવાળા ધ્વજસંભ રોપી તેના પર 30 MM × 30 MMની ઝંકીઓ ધ્વજ લગાડવામાં આવે છે.

ગોલ

બંને ગોલરેખાઓ (Goal Lines)ના મધ્યબિંદુની બંને બાજુએ 1.83 મીટરનું અંતર માપી, અંદરની બાજુએથી 3.66 મીટર (4 વાર) અંતર રહે તેમ ગોલરેખાને સ્પર્શનિ બહારની બાજુએ ગોલ સંભ રોપવામાં આવે છે. આ ગોલ સંભની ઉંચાઈ 2.14 મીટર હોય છે. બંને ગોલ સંભ ઉપર 7.5 સેન્ટિમીટર પહોળો અને 5.1 સેન્ટિમીટર જાડો લંબચોરસ આકાર ધરાવતો 'કોસબાર' ફિટ કરવામાં આવે છે. ગોલ સંભ અને કોસબાર સફેદ રંગથી રંગવામાં આવે છે.




ગોલ તથા ગોલ બોર્ડ્સ

બેંક બોર્ડ્સ (Goal Boards)

દરો ગોલમાં ગયા પણી તેને રોકવા માટે ગોલની પાછળા 'બેંક બોર્ડ' મૂકવામાં આવે છે. જેની લંબાઈ 3.66 મીટર, પહોળાઈ 1.22 મીટર અને ઉંચાઈ 46 સેન્ટિમીટર હોય છે. તેમજ અંદરની બાજુએ બોર્ડને ડાર્ક કલરથી રંગવામાં આવે છે.

નેટ

ગોલ પાછળ જતા દડાને રોકવા માટે 45 મિલિમીટર પહોળાઈ રહે તે પ્રમાણેની ગુંઘણીવાળી જળીવાળી નેટ ગોલ સંભ અને ગોલ બોર્ડસની પાછળની બાજુએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે.



નેટ

સાધનો

હોકી સ્ટિક (Hockey Stick) :

હોકી સ્ટિકનો ડાબી બાજુનો નીચેનો વળાંકવાળો ભાગ 'સપાટ' (ચપટો) હોવો જોઈએ. સ્ટિકની લંબાઈ 75 થી 93 સેન્ટિમીટર (30 થી 37 ઈંચ) જેટલી તથા વજન 12 ઔંસથી ઓછું નહિ અને 28 ઔંસથી વધારે ન હોવું જોઈએ. તેમજ 5.08 સેન્ટિમીટર (2 ઈંચ)ના પરિધવાળી રિંગમાંથી સ્ટિક પસાર થવી જોઈએ.



હોકી સ્ટિક

સ્ટિકની બનાવટમાં નીચેનો ભાગ લાકડાનો તથા ચપટો અને ગોળાકાર હોય છે. તેમજ સ્ટિકમાં કોઈ પણ જગ્યાએ ધાતુનો ઉપયોગ થઈ શકતો નથી. સમગ્ર સ્ટિક લાકડાના બે ટુકડાઓને જોડીને બનાવવામાં આવતું હોવાથી તેમાં લચીલાપણું હોય છે.

દડો (Ball)

દડાનું ઉપરનું પડ સફેદ રંગનું, ચામડાનું અથવા સિન્થેટિક પદાર્થનું બનેલું હોય છે. દડાનો ધેરાવો (પરિધ) 22.4 સેન્ટિમીટર ($8\frac{13}{16}$ ઈંચ)થી ઓછો નહિ અને 23.5 સેન્ટિમીટર ($9\frac{1}{4}$ ઈંચ)થી વધારે હોવો જોઈએ નહિ. જગ્યારે દડાનું વજન 156 ગ્રામ ($5\frac{1}{2}$ ઔંસ)થી ઓછું નહિ અને 163 ગ્રામ ($5\frac{3}{4}$ ઔંસ)થી વધારે હોવું જોઈએ નહિ.



દડો

ગોલકીપરનાં પેડ્સ અને ગ્લોવ્સ (Pads and Gloves)

રમત દરમિયાન ગોલકીપર પોતાના પગના રક્ષણ માટે ખાસ બનાવટના વિશિષ્ટ આકારનાં પેડ બંને પગે, તેમજ હથેળીથી દડાને રોકતી વખતે હથેળીને ઈજા ન થાય તે માટે ગ્લોવ્સ પહેરી શકે છે. ગોલકીપરને શારીરિક ઈજાઓ ન થાય તે માટે આવા સંરક્ષણ માટેનાં માન્ય સાધનોનો ઉપયોગ કરવાની દૂટ છે.

ચેસ્ટગાર્ડ (Chest Guard)

ઉછળતો દરો રોકતી વખતે ગોલકીપરને છાતીમાં ઈજા ન થાય તે માટે 'ચેસ્ટગાર્ડ' પહેરી શકે છે.

હેલ્મેટ : ઊંચો ઉછળતો દરો ગોલકીપરને માથામાં ઈજા ન પહોંચાડે તે માટે હેલ્મેટ પહેરી શકે છે.


સીનગાર્ડ (Sinn Bon Garde)

રમત દરમિયાન ખેલાડીઓના પગના નળામાં સામેની ટુકડીના ખેલાડીની હોકી સ્ટિક અગર દરો વાગવાની સંભાવનાઓ હોય છે. આથી પગના નળાના હાડકાના રક્ષણ માટે નળાના આગળના ભાગ પર સીનગાર્ડ પેડ બાંધી શકે છે. તેમજ પગમાં નળાના ભાગની ઉપર સુધી પહોંચે તેવા લાંબા મોજા પહેરે છે.

ખેલાડીઓ

પ્રત્યેક ટુકડીમાં 16 ખેલાડીઓ હોય છે. જે પૈકી સ્પર્ધા દરમિયાન 11 ખેલાડીઓ રમત દરમિયાન 11 ખેલાડીઓ રમતના મેદાનમાં ભાગ લે છે, જ્યારે બાકીના 5 ખેલાડીઓ અવેજી તરીકે રહે છે. રમત માટે ભાગ લેનાર 11 ખેલાડીઓ રમત શરૂ થતી વખતે મેદાનમાં ચોક્કસ જગ્યાએ સ્થાન લે છે. ખેલાડીઓ રમત શરૂ થતા પૂર્વ મેદાનમાં જે સ્થળે સ્થાન લીધું હોય તેના પરથી તેની ઓળખ થાય છે જે નીચે પ્રમાણે છે :

(1) ગોલકીપર (G.K.) (2) રાઈટ ફૂલ બેક (R.B.) (3) લેફ્ટ ફૂલ બેક (L.B.) (4) રાઈટ હાફ બેક (R.H.B.) (5) સેન્ટર હાફ બેક (C.H.B.) (6) લેફ્ટ હાફ બેક (L.H.B.) (7) આઉટ સાઈડ રાઈટ (O.R.) (8) ઈન્સાઈડ રાઈટ (I.R.) (9) સેન્ટર ફોર્વર્ડ (C.F.) (10) ઈન્સાઈડ લેફ્ટ (I.L.) (11) આઉટ સાઈડ લેફ્ટ (O.L.).



મેદાનમાં ખેલાડીઓનાં સ્થાન

રમતનાં કૌશલ્યો

દ્રિષ્ટિલંગ :

હોકીની રમતમાં આ પાયાનું કૌશલ્ય છે. આ કૌશલ્યના મહાવરાથી દરો ઉપર કાબૂ આવે છે અને ઝડપથી દરો સાથે ગતિ કરી શકાય છે.

ગોલકીપર પેડ્સ
અને શૂઝ

સંપૂર્ણ સાધનસંજ્ઞા ગોલકીપર
સામેથી અને બાજુમેથી જોતાં




શૈક્ષણિક પગથિયાં

સ્ટિકની પકડ : ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છોટેથી તેનો સપાટ ભાગ ડાબી તરફ રહે તે શરીરે પકડવી. જમણા હાથ વડે સ્ટિકને મધ્યમાંથી પકડવી. ડાબા હાથની પકડ મજબૂત, જ્યારે જમણા હાથની પકડ ઢીલી રહેશે, જેથી તે હાથમાં સ્ટિક ફરી શકે.


શરીરની સ્થિતિ : બંને પગ યોંય પ્રમાણમાં આગળ-પાછળ ખુલ્લા, શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલું અને નજર દા પર રાખવી.

દાની સ્થિતિ : દાંડો જે પગ આગળ હોય તેનાથી 9 ઠંચથી 12 ઠંચ જેટલો આગળ તરફ રાખવો.

દ્રિષ્ટિંગની કિયા : એક પગ આગળ મૂકી તેનાથી વિરુદ્ધ દિશામાં આગળ તરફ દાને 45° અંશને ખૂણે ટપારવો. તરત જ બીજો પગ આગળ મૂકી, દાને રોકી, વિરુદ્ધ દિશામાં 45° અંશને ખૂણે આગળ તરફ ટપારવો. આ પ્રમાણે ટપારતાં આગળ વધ્યું.



સ્ટ્રેઇટ સ્ટિક રીવર્સ સ્ટિક દ્રિષ્ટિંગ સ્ટિક પકડ



ડાબો પગ

જમણો પગ

હિટિંગ (દાને ફટકો મારવો)

આ કૌશલ્યના વિવિધ પ્રકારો છે, જેમકે સ્ટ્રેઇટ હિટ, રીવર્સ હિટ, હિટ ઓન રોંગ ફૂટ વગેરે.

સ્ટ્રેઇટ હિટ

અહીં આપણે સ્ટ્રેઇટ હિટ વિશે જોઈએ. આ કિયામાં દાને ફટકો મારીને આગળ મોકલવાનો હોય છે.

શૈક્ષણિક પગથિયાં


સ્ટિકની પકડ :

સ્ટિકના ઉપરના છેડે 4 ઠંચથી 5 ઠંચ જેટલી જગ્યા છોડી સ્ટિકને ડાબા હાથ વડે પકડવી. ડાબા હાથ સાથે જ નીચેથી જમણા હાથ વડે સ્ટિકને પકડવી. સ્ટિકનો સપાટ ભાગ ડાબી બાજુ રહે તે પ્રમાણે મજબૂત પકડ લેવી.



સ્ટ્રેઇટ હિટ માટે સ્ટિકની પકડ

શરીરની સ્થિતિ : ડાબો પગ આગળ મૂકવો. શરીરનું બધું વજન ડાબા પગ પર આપવું. જમણો પગ ડાબા પગાની એડીથી સહેજ પાછળ તરફ, (માત્ર પંચો જમીનને સ્પર્શ તે પ્રમાણે) રાખવો. શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલું, નજર દા તરફ, ડાબો ખબો જે તરફ દાંડો ફટકારવાનો હોય તે તરફ રાખવો.



સ્ટ્રેઇટ હિટ - પગ



જમણો પગ

દડાની સ્થિતિ : દડો ડાબા પગના પંજાની આગળ 6 ઈંચથી
9 ઈંચ જેટલો દૂર રાખવો.


કિયા : સ્ટિકને જમણી તરફ પાછળ સીધી લઈ જઈ તે જ
પ્રમાણે આગળ લાવી, સ્ટિકના મધ્યભાગમાંથી કંડાના બળથી
દડાને ફટકો મારવો. આ કિયા દરમિયાન સ્ટિક ખંબાથી ઊંઘે
જવી જોઈએ નહિ.

અનુગામી કિયા : સ્ટિકને સીધી, દડો જે તરફ ફટકાર્યો છે તે
દિશામાં લઈ જવી. શરીર ફટકારેલા દડાની દિશામાં ફેરવવું.

સ્ટોપિંગ (દડાને અટકાવવો)

રમતમાં આ કૌશલ્ય ખૂબ અગત્યનું છે.
આ માટે આત્મવિશ્વાસ ખાસ જરૂરી છે. આ
કૌશલ્યના વિવિધ પ્રકારો છે, જેમકે સામેથી દડાને
રોકવો, ડાબી બાજુથી દડાને રોકવો, જમણી
બાજુથી દડાને રોકવો વગેરે. અહીં આપણે દડાને
સામેથી કઈ રીતે રોકી શકાય તે વિશે જોઈએ.

સ્ટિકની પકડ : ડાબા હાથ વડે સ્ટિકને
ઉપરના છેઢે પકડવી અને જમણા હાથે સ્ટિકને
ઉપરના છેઢે મધ્યમાંથી પકડવી. સ્ટિકનો સપાટ
ભાગ આગળ સામેની બાજુએથી આવતા દડા
તરફ રાખવો.



હિટ માર્યા પહેલાંની, દડાને સ્પર્શ કરવાની અને હિટ માર્યા
પણીની વિભિન્ન સ્થિતિઓ




શરીરની સ્થિતિ : શરીરનું વજન બંને પગ ઉપર સરખું રહે તેમ પગને ફુદરતી રીતે ખુલ્લા રાખવા. શરીર કમરમાંથી આગળ તરફ
જૂકેલું, ડાબા હાથની કોણી દડા તરફ રહે તે રીતે, જમણો ઘૂંટણ વચ્ચે સહેજ આગળ તરફ રાખવો. નજર સામેથી આવતા દડા તરફ રાખવી.

કિયા : દડો નજીક આવે ત્યારે બંને પગના પંજા આગળ, સ્ટિકનો સપાટ ભાગ દડા તરફ રહે અને સ્ટિક ઉપરથી આગળ તરફ સહેજ
જૂકેલી રહે તે રીતે સ્ટિકના સપાટ ભાગ વડે દડો રોકવો. જેવો દડો સ્ટિકને સ્પર્શ કે તરત જ જમણા હાથ વડે સ્ટિકને સહેજ પાછળ તરફ
ખેંચવી જેથી દડો સ્ટિકને અથડાઈને નજીક જ અટકી જાય.

પુશિંગ : સ્ટ્રેઇટ પુશ (દડાને ધકેલવો)

આ કૌશલ્યમાં દડાની પાછળ સ્ટિક
મૂડી સ્ટિક વડે દડાને આગળ ધકેલવામાં
આવે છે. પુશના વિવિધ પ્રકારો છે. જેમકે
સ્ટ્રેઇટ પુશ, રિવર્સ પુશ, સ્લીપ પુશ વગેરે.
અહીં આપણે દડાને આગળ તરફ કઈ રીતે
ધકેલવામાં આવે છે તે શીખીએ.

સ્ટિકની પકડ : ડાબા હાથ વડે
સ્ટિકને ઉપરના છેઢેથી પકડવી અને જમણા
હાથથી સ્ટિકને મધ્યમાંથી સ્ટિકનો સપાટ
ભાગ ડાબી બાજુ રહે તે રીતે પકડવી.



શરીરની સ્થિતિ : જે તરફ દડાને ધકેલવાનો હોય તે તરફ પંજો રહે તે રીતે ડાબો પગ આગળ મૂકવો. જમણો પગ ડાબા પગની પાછળ આશરે દોઢથી બે ફૂટ જેટલો દૂર લગભગ બંને પગ એકબીજાને 45° ને ખૂણો રહે તે પ્રમાણે મૂકવો. શરીર કમરમાંથી દડાની દિશામાં સહેજ ઝૂકેલું, નજર દડા તરફ, શરીરનું બધું વજન દડો પુશ કરતાં પહેલાં જમણા પગ ઉપર અને પુશ કર્યા બાદ સંપૂર્ણ વજન ડાબા પગ ઉપર લઈ જવું, નજર દડા તરફ રાખવી.

દડાની સ્થિતિ : દડો ડાબા પગના પંજાની જમણી બાજુએ આશરે 9 ઠંચથી 12 ઠંચ જેટલો દૂર રાખવો.

કિયા : દડાને પુશ કરવામાં ત્રણ પ્રકારનું બળ એકસાથે કામ કરે છે :

(1) હાથ વડે સ્ટિકથી દડાને આગળ તરફ ધક્કો આપવો.

(2) શરીરનું વજન જમણા પગ ઉપરથી ડાબા પગ ઉપર લઈ જવું.

(3) શરીરને દડા તરફથી ફેરવી જે દિશામાં દડો ધકેલીએ તે દિશામાં ફેરવવું. દડાની પાછળ સ્ટિકના નીચેના વળાંકવાળા સપાટ ભાગનો મધ્યભાગ રહે તે રીતે સ્ટિકને મૂકી ઉપર્યુક્ત ત્રણે બળને એકસાથે કામે લગાડી, દડો આગળ તરફ ધકેલવો.

અનુગામી કિયા : દડાને જે દિશામાં ધકેલ્યો હોય તે તરફ સ્ટિકને સીધી લંબાવવી. શરીર દડાની દિશામાં સીધું કરવું.

ફ્લાંકિંગ (સ્ટ્રેઇટ ફ્લાંક) :

દડાને સામાપ્નકણના બેલાડીની સ્ટિક ઉપરથી થઈને એવી રીતે ઉછાળીને

ફ્લાંકવામાં આવે છે કે દડો જમીન પર પડ્યા પદ્ધી ગબડતો રહે છે.

સામાન્ય રીતે આ કિયામાં દડાને ઘૂંટણથી છાતી જેટલી ઊંચાઈએ ઉછાળવામાં આવે છે. આ કિયાને ‘ફ્લાંક’ કહેવામાં આવે છે. ફ્લાંકિંગના વિવિધ પ્રકારો છે. જેમકે સ્થિર દડાને ફ્લાંક કરવો, ગબડતા દડાને ફ્લાંક કરવો, દડાને સામી બાજુથી ફ્લાંક કરવો, દડાને રિવર્સ ફ્લાંક કરવો વગેરે. અહીં આપણે સ્ટ્રેઇટ ફ્લાંક વિશે જોઈએ.

સ્ટિકની પકડ : ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડે પકડવી જ્યારે જમણા હાથની પકડ સ્ટિકના મધ્ય ભાગ કરતાં સહેજ ઉપરથી લેવી. સ્ટિકનો સપાટ ભાગ જે તરફ દડો મોકલવાનો હોય તે દિશામાં રાખવો.

શરીરની સ્થિતિ : જે દિશામાં દડો ફ્લાંક કરવાનો હોય તે તરફ પંજો રહે તે રીતે ડાબો પગ આગળ મૂકવો. જમણો પગ ડાબા પગની પાછળ 1.5 ફૂટથી 2 ફૂટ જેટલા અંતરે મૂકવો. શરીરનું વજન $\frac{3}{4}$ ભાગ ડાબા પગ ઉપર, જ્યારે $\frac{1}{4}$ ભાગ જમણા પગ ઉપર રહેશે. શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલું રાખવું અને નજર દડા તરફ રાખવી.

દડાની સ્થિતિ : દડો ડાબા પગથી સહેજ આગળની બાજુએ 18 ઠંચથી 24 ઠંચ જેટલો બાજુમાં દૂર મૂકવો.


કિયા : સ્ટિકને દડાની પાછળ, સપાટ ભાગ દડા નીચે ત્રણો રહે તેમ મૂકવી. ડાબા હાથ વડે સ્ટિકને નીચે તરફ ધકેલવી. તે જ સમયે જમણા હાથ વડે સ્ટિકને ઉપરની બાજુએ ખેંચવી.

અનુગામી કિયા : દડો જે દિશામાં જાય તે તરફ સ્ટિકને લંબાવવી. જેથી દડાની દિશા બદલાય નહિ.

સ્કૂપિંગ (સ્ટ્રેઇટ સ્કૂપ)

દડાને સામાપ્નકણના બેલાડીના માથા કરતાં વધારે ઊંચો ઉછાળી દૂર પોતાના બિલ્બુ તરફ હવામાં દડો મોકલી આપવાની કિયાને સ્કૂપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પુશ કે હિટ દ્વારા પોતાના બિલ્બુ તરફ દડો મોકલી ન શકાય તેમ હોય ત્યારે આ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે.

વિવિધ રીતે સ્કૂપિંગ થાય છે : જેમકે (1) સ્ટ્રેઇટ સ્કૂપ (2) રિવર્સ સ્કૂપ (3) પુશ સ્કૂપ ઘણો ભાગે સ્ટ્રેઇટ ફ્લાંકને મળતું આવે છે. જ્યારે



ફ્લાંક કરતાં પહેલાંની, કરતી વખતની અને કર્યા પછીની વિવિધ સ્થિતિઓ

સ્રેટ સ્કૂપ જુદી રીતે કરવામાં આવે છે. અહીં આપણે સ્રેટ સ્કૂપ વિશે જોઈએ.

સ્ટિકની પકડ : ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડે પકડવી, જ્યારે જમણા હાથ વડે સ્ટિકના મધ્ય ભાગમાં પકડ લેવી. સ્ટિકનો સપાટ ભાગ ઉપરની દિશામાં રહે તેમ દડા નીચે છેડાનો ભાગ રાખવો.

શરીરની સ્થિતિ : જે દિશામાં દડો મોકલવાનો હોય તે તરફ પંજે રહે તે પ્રમાણે જમણો પગ આગળ મૂકવો. ડાબો પગ જમણા પગની બાજુમાં પાછળ લગભગ 18 ઈંચથી 24 ઈંચ જેટલો દૂર મૂકવો. શરીરનું મોટા ભાગનું વજન જમણા પગ ઉપર રહેશે. જમણો પગ ઘૂંઠણમાંથી વળેલો, જ્યારે ડાબો પગ કુદરતી રીતે વળેલો રાખવો. નજર દડા તરફ રાખવી.




દડાની સ્થિતિ : જમણા પગના પંજાની લાઈનમાં ડાબી બાજુએ 6 ઈંચથી 9 ઈંચ જેટલો દૂર દડો મૂકવો.

કિયા : પ્રથમ દડાની પાછળની બાજુએ સ્ટિકને દડાની નીચે જાય તે પ્રમાણે મૂકવી. ડાબા હાથ વડે સ્ટિકને નીચે તરફ ધકેલી તે જ સમયે હાથ વડે સ્ટિકને ઉપર તરફ બેંચવી.

અનુગામી કિયા : સ્ટિક ખભાથી ઊંચી કરી ઉપર તરફ ન જાય તે રીતે તેને દડાની દિશામાં લંબાવવી અને શરીર સીધું કરવું. ટેક્લિંગ

આ કૌશલ્યમાં સામા પક્ષના ખેલાડી પાસેથી દડા મેળવવા વિવિધ રીતો અપનાવાય છે. જો દડો કોઈ સંઝોગોમાં પડાવી ન લેવાય તેમ હોય તો તેની ગતિને અવરોધવા પ્રયત્ન કરવામાં આવે છે અને એ રીતે પોતાના ખેલાડીઓને યોગ્ય સ્થાને ગોઠવાઈ જવાની તક આપવામાં આવે છે. ટેક્લિંગના વિવિધ પ્રકારો છે. જેમકે શેડો ટેક્લિંગ, લંજ ટેક્લિંગ, ટેક્લિંગ એઝ લાસ્ટ ટીફેન્ડર ઈત્યાદિ.



શેડો ટેક્લિંગ

લંજ ટેક્લિંગ

શેડો ટેક્લિંગ : આ પ્રકારના ટેક્લિંગમાં બચાવપક્ષનો ખેલાડી આકમણ કરનાર ખેલાડી સાથે દોડી, તેના માર્ગમાં અવરોધ કરે છે અને જ્યારે તક મળે ત્યારે દડો તેની પાસેથી ઝૂંટવી લેવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણેની કિયા તેની ટુકડીના ઈતર બિલ્બુઓ યોગ્ય સ્થાને ગોઠવાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રાખી સામાપક્ષના ખેલાડીની ગતિને ઢીલમાં નાખવા પ્રયત્ન કરે છે.

લંજ ટેક્લિંગ : આ કૌશલ્યમાં દડો સામાપક્ષના ખેલાડી પાસેથી પડાવવા એક કદમ આગળ તરફ જઈ ફક્ત ડાબા હાથ વડે સ્ટિકને આગળ તરફ લંબાવી સામાપક્ષનો ખેલાડી દડાને ફટકો મારવા સ્ટિક ઉગામે તે વખતે દડાને પડાવી લેવામાં આવે છે.

ટેક્સિંગ એડ લાસ્ટ ડિફેન્ડર : જ્યારે બચાવ કરનાર ખેલાડી પાછળ ગોલકીપર સિવાય પોતાના પક્ષનો કોઈ પણ બિલ્બુ નહિ હોય, ત્યારે સામેથી આકમણ કરવા દરો લઈ આવતા ખેલાડી સાથે બચાવપક્ષનો ખેલાડી પોતે ઈચ્છતો હોય તે બાજુ ખુલ્લી જગ્યા આપે છે. જેથી આકમણ કરનાર તે તરફ થઈ દરો લઈ આગળ વધવા લલચાય છે. આ સમયે બચાવ કરનાર ખેલાડી આકમણ કરનાર ખેલાડીની સાથે દોડવાનું શરૂ કરી તક મળતાં તેની પાસેથી દરો છીનવી પોતાના કાબૂમાં લે છે. ખાસ કરીને ખેલાડી દરાને ફટકો મારવા સ્ટિક ઉગામે ત્યારે અથવા પાસ કરવા પ્રયત્ન કરે ત્યારે દરો છીનવી લેવા પ્રયત્ન કરે છે.

ડોઝિંગ

સામાપક્ષના ખેલાડીને ભુલાવામાં નાખી, છેતરીને, દરો લઈને આગળ વધવાની કિયાને ડોઝિંગ કહેવામાં આવે છે. આ કિયામાં જડપ અને ચપળતા ખાસ જરૂરી છે. ડોઝિંગના વિવિધ પ્રકારો છે.

ડોઝિંગ ઓન ડિફેન્ડર્સ રાઇટ સાઈડ : સામાપક્ષના એક ખેલાડીને છેતરીને તેની જમણી બાજુએથી દરો લઈ આગળ નીકળી જવું. આ કૌશલ્યમાં જ્યારે સામા પક્ષનો ખેલાડી સામે આવે ત્યારે જેની પાસે દરો છે, તે ખેલાડી જમણી તરફ જવાનો અભિનય કરે છે, આથી સામેનો ખેલાડી તે તરફ દોરવાય છે. આ વખતે એકદમ તે જડપથી દરાને પોતાની ડાબી બાજુ તરફ ટપારી, શરીરનું વજન અને ઝોક ડાબી તરફ આપી, દરો સામા ખેલાડીની જમણી તરફથી લઈ, સામેના ખેલાડીને છેતરીને આગળ વધી જાય છે.

એ જ પ્રમાણે સામે બે ખેલાડી હોય તો બેવાર દરાને પોતાની ડાબી બાજુ ટપારી, તેમને છેતરી તેમની જમણી તરફ થઈને આગળ વધી જાય છે.

ડોઝિંગ ઓન ડિફેન્ડર્સ લેફ્ટ સાઈડ : સામાપક્ષના એક ખેલાડીને છેતરીને તેની ડાબી બાજુ થઈ, દરો લઈ આગળ વધવું. જ્યારે સામા પક્ષનો ખેલાડી સામે આવે ત્યારે દરો લઈ જનાર ખેલાડી પોતાની ડાબી તરફ જવાનો દેખાવ કરે છે. આથી સામેનો ખેલાડી તે તરફ દોરવાય છે. આ વખતે અચાનક તે દરાને પોતાની જમણી બાજુએ સ્ટિકને રિવર્સ કરી, ટપારી, શરીરનું વજન અને ઝોક જમણી બાજુ આપી, સામેના ખેલાડી ડાબી બાજુ થઈને જડપથી આગળ નીકળી જાય છે.

એ જ પ્રમાણે બે ખેલાડી હોય તો દરાને બેવાર જમણી બાજુ ટપારી તેમને છેતરીને આગળ વધે છે.

પાસિંગ



પોતાના બિલ્બુને વિવિધ પ્રકારની રીતો દ્વારા દરો પાસ કરવાની કિયાને પાસિંગ કહેવામાં આવે છે. પાસિંગના વિવિધ પ્રકારો છે :

શું પાસ : જ્યારે સામાપક્ષના બે ખેલાડીઓ વચ્ચે થઈને પોતાના બિલ્બુને દરો આપી શકાય તેમ હોય ત્યારે દરો સીધો પોતાના બિલ્બુ તરફ મોકલવામાં આવે છે.

રિટર્ન પાસ : જ્યારે સામાપક્ષનો ખેલાડી સામે આવે ત્યારે પોતાના બિલ્બુને પાસ આપવામાં આવે છે. જે બિલ્બુ તરફ દરો પાસ કર્યો હોય તે બિલ્બુ સામાપક્ષના ખેલાડીની પીઠ પાછળ થઈને દરો જાય તે પ્રમાણે, જેણે પાસ કર્યો હતો તે બિલ્બુ તરફ દરાને ફરીથી પાસ કરે છે.

બેક પાસ : જ્યારે આગળ દરો લઈને જઈ શકાય તેમ ન હોય ત્યારે પાછળ આવતા પોતાના બિલ્બુ તરફ દરાને સમાંતર પાસ કરવામાં આવે તેને બેક પાસ કહેવામાં આવે છે.

પેરેલલ પાસ : ખાસ કરીને રાઇટ આઉટ કે લેફ્ટ આઉટ સાઈડના ખેલાડીઓ દરો લઈને સામાપક્ષની ગોલ લાઈન નજીક પછોંચી જાય તો ગોલ કરી શકાય એ દસ્તિએ પોતાના સમાન અંતરે દોડતા બિલ્બુને સ્ટ્રાઇકિંગ વૃત્ત (શૂટિંગ સર્કલ) તરફ દરાને સમાંતર પાસ કરીને મોકલી આપે છે. જેથી તે ગોલ કરી શકે.



ફોરવર્ડ પાસ

પોતાની આગળ દોડતા બિલ્બુ તરફ સીધો દડો ઘકેલીને આગળ તરફ મોકલી આપવામાં આવે છે, જેથી તે દડો લઈને આગળ વધી શકે.

બુલી

આ કૌશલ્યમાં સામસામા પક્ષના બે ખેલાડીઓ એકબીજા સામે ઊભા રહી વચ્ચે દડાને મૂકે છે. પ્રથમ દડાની બંને બાજુ પોતપોતાની સ્ટિકનો જમીનને સ્પર્શ કરાવે છે. ત્યાર બાદ હવામાં દડા ઉપર બંને સ્ટિકના સપાટ ભાગ સામસામે રહે તે રીતે સ્પર્શ કરાવે છે. આ પ્રમાણેની ક્રિયા ત્રણવાર કરાવવામાં આવ્યા બાદ જેને તક મળે તે ખેલાડી દડાને રમવા પ્રયત્ન કરે છે. ત્રણવાર જમીન ઉપર અને હવામાં સ્ટિકનો સ્પર્શ કરાવ્યા બાદ દડા ઉપર પ્રભુત્વ મેળવવા નીચેના જેવી રીતો અપનાવવામાં આવે છે :

(1) દડાને રિવર્સ સ્ટિક વડે પુશ કરી પોતાની ટુકડીના સેન્ટર હાફ ખેલાડી તરફ મોકલી આપવામાં આવે છે.

(2) સામાપક્ષના ખેલાડીના પગ અને સ્ટિક વચ્ચે થઈને દડાને સામા પક્ષના મેદાનમાં આગળ પુશ કરવામાં આવે છે, જેથી દોડીને રાઈટ ઇન્સાઈટનો પોતાનો બિલ્બુ તે દડો મેળવી શકે છે.

(3) બુલી કરનાર ખેલાડી જ સામા ખેલાડીને ડેજ કરીને દડો લઈને આગળ વધે છે.



બુલી કરી રહેલા ખેલાડીઓ

ગોલકીપિંગ

ગોલકીપિંગની કળાએ ટુકડીનું હાદ છે. સારો ગોલકીપર ટીમને જીતાડે છે. કારણ કે ગોલ થતો રોકવાની મુખ્ય જવાબદારી તેના શિરે હોય છે. પણેપળ બદલાતી સ્થિતિમાં યોગ્ય ધારણાઓ, હિંમત, સતર્કતા, સ્વૂર્તિ, તત્કાળ નિર્જયશક્તિ અને તીક્ષ્ણ દાઢિ વડે જ સારું અને કુશળ ગોલકીપિંગ કરી શકાય છે. સ્ટ્રાઇકિંગ વૃત્ત (શૂટિંગ સર્કલ) વિસ્તારમાં ગોલકીપરને વિશેષ હકો મળે છે. જે મુજબ તે દડાને શરીરના કોઈ પણ ભાગ વડે રોકી શકે છે તથા લાત મારી શકે છે. સામાન્ય રીતે દડો અટકાવ્યા પછી મેદાનમાં ખાલી જગ્યા હોય તે તરફ અગર જ્યાં પોતાનો બિલ્બુ ઊભો હોય તે તરફ દડો મોકલવો જોઈએ. તેમ શક્ય ન હોય તો બાજુરેખા પરથી દડાને મેદાન બહાર મોકલી આપવો. પોતાની ગોલરેખા પરથી કદીયે ગોલકીપરે દડો મેદાન બહાર કાઢવો નહિએ.



ગોલમાં જઈ રહેલા દડાને પગ
અને પેડ વડે રોકવાનો પ્રયાસ
કરતો ગોલકીપર



ગોલ થતો રોકવા માટે દડાને કિક
મારતો ગોલકીપર

ગોલકીપિંગ : (1) દડાને સ્ટિક વડે રોકતો ગોલકીપર (2) દડાને પગ વડે લાત મારીને ગોલથી દૂર કરીને ગોલનું રક્ષણ કરતો ગોલકીપર (3) હવામાં દડાને રોકતો ગોલકીપર.



(1)



(2)



(3)

રમતના નિયમો

રમતનો સમય : 35 મિનિટનો એક એવા બે અર્ધ સમયમાં રમતનો સમય વહેચાવમાં આવે છે. બે અર્ધ સમય વચ્ચે 5 મિનિટનો વિરામ આપવામાં આવે છે. પંચને અગાઉથી જાણ કરીને બંને કેપ્ટન સંમત થાય તો વિરામનો સમય 10 મિનિટનો કરી શકાય છે. રમત દરમિયાન સમયનો જે વય થયો હોય તેને જે-તે અર્ધ સમયમાં ઉમેરી આપીને વય થયેલા સમય જેટલી રમત લંબાવી આપવામાં આવે છે.

રમતની શરૂઆત :

(1) રમતની શરૂઆત કરતા પહેલાં સિક્કા-ઉછાળ કરી ‘મેદાન’ અથવા ‘સેન્ટર પાસ’ નક્કી કરવામાં આવે છે. સિક્કા-ઉછાળમાં વિજેતા ટુકડીનો કેપ્ટન ‘મેદાન’ અથવા ‘સેન્ટર પાસ’ દ્વારા રમતની શરૂઆત એ બેમાંથી એકની પસંદગી કરે છે. સિક્કા-ઉછાળમાં વિજેતા નહિ થનાર ટુકડીને, સિક્કા ઉછાળમાં જીતનાર ટુકડીએ, પસંદ નહિ કરેલો વિકલ્ય મળે છે.

(2) ‘સેન્ટર પાસ’થી રમતની શરૂઆત કરતી વખતે ‘સેન્ટર પાસ’ કરનાર બેલાડી સિવાયના બંને ટુકડીઓના બાકીના તમામ બેલાડીઓ મેદાનના પોતપોતાના અર્ધ ભાગમાં રહે છે.

(3) સેન્ટર પાસ ‘પુશ’ અથવા ‘હિટ’ બંનેમાંથી અનુકૂળ લાગે તે રીતે કરી શકાય છે. તેમજ મેદાનની ગમે તે દિશામાં કરી શકાય છે.

(4) ‘સેન્ટર પાસ’ વખતે હરીફ ટીમના તમામ બેલાડીઓ સેન્ટર પાસ લેનાર બેલાડીથી ઓછામાં ઓછા 5 મીટર દૂર હોવા જોઈએ.

(5) ‘સેન્ટર પાસ’ પુશ કે હિટ કરેલો દડો 1 મીટર જેટલો દૂર જાય પછી સેન્ટર પાસ લેનાર બેલાડી સિવાયનો ગમે તે બેલાડી તે દડાને રમી શકે છે. અન્ય કોઈ પણ બેલાડી દડાને રમે તે પછી જ સેન્ટર પાસ કરનાર દડાને રમી શકે છે.

(6) ગોલ થાય ત્યારે જે ટુકડીએ ગોલ કર્યો હોય તેનાથી વિરુદ્ધ ટુકડી મેદાનની મધ્યમાંથી સેન્ટર પાસ દ્વારા રમત પુનઃ શરૂ કરે છે.

(7) બીજા અર્ધ સમયની શરૂઆત કરતા પહેલાં બંને ટુકડીઓ મેદાનની ફેરબદલી કરે છે. તેમજ પ્રથમ વખતે રમત શરૂ કરનાર ટુકડીના વિરુદ્ધપક્ષનો બેલાડી ‘સેન્ટર પાસ’ની રમત શરૂ કરે છે.

અવેજીકરણ : પ્રયોગ ટુકડીમાં 16 બેલાડીઓ હોય છે. જે પૈકી 11 બેલાડીઓ રમતમાં ભાગ લે છે. રમત દરમિયાન (પેનલ્ટી કોર્નર મળે ત્યાર સિવાય) ગમે ત્યારે બેલાડીઓનું ગમે તેટલી વાર અવેજીકરણ કરી શકાય છે. ફક્ત શિક્ષારૂપે મેદાન બલાર મોકલવામાં આવેલા બેલાડીને બદલે બીજો અવેજી બેલાડી રમતમાં લઈ શકાતો નથી.

ગોલ : રમતમાં ભાગ લેનાર ટુકડીઓ પૈકી સામાપક્ષના મેદાનમાં આકમણ કરનાર ટુકડીનો કોઈ પણ બેલાડી સામાપક્ષના શૂટિંગ સર્કલમાંથી પોતાની સ્ટિક વડે દડાને સામાપક્ષની ગોલરેખા પસાર કરીને ગોલ સંભોની અંદર મોકલી આપે ત્યારે આકમણ કરનાર ટુકડીનો ‘ગોલ’ થયો ગણાય છે.

રમતના સામાન્ય નિયમો

- (1) હોકી સ્ટેકના ચપટા ભાગ વડે જ દાને રમી શકાય છે.
- (2) જ્યારે 5 મીટરની નજીકમાં અન્ય કોઈ ખેલાડી હોય ત્યારે દાને ભયજનક રીતે ફટકો મારીને કે અન્યને ઈજા થાય તે રીતે રમી શકાશે નહિએ.

(3) ગોલકીપર સિવાયનો અન્ય કોઈ પણ ખેલાડી દાને હોકી સ્ટેક સિવાય રોકી કે રમી શકશે નહિએ. માત્ર ગોલકીપર પોતાના શૂટિંગ સર્કલમાં દાને શરીરના કોઈ પણ ભાગ વડે રોકી શકે તેમજ દાને લાત મારીને દૂર પણ મોકલી શકે છે.

(4) કોઈ પણ ખેલાડી પોતાની હોકી સ્ટેક કે શરીરના કોઈ પણ ભાગ દ્વારા પ્રતિસ્પદ્ધની અદ્યાષ કરી શકશે નહિએ, તેમજ પ્રતિસ્પદ્ધની ખેલાડી અને દા વચ્ચે અદ્યાષ થાય તેમ આવી શકશે નહિએ કે પસાર થઈ શકશે નહિએ.

(5) દડો રમત દરમિયાન પંચને અથડાય અથવા ફટકારેલો દડો ગોલ સંભને અથડાઈને મેદાનમાં પાછો આવે તો દડો રમતમાં ચાલુ ગણાય છે.

ઝી હિટ :

(1) સામાન્ય રીતે શૂટિંગ સર્કલ સિવાય મેદાનના અન્ય કોઈ ભાગમાં નિયમ બંગ થાય તો નિયમ બંગ કરનાર ટુકડીના વિરોધી પક્ષને જે સ્થળે નિયમ બંગ થયો હોય તે સ્થળેથી ‘ઝી હિટ’ દ્વારા દડો રમતમાં મૂકવાની તક આપવામાં આવે છે.

(2) ઝી હિટ લેતી વખતે સામાપક્ષના તમામ ખેલાડીઓ ઝી હિટ લેનાર ખેલાડીથી 5 મીટર દૂર રહેવા જોઈએ.

(3) ઝી હિટ લેનાર ખેલાડીએ ફટકારેલા દાને, બંને ટુકડી પૈકી કોઈ પણ ટુકડીનો ખેલાડી રમે નહિ ત્યાં સુધી ઝી હિટ લેનાર ખેલાડી તે દાને રમી શકે નહિએ.

(4) ઝી હિટ લેતી વખતે દાને ‘હિટ’ અથવા ‘પુશ’ કરી શકાય છે.

પુશ ઈન :

(1) પુશ ઈનની કિયા દરમિયાન, જે ટુકડીથી દડો બાજુરેખા પરથી બહાર ગયો હોય તેના વિરુદ્ધપક્ષને દડો જે સ્થળેથી બહાર ગયો હોય ત્યાંથી ‘પુશ ઈન’ કે હીટ દ્વારા મેદાનમાં રમવા મૂકવાની તક આપાય છે.

(2) પુશ ઈન વખતે સામાપક્ષના તમામ ખેલાડીઓ, પુશ ઈન લેનાર ખેલાડીથી 5 મીટર દૂર હોવા જોઈએ.

બુલી :

નીચેના સંજોગોમાં ‘બુલી’ દ્વારા રમત પુનઃ શરૂ કરાય છે :

(1) સંજોગોવશાત્ત રમત દરમિયાન દડો ગોલકીપરના પેડમાં અગર તેના કે અન્ય ખેલાડીના કપડામાં અગર પંચના કપડામાં ભરાય જાય ત્યારે.

(2) બંને પક્ષના ખેલાડીઓ એક સાથે ફાઉલ કરે ત્યારે.

(3) રમત દરમિયાન દડો ફાટી જાય અને દડો બદલવો પડે ત્યારે.

(4) કોઈ ખેલાડી ગંભીર ઈજા પામે (રમત દરમિયાન) અને ફરજિયાત રમત અટકાવવી પડે ત્યારે.

ઉપરની પરિસ્થિતિમાં ‘બેક લાઈન’થી મેદાનની અંદર 14.63 મીટર દૂર, પંચ જે સ્થળે નક્કી કરે ત્યાંથી બુલી દ્વારા રમત પુનઃ શરૂ કરાય છે જેમાં બંને પક્ષનો એક-એક ખેલાડી પોતાની ગોલ-બેકરેખા તરફ જમણો ખભો રહે તેમ બંને પગ ખભા જેટલા ખુલ્લા રાખીને સામસામે ઊભા રહે છે. બંને વચ્ચે દડો મેદાન પર મૂકવામાં આવે છે અને એ રીતે પંચની સંજ્ઞા થતાં બુલીની કિયા કરવામાં આવે છે.

ગેરવર્તણૂક : રમત દરમિયાન કોઈ પણ ખેલાડીનું વર્તન ખેલહિલીભર્યું ન હોય, હિસ્ક રીતે રમતો હોય, પંચના નિર્ણયને માન ન આપતો હોય, અપશંદો બોલતો હોય તેવી પરિસ્થિતિમાં તેના ગુનાની ગંભીરતાને અનુલક્ષીને પંચ તેને નીચે પ્રમાણો શિક્ષા કરે છે :

(1) પહેલી જ વાર ગેરવર્તન કરતો હોય અને ગુનો ગંભીર ન હોય તો પંચ તેને બોલાવીને સૂચના આપે છે.

(2) આમ છતાં વર્તનમાં સુધારો ન થાય તો ‘ગ્રીન કાર્ડ’ લીલા રંગનું કાર્ડ બતાવીને તેને ચેતવણી આપે છે.

(3) કોઈ પણ ખેલાડી ગંભીર પ્રકારનું ગેરવર્તન કરે તો ‘યલો કાર્ડ’ પીળા રંગનું કાર્ડ દેખાડીને રમતના અમુક ચોક્કસ સમય માટે રમતના મેદાનમાંથી બહાર જવા જણાવે છે.

ગુનાની - ગેરવર્તણૂકની ગંભીરતા નક્કી કરવાની સત્તા પંચને હોય છે. ગેરવર્તણૂક માટે મેદાન બહાર મોકલવામાં આવેલા ખેલાડીને બદલે અવેજી ખેલાડીમાંથી કોઈને રમતમાં લઈ શકતો નથી.

પીળા રંગનું કાર્ડ બતાવીને જે ખેલાડીને મેદાન બહાર મોકલવામાં આવ્યો હોય તે પોતાની શિક્ષાનો અમલ પૂરો થતાં જે-તે પંચની પરવાનગી લઈને રમવા માટે મેદાનમાં દાખલ થશે.

રમતને અંતે ટાઇ (Tie) - ગાંધ પડે :

રમતના બંને અર્ધ સમય પૂરા થઈ જાય અને છતાં કોઈ પણ ટુકડી એક પણ ગોલ ન કરી શકે અથવા બંને ટુકડીના સરખા ગોલ થાય તારે બંને ટુકડી વચ્ચે ટાઇ-ગાંધ પડી ઓમ કહેવાય. આવી પરિસ્થિતિમાં ‘ટાઇબ્રેકર’ નિયમનો અમલ કરવામાં આવે છતાં વિજેતા નક્કી થાય તેવું પરિણામ ન આવે. ત્યારે બંને ટુકડીના એક-એક ખેલાડીને વારાફરતી પાંચ-પાંચ પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવે છે. આમ છતાં પરિણામ ન આવે તો ‘તત્કાળ મૃત’ (Sudden death) પદ્ધતિ મુજબ વારાફરતી પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવે છે અને કોઈ પણ ટુકડી પેનલ્ટી સ્ટ્રોકથી પ્રથમ ગોલ કરવામાં સફળ થાય તેને વિજેતા જાહેર કરી રમત બંધ કરવામાં આવે છે.

પેનલ્ટી કોર્નર :

નીચેની પરિસ્થિતિમાં આકમણ કરનાર ટુકડીને બચાવપક્ષના શૂટિંગ સર્કલ વિસ્તારની પાછળ પેનલ્ટી કોર્નર માટેના 9-10 મીટરના સ્થળેથી પેનલ્ટી કોર્નર આપવામાં આવે છે.

(1) બચાવપક્ષના ખેલાડી દ્વારા ઈરાદાપૂર્વક બચાવ પક્ષની ‘બેક લાઈન’ અને 22.90 મીટર રેખાની અંદરના વિસ્તારમાં ફાઉલ કરવામાં આવે ત્યારે.

(2) બચાવપક્ષના ‘શૂટિંગ સર્કલ’ વિસ્તારમાં તે પક્ષનો કોઈ ખેલાડી ફાઉલ કરે ત્યારે.

(3) બચાવપક્ષનો કોઈ ખેલાડી ઈરાદાપૂર્વક દડાને પોતાની બેક લાઈન પાછળ મોકલી આપે ત્યારે. ઉપર દર્શાવેલ પરિસ્થિતિમાં ફાઉલ થાય ત્યારે નીચે દર્શાવ્યા પ્રમાણે ‘પેનલ્ટી કોર્નર’ લેવામાં આવે છે.

(1) ‘પેનલ્ટી કોર્નર’ બેક લાઈન પર ગોલ સંતથી 9.10 મીટર દૂર દડો મૂકીને લેવામાં આવે છે.

(2) પેનલ્ટી કોર્નર લેતાં દડાને ‘હિટ’ અથવા ‘પુશ’ કરી શકાય છે.

(3) પેનલ્ટી કોર્નર લેતી વખતે પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડી પોતાનો એક પગ બેક લાઈનની પાછળ રાખીને અને આકમણ કરનાર ટુકડીના બાકીના દસ ખેલાડીઓ શૂટિંગ સર્કલની બહાર ઊભા રહે છે.

(4) ‘પેનલ્ટી કોર્નર’ લેતી વખતે બચાવપક્ષનો ગોલકીપર અને બાકીના ચાર મળી કુલ પાંચ ખેલાડીઓ પોતાની ગોલરેખા બેક લાઈન પાછળ પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડીથી 4.55 મીટર દૂર ઊભા રહે છે. બાકીના ખેલાડીઓ મધ્યરેખાની સામેના આંગણમાં ઊભા રહે છે.

(5) પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડીએ હિટ - પુશ કરેલો દડો શૂટિંગ સર્કલમાંથી બહાર નીકળે ત્યારે આકમણ કરનાર તેને રોકીને સર્કલમાં રમતા રમતા સર્કલમાં લઈ ગોલમાં ફટકારવા પ્રયત્ન કરે છે. જ્યારે બચાવપક્ષના ખેલાડીઓ દડાને રોકવા પ્રયત્ન કરે છે.

(6) પેનલ્ટી કોર્નરની કિયા શરૂ ન થાય ત્યાં સુધી બંને પક્ષના ખેલાડીઓ નક્કી કરેલા સ્થળની અંદર પ્રવેશી શકતા નથી.

(7) પેનલ્ટી કોર્નર લેનાર ખેલાડી અન્ય કોઈ પણ ખેલાડી દડાને રમે નહિ ત્યાં સુધી ફરીથી તે દડાને રમી શકતો નથી.

(8) પેનલ્ટી કોર્નરની કિયા દરમિયાન બચાવપક્ષ નિયમ લંગ કરે તો આકમણ કરનારને ફરીથી પેનલ્ટી કોર્નર આપવામાં આવે છે; પરંતુ આકમણ કરનાર નિયમ લંગ કરે તો બચાવપક્ષને શૂટિંગ સર્કલ બહારથી ફી હિટ આપવામાં આવે છે.

પેનલ્ટી સ્ટ્રોક :

જ્યારે આકમણ કરનાર ટુકડી શૂટિંગ સર્કલમાંથી દડાને ગોલ કરવાની તૈયારીમાં હોય અને તે સમયે બચાવપક્ષનો કોઈ ખેલાડી નિયમ બંગ કરે પરિણામે ગોલ થતો અટકી જાય. પંચને લાગે કે બચાવપક્ષે આવો નિયમ બંગ - ફાઉલ ન કર્યો હોત તો આકમણ કરનારનો અવશ્ય ગોલ થાત. તેવા સંજોગોમાં આકમણ કરનારને ‘પેનલ્ટી સ્ટ્રોક’ લેવાની તક આપવામાં આવે છે. તેમજ પેનલ્ટી કોર્નરની કિયા દરમિયાન બચાવપક્ષ ઈરાદાપૂર્વક વારંવાર ફાઉલ કરે તોપણ આકમણ કરનાર પક્ષને ‘પેનલ્ટી સ્ટ્રોક’ લેવાની તક આપવામાં આવે છે.

પેનલ્ટી સ્ટ્રોક સમયે બચાવપક્ષનો ગોલકીપર પોતાની ગોલરેખા પર સ્થિર ઊભો રહે છે. બાકીના તેના બિલ્બુઓ 22.90 મીટરની નજીકની રેખાની પાછળ મધ્યરેખા તરફ બાજુએ ઊભા રહે છે. જ્યારે આકમણ કરનાર ટુકડીનો એક ખેલાડી પેનલ્ટી સ્ટ્રોક લેવા માટે પેનલ્ટી સ્ટ્રોક બિંદુની નજીક ઊભો રહે છે અને તેના બાકીના બિલ્બુઓ પણ નજીકની 22.90 મીટરની રેખાની પાછળ મધ્યરેખા બાજુએ ઊભા રહે છે.

પેનલ્ટી સ્ટ્રોક લેનાર ખેલાડી એક કદમ ભરીને માત્ર એક જ વાર દડાને ‘પુશ’, ‘ફ્લાન્ક’ કે ‘સ્ક્રૂપ’ દ્વારા ગોલમાં મોકલવા પ્રયત્ન કરે છે. તે દડાને ફટકો - હિટ મારી શકતો નથી.

જો દડો ગોલમાં પસાર થઈ જાય તો આકમણ કરનારનો ગોલ થયો ગણાય છે; પરંતુ ગોલકીપર તે દડાને રોકી લે તો શૂટિંગ સર્કલની બુધારથી બચાવપક્ષને ફી હિટ આપી રમત પુનઃ શરૂ કરવામાં આવે છે. પેનલ્ટી સ્ટ્રોક જહેર થતાં રમતનો સમય દર્શાવતું ઘણિયાળ બંધ કરવામાં આવે છે અને પેનલ્ટી સ્ટ્રોકની કિયા શરૂ કરવામાં આવે છે.

પંચો :

આ રમતમાં બે પંચો અને એક ટેબલ ઓફિશિયલ હોય છે. જેઓ સમગ્ર રમતનું સંચાલન કરે છે. દરેક પંચ પોતાના મેદાનના અર્ધ ભાગના નિર્ણયો આપે છે. બંને નિર્ણયો એકબીજાની સહમતી તથા સંકલનથી રમતના સમયની અને થયેલા ગોલની નોંધ રાખે છે. તેમજ ખેલાડીઓનું અવેજીકરણ થાય તેની નોંધ સાથે પોતાના અર્ધ મેદાનમાં ખેલાડીઓને આપેલી ચેતવણીઓ તથા બરતરફીની નોંધ પણ રાખે છે.

સ્વાધ્યાય

1. સવિસ્તર જવાબ લખો :

- (1) ‘ટ્રિબ્લિંગ’ કોશાલ્ય શીખવાનાં પગથિયાં વર્ણવો.
- (2) ‘પેનલ્ટી કોર્નર’ વિશે વિગતવાર માહિતી આપો.
- (3) ગોલ થયો ક્યારે ગણાય ? ગોલ થયા પછી ફીલી રમત કઈ રીતે શરૂ કરવામાં આવે છે ?
- (4) ટેક્લિંગના પ્રકારો જણાવી ગમે તે એક વિશે સવિસ્તાર સમજૂતી આપો.

2. નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં જવાબ લખો :

- (1) હોકીના મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો.
- (2) હોકીની રમત દરમિયાન ‘ફી હિટ’ ક્યારે આપવામાં આવે છે ?
- (3) હોકીની રમતમાં ‘બુલી’ ક્યારે આપવામાં આવે છે ?
- (4) હોકીની રમતમાં કેટલાં પંચો હોય છે ?

3. નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો :

प्रवृत्ति

- મેદાન ઉપર વિદ્યાર્થીઓ દ્વારા હોકીના મેદાનનું અંકન કરાવવું.

ટેબલ ટેનિસ રમતની શોધ અને વિકાસ

ટેબલ ટેનિસ રમત ઈ.સ. 1880માં ઈંગ્લેન્ડમાં શોધાઈ હતી. આ રમત શોધાઈ ત્યારે તેનું નામ 'ગાસિમા' હતું. તેની શોધનાં થોડાં વર્ષો બાદ તેનું નામ 'પિંગ પોંગ' અપાયું હતું. આ રમતની શોધ કરનારનું નામ 'જેમ્સ ગિબ' હતું. પિંગ પોંગ રમતનું ઓસોસિયેશન સૌ પ્રથમ ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1902માં રચાયું હતું. તે જ વર્ષે તેની સ્પર્ધા પણ યોજાઈ હતી. પિંગ પોંગ નામમાંથી આ રમતનું આખરી નામ ઈ.સ. 1921માં 'ટેબલ ટેનિસ' થયું હતું. આ નવા નામાભિકરણ થયેલ રમતના ઓસોસિયેશનનું નામ ઈ.સ. 1926માં 'ઇંગ્લેન્ડ ટેબલ ટેનિસ ઓસોસિયેશન' બન્યું.

જર્મનીના ડૉ. ઓલે લેહમને (Dr. Olay Lahman) વિશ્વ ટેબલ ટેનિસ ફેડરેશનની રચના કરવા માટે ઈ.સ. 1926માં બર્લિનમાં એક બેઠક બોલાવી હતી જેમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, હંગરી, એકોસ્લોવેકિયા અને સ્વિઝરન એટલાં રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઈ.સ. 1926માં રચાયેલ આ 'વિશ્વ ટેબલ ટેનિસ ફેડરેશન'ના પ્રથમ પ્રમુખ ઈવર મોન્ટંગ્યુ હતા. આ પ્રથમ ફેડરેશનની 'પ્રથમ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ' સ્પર્ધાઓ પણ ઈ.સ. 1926માં જ યોજાઈ હતી. ઈ.સ. 1935 સુધી યોજાયેલ દ્વિ-વાર્ષિક વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં ભાગ લેનાર દેશો યુરોપના જ હતા.

અમેરિકા, ઈંગ્લેન્ડ અને ભારતે અનુકૂળ ઈ.સ. 1935, ઈ.સ. 1937 અને ઈ.સ. 1939 માં વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. યુરોપનાં રાષ્ટ્રોની બહાર સૌપ્રથમ વખત વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓ ઈ.સ. 1939માં ઇજિઝ રાષ્ટ્રના કેરો શહેરમાં યોજાઈ હતી. ઈ.સ. 1945 સુધી દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે આ સ્પર્ધાઓ યોજાઈ ન હતી.

ઈ.સ. 1937માં ભારતમાં રચાયેલ 'ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન'ના ઉપકૂળ ઈ.સ. 1938માં કોલકાતા ખાતે સૌપ્રથમ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યાર બાદ ભારતમાં નિયમિત રીતે આ રમતની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાતી રહી છે.

ઈ.સ. 1952 અને ઈ.સ. 1975માં ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશનના ઉપકૂળ 'વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ'ની સ્પર્ધાઓ અનુકૂળ મુંબઈ અને કોલકાતા ખાતે યોજાઈ હતી.

મેદાન :


ટેબલ ટેનિસની રમત સામાન્ય રીતે બંધ બારણે મોટા ઓરડામાં કે હોલમાં ટેબલ ટેનિસનું ટેબલ મૂકીને તેના ઉપર રમાય છે. ટેબલની લંબાઈ 274 સેમી, પહોળાઈ 152.5 સેમી અને ઊંચાઈ 76 સેમી હોય છે.

ટેબલ ટેનિસના દડાનું વજન 2.40 ગ્રામથી 2.53 ગ્રામ જેટલું જ હોવાથી સહેજ પવનથી પણ રમતમાં આડખીલી ઊભી થવાની શક્યતા રહેતી હોઈ, રમત રમાય ત્યારે ઓરડો કે હોલનાં બારીબારણાં બંધ રાખવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં આ રમત વાતાનુકૂલિત ઓરડામાં કે હોલમાં રમાડવામાં આવે છે. ઓછામાં ઓછું ટેબલ ટેનિસનું એક ટેબલ મૂકી શકાય અને તેની આજુબાજુ ખેલાડી મુક્ત રીતે હલનચલન કરી શકે તેને ધ્યાનમાં રાખીને ઓરડાની ઓછામાં ઓછી લંબાઈ 25 ફૂટ અને પહોળાઈ 15 ફૂટ હોવી આવશ્યક છે. ઓરડા કે હોલની છત પણ બોંયતળિયાથી ઓછામાં ઓછી 12 થી 15 ફૂટ જેટલી ઊંચી હોવી જોઈએ.

સાધનો :

ટેબલ ટેનિસની રમતનાં સાધનોમાં (1) ટેબલ (2) જાળી અને તેના આધાર સ્તંભ (3) દડો અને (4) રોકેટ હોય છે.

(1) ટેબલ : ટેબલ ટેનિસ રમતનું ટેબલ લંબચોરસ હોય છે. નીચેની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની લંબાઈ 274 સેમી (2.74 મીટર) અને પહોળાઈ 152.5 સેમી (1.525 મીટર) રહેશે. પાયાઓથી આધારિત ટેબલની ઉપરની સપાટી જમીનથી 76 સેમી રહેશે. ટેબલની ઉપરની સપાટી ગમે તે વસ્તુની બનાવી શકાય, પરંતુ તે એવી હોવી જોઈએ કે જેથી ટેબલ ટેનિસનો પ્રમાણભૂત દરો ટેબલની ઉપરની સપાટીથી 30 સેમીની ઊંચાઈએથી છોડવામાં આવે તો તે ઓછામાં ઓછો 22 સેમી અને વધારેમાં વધારે 24 સેમી જેટલો ઊંચો ઉછળવો જોઈએ.




ટેબલની ઉપરની સપાટીનો રંગ ઘરો, ખાસ કરીને લીલો હોવો જોઈએ. ટેબલની ઉપરની સપાટીની ચારેબાજુની ધાર 2 સેમીની પહોળી તથા સફેદ રંગથી રંગેલી હોવી જોઈએ. 152.5 સેમીની લંબાઈવાળી રેખાઓ ‘અંત રેખાઓ’ કહેવાશે અને 274 સેમીની લંબાઈવાળી રેખાઓ ‘બાજુ રેખાઓ’ કહેવાય છે.

ડબલ્સની રમત માટે ટેબલની ઉપરની સપાટીનો ભાગ $\frac{1}{4}$ સેમી પહોળાઈવાળી સફેદ રેખાથી બે સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવશે. આ રેખાને ‘મધ્ય રેખા’ કહેવામાં આવે છે, જે બાજુ રેખાઓને સમાંતર હોય છે.

(2) નેટ અને તેના આધાર સ્તંભ : ટેબલની ઉપરની સપાટીને બે સરખા ભાગમાં વહેંચે તે શીતે નેટને ટેબલની મધ્યમાં બાંધવામાં આવે છે. અંત રેખાઓને સમાંતર રહેશે. નેટની લંબાઈ 183 સેમી અને પહોળાઈ 15.25 સેમી રહેશે આધારસ્તંભ સાથે દોરીથી બાંધવામાં આવશે. આધાર સ્તંભની ઊંચાઈ પણ 15.25 સેમી જેટલી હોય છે. આધાર સ્તંભની બહારની ધાર, બાજુ રેખાઓથી 15.25 સેમી. દૂર હોય છે. આકૃતિમાં ટેબલની મધ્યમાં નેટ બાંધીને દર્શાવવામાં આવી છે.

(3) દડો : દડો સંપૂર્ણગોળાકાર રહેશે. તેનો વ્યાસ 40 મિલી રહેશે. દડો સફેદ, નારંગી રંગનો અને અપરાવર્તિત હોવો જોઈએ. તેનું વજન ઓછામાં ઓછું 2.67 ગ્રામ અને વધારેમાં વધારે 2.77 ગ્રામ હોવું જોઈએ.



(4) રોકેટ : ટેબલ ટેનિસનું રોકેટ (બેટ)ની સપાટી ધેરા રંગની અને અપરિવર્તિત હોવી જોઈએ. રોકેટની 'બ્લેડ' લાકડાની, સતત એકધારી જાડાઈવાળી, સપાટ અને કઠળ હોવી જોઈએ. બ્લેડની બંને ભાજુ એકસરખી સપાટીવાળી બને તે માટે દાઢાદાર રબર ચોટારી શકાય, તેની કુલ જાડાઈ 2 મિમિથી વધારે હોવી જોઈએ નહિ. અથવા રબરની નીચે સ્પોન્જ જેવી વસ્તુનું પડ નાખ્યું હોય તો રબર સાથેની તેની કુલ જાડાઈ 4 મિમિથી વધારે હોવી જોઈએ નહિ. રોકેટની એક ભાજુએ રબર ચોટાડેલું હોય અને બીજી ભાજુએ લાકડાનું પાટિયું ખુલ્લું રાખ્યું હોય તો તેનો રંગ (લાકડાનો) કુદરતી જે હોય તે જ રહેવા દેવો જોઈશે, તેને રંગી શકાય નહિ.

ટેબલ ટેનિસ રમતનાં કૌશલ્યો :

આ રમતનાં નીચેનાં કૌશલ્યો વિશે જાણકારી મેળવીશું :

(1) રોકેટ પકડ

(2) સર્વિસ :

(i) ફોર હેન્ડ સર્વિસ (ii) બેક હેન્ડ સર્વિસ (iii) સ્પિન સર્વિસ

(3) એટેક :

(i) ફોર હેન્ડ શૉટ (ii) બેક હેન્ડ શૉટ

(4) ડિફેન્સ :

(i) ફોર હેન્ડ રિટર્ન (ii) બેક હેન્ડ રિટર્ન

(1) રોકેટ પકડ : પકડના બે પ્રકાર છે : (i) હસ્તધૂનન પકડ અને (ii) પેન પકડ.

(i) હસ્તધૂનન પકડ : હસ્તધૂનનની કિયામાં જે રીતે સામેની વ્યક્તિનો હાથ પકડવામાં આવે છે તે રીતે સામેની વ્યક્તિના હાથની જગ્યાએ અહીં રોકેટનું હેન્ડલ પકડવામાં આવે છે. આ પકડમાં હાથનાં ચાર આંગળાં હેન્ડલની એક ભાજુએ અને અંગૂઠો સામેની ભાજુએ રહેશે. રોકેટનો ચપટો ભાગ ભાજુએ રહેશે. તેની કિનારી ઉપર તરફ રહેશે.

(ii) પેન પકડ : આ પકડમાં જે રીતે પેન પકડવામાં આવે છે તે રીતે રોકેટને પકડવામાં આવે છે. આ પકડમાં અંગૂઠો અને પહેલી આંગળી હેન્ડલ ઉપર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી હેન્ડલનો ચપટો ભાગ ઉપર તરફ રહે.

(2) સર્વિસ : સર્વિસના ત્રણ પ્રકાર છે : (i) ફોર હેન્ડ સર્વિસ (ii) બેક હેન્ડ સર્વિસ અને (iii) સ્પિન સર્વિસ.

(i) ફોર હેન્ડ સર્વિસ : સર્વિસ કરતી વખતે ખેલાડીના એકાંક્ષાથમાં દડો હોય છે અને બીજાં હાથમાં રોકેટ હોય છે. જો ખેલાડી જમણોરી હશે તો તે જમણા હાથે રોકેટ પકડશે અને ડાબાંથાથમાં દડો રહેશે. ફોર હેન્ડ સર્વિસમાં દડો ઉછાયા પછી ખેલાડી તેના જમણાથાથમાં પકડેલ રોકેટ વેદ એવી રીતે ફટકારશે કે જેથી જમણાથાથની હથેળી સામેના ખેલાડી તરફ રહેશે. દડો રોકેટના અંગૂઠા તરફના સપાટ ભાગને સ્પર્શની ફટકારવાનો રહેશે. આ રીતે ફટકારાયેલો દડો નેટ ઓંઝંગીને સામેના ખેલાડીના ટેબલના અર્ધ ભાગમાં પડવો જોઈએ.

(ii) બેક હેન્ડ સર્વિસ : બેક હેન્ડ સર્વિસમાં દડો ઉછાયા પછી ખેલાડી તેના જમણા હાથમાં પકડેલ રોકેટ વેદ એવી રીતે ફટકારશે જેથી જમણાથાથની હથેળીના પાછળનો આંગળાવાળો ભાગ સામેના ખેલાડી તરફ રહેશે. આ પ્રકારની કિયામાં દડો, ફોર હેન્ડ સર્વિસમાં રોકેટની જે ભાજુના સપાટ ભાગથી ફટકારવામાં આવતો હોય છે તેની વિસુદ્ધની ભાજુના સપાટ ભાગથી ફટકારશે.

(iii) સ્પિન સર્વિસ : સ્પિન સર્વિસમાં દડો ટેબલ ઉપરથી ગોળાકાર ગતિમાં ફરતો ફરતો સામેના ખેલાડીના ટેબલના અડધા ભાગમાં જગ્યે. આ પદ્ધતિથી ફટકારાયેલ દડો વધારે અસરકારક હોઈ ઘણી વખત સામેના ખેલાડી માટે તેને ઉપાડવો કે રમવો અધરો હોય છે.

સ્પિન સર્વિસમાં પણ ત્રણ પ્રકાર છે : (a) ટોપ સ્પિન સર્વિસ (b) બેક સ્પિન સર્વિસ (c) સાઈડ સ્પિન સર્વિસ.

(a) ટોપ સ્પિન સર્વિસ : ટોપ સ્પિન સર્વિસમાં દડાને રોકેટ વેદ સ્પર્શ કરતી વખતે રોકેટને લગભગ 30° ના ખૂણે આગળ તરફ નમેલું રાખવામાં આવે છે. આ કિયામાં રોકેટ દડાના ઉપર તરફના ભાગને સ્પર્શ કરે છે અને કંડાની ઝડપી ગતિથી દડાને સામેની ભાજુએ

ગોળાકાર ગતિમાં ધકેલી આવે છે. આ કિયામાં રેકેટ વડે પકડાયેલો હાથ શરૂમાં કોણીમાંથી સહેજ વળેલો હોય છે, જે દાને ફટકારવાની કિયા પૂરી થતાંની સાથે સીધો થતો હોય છે. ટોપ સ્પિન સર્વિસમાં ખેલાડી આકમક અને તવરિત હોય છે.

(b) બેક સ્પિન સર્વિસ : બેક સ્પિન સર્વિસમાં દાને રેકેટ વડે સ્પર્શ કરતી વખતે રેકેટ લગભગ 30° ના ખૂંઝો પાછળ તરફ નમેલું હોય છે. આ કિયામાં દાનો રેકેટના નીચેના ભાગમાં સ્પર્શ થતો હોય છે. હાથની અને કાંડાની સ્થિતિ ટોપ સ્પિન સર્વિસ પ્રમાણે જ હોય છે. આ કિયામાં રેકેટની ગતિ પાછળ તરફ આંચકા સાથે કરવામાં આવે છે. આ પદ્ધતિથી ફટકારાયેલ દો ટોપ સ્પિન કરતાં થોડો વધારે ઉંચો ઉછળે છે, પરંતુ સામેના ટેબલ ઉપર તે દૂર નહિ પડતાં નેટ તરફ નજીકમાં પડતો હોય છે. આ રીતે પડતા દાની ગતિ સામેનો ખેલાડી અંદાજ શકતો હોતો નથી તેથી તેની દાને ફટકારવાની કિયામાં નિષ્ફળતા મળવાની શક્યતા વધારે હોય છે. આ બેક સ્પિનની કિયાને ‘ઓપ’ પણ કહેવામાં આવે છે.

(c) સાઈડ સ્પિન સર્વિસ : સામાન્ય રીતે ટોપ સ્પિન અને બેક સ્પિન ઉપર પ્રભુત્વ મેળવ્યા પછી સાઈડ સ્પિન સર્વિસ શીખવામાં સરળતા રહે છે. કારણ કે સાઈડ સ્પિનની કિયા ટોપ સ્પિન અને બેક સ્પિનના મિશ્ર પ્રકાર જેવી છે. સાઈડ સ્પિન સર્વિસમાં ખેલાડી દાને રેકેટથી સામેની દિશામાં નહિ, પરંતુ બાજુએથી સ્પર્શથી હોય છે. આ પદ્ધતિથી સ્પિન કરેલ દો ટેબલ ઉપર પડતાંની સાથે ટેબલની બહાર તરફ ગતિ કરતો હોય છે.

(3) એટેક : ટેબલ ટેનિસમાં એટેક અથવા ઓફેન્સ (Offence)ના બે પ્રકાર છે : (i) ફોર હેન્ડ શોટ (ii) બેક હેન્ડ શોટ.

(i) ફોર હેન્ડ શોટ : અહીં શોટ શબ્દ એટેક અથવા ઓફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. આ કૌશલ્યની કિયા આકમણ પ્રકારની છે. આમ, ટોપ સ્પિનની કિયા આકમણ સાથે કરવામાં આવે છે. આ કિયામાં દો, પોતાના તરફના ટેબલ ઉપર પડીને ઉછળે અને ઉછળીને જ્યારે વધારેમાં વધારે ઊંચાઈ મેળવે ત્યારે તે દાને રેકેટ વડે ઘસારો (બ્રાંશિંગ) આપીને સ્પિન કરવામાં આવે છે. ઘસારો આપતી વખતે કાંડના આંચકાની કિયા લંબાવવામાં આવે છે. આ કિયા કરતી વખતે ડાબા પગ અને ડાબા હાથને, આવતા દાની સ્થિતિ પ્રમાણે, એવી રીતે નેટ તરફ લઈ જવાના હોય છે કે જેથી ખેલાડીના ખભા નેટને લગભગ કાટખૂંઝો આવે. આ કિયા કરતાં પહેલાં હાથ કોણીમાંથી લગભગ 135° ના ખૂંઝો વળેલા રહે. આ આકમણની કિયાની શરૂઆતમાં હાથ લગભગ કમરની ઊંચાઈએ આશરે 30 સેમી પાછળ તરફ રાખવામાં આવે છે અને દાને સ્થિર કર્યા પછી, હાથ ખભાની ઉપર સુધીની ઊંચાઈએ લઈ જવામાં આવે છે. ગતિથી આવતા દાને ફટકારવાનો હોઈ આ એટેકમાં રેકેટને હંમેશાં કાટખૂંઝો રાખવાયાં આવે છે અને હાથની કિયા મુક્ત રીતે કરવામાં આવે છે. આ કિયામાં હાથની હથેળી નેટ તરફ રહેશે.

(ii) બેક હેન્ડ શોટ : અહીં પણ શોટ શબ્દ એટેક અથવા ઓફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. આ કિયામાં હાથને ફોર હેન્ડ શોટ અથવા એટેક અથવા ઓફેન્સની કિયાથી વિરુદ્ધની દિશામાં રાખવામાં આવે છે. એટલે કે આ કિયા કરતી વખતે હાથની હથેળી નેટની વિરુદ્ધ દિશામાં રહેશે.

આ કિયામાં પણ દાનો સ્પર્શ વધારેમાં વધારે ઊંચાઈએ કરવાનો હોય છે. અહીં જમણો પગ અને જમણો હાથ કિયા કરતી વખતે એવી સ્થિતિમાં આવે છે કે તે વખતે ખેલાડીના ખભા નેટને કાટખૂંઝો આવશે. અહીં શરીરને દાઢી દૂર રાખીને ઊભા રહેવાનું હોય છે, કારણ કે આ કિયામાં હાથને છાતી સામેથી ડાબી બાજુએ લઈ જવાનો હોવાથી દાને ફટકારવાની કિયામાં સરળતા રહે. આ કિયામાં સામેનો ખેલાડી દાને રમવા માટે તૈયાર થાય ત્યાર પહેલાં દો ટેબલ ઉપર અથડાઈને દૂર ચાલ્યો જાય છે.

(4) ડિફેન્સ : ટેબલ ટેનિસમાં ડિફેન્સના બે પ્રકાર છે : (i) ફોર હેન્ડ રિટર્ન (ii) બેક હેન્ડ રિટર્ન.

(i) ફોર હેન્ડ રિટર્ન : અહીં રિટર્ન શબ્દ ડિફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. સામેના ખેલાડીના આકમણની ગતિ ધીમી કરવા માટે ડિફેન્સિવ રમત (બચાવની રમત) રમવાની હોય છે. બચાવની કિયા કરવા માટે રમતમાં આવેલા દાને થોડે દૂર સુધી જવા દેવો. આ માટે જેટલા અંતરેથી દાનો સંપર્ક કરવાનો હોય તેટલા અંતરે સામાન્ય રીતે પહેલેથી ઊભા રહેવાનું હોય છે. આ થોડે દૂર ઊભા રહેવાની સ્થિતિનો આધાર સામેના ખેલાડીના આકમણ ઉપર આધારિત હોય છે. આવી કિયા કરવા માટે પહેલાં જમણો પગ આવતા દાની દિશામાં જમણી બાજુએ મુકવો. આ રીતે રમવામાં આવતા દાને બેક સ્પિનની કિયાથી અને ધક્કા સાથે ફટકારવામાં આવે છે.

શીખાઉ ખેલાડીઓએ આકમણની રમત શીખતાં પહેલાં બચાવની રમત શીખવા પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આકમણની કિયા કરતાં બચાવની કિયા સરખામણીમાં વધારે સ્વાભાવિક અને સરળ છે.

(ii) બેક હેન્ડ રિટર્ન : અહીં પણ રિટર્ન શબ્દ ડિફેન્સના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. બેક હેન્ડ ડિફેન્સની કિયા સામાન્ય રીતે સામેના ખેલાડીએ આકમણ કરીને મોકલેલો દડો ડાબી બાજુ જતો હોય ત્યારે જ કરવામાં આવે છે. આ કિયામાં ડાબા પગને ડાબી બાજુએ દડા તરફ મૂકીને, જમણા હાથને છાતી સામેથી નીચે તરફ લઈ જવામાં આવે છે અને શરીરને પણ ડાબી બાજુએ સહેજ આગળ તરફ નમાવવામાં આવે છે. અહીં દડાને બેક સ્પિનથી ધક્કા સાથે ફટકારવામાં આવે છે. આ કિયા પ્રમાણમાં ફોર હેન્ડ ડિફેન્સ કરતા અધરી છે. બેક હેન્ડ કિયા કરતી વખતે પગનું સમતોળન રાખવું જરૂરી હોય છે. સામેના ખેલાડીઓ દડો ફોર હેન્ડ ઓફેન્સ કે બેક હેન્ડ ઓફેન્સથી ડાબી બાજુએ આવતો હોય ત્યારે બેક હેન્ડ ડિફેન્સથી જ રમવો જોઈએ.

ટેબલ ટેનિસ રમતના નિયમો :

(1) કેટલીક વ્યાખ્યાઓ :

(i) રોલી : જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમયગાળાને ‘રોલી’ કહે છે.

(ii) લેટ : રોલી દરમિયાન જ્યારે ગુણ આપવામાં આવતા નથી તે પરિસ્થિતિને ‘લેટ’ કહે છે. દા.ત. સર્વિસ કરીને દડો, નેટની ઉપરની ધારને અડક્યા બાદ સામેના ટેબલ ઉપર પડે તો તેને લેટ કહે છે. આ લેટની પરિસ્થિતિમાં, જે ખેલાડીએ સર્વિસ કરી હોય તે ખેલાડીની સર્વિસ, ગુણ ગુમાવ્યા કે મેળવ્યા વગર ચાલુ રહે છે. આમ, સર્વિસ કરવાની આ પરિસ્થિતિને લેટ કહે છે.

(iii) ગુણ : રોલી દરમિયાન લેટની પરિસ્થિતિ સિવાયની પરિસ્થિતિમાં જ્યારે ગુણ આપવામાં આવે છે ત્યારે દડાને રમવામાં ભૂલ કરનાર પક્ષના ખેલાડીને ગુણ આપવામાં આવે છે.

રોલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને ‘સર્વિસ કરનાર’ અને પછીથી ફટકારે તેને ‘સર્વિસ જીલનાર’ કહેવામાં આવે છે. ‘સિંગલ્સ’ની રમતમાં સર્વિસ કરનાર અને સર્વિસ જીલનાર, એમ બે જ ખેલાડી હોય છે.

‘અબલ્સ’ની રમતમાં કુલ ચાર ખેલાડી હોય છે. સર્વિસ કરનાર, તેની સામે ડાબી બાજુથી દડો જીલનાર, બીજા ખેલાડી સર્વિસ કરનારની ડાબી બાજુનો ત્રીજો ખેલાડી અને સર્વિસ કરનારની બરાબર સામેનો ચોથો ખેલાડી એમ ચાર ખેલાડી હોય છે.

(2) સાચી સર્વિસ : ખુલ્લા હાથમાં મૂકેલ દડો સ્થિર થતાં, તેને પંચ જોઈ શકે તેટલો લંબ દિશામાં ઉછાળેલો દડો નીચે તરફ ગતિ કરે તારે સર્વિસ કરનાર ખેલાડી દડાને ફટકારશે. આ ફટકારાયેલો દડો સર્વિસ કરનારના ટેબલને અડકીને, નેટ ઉપરથી સામેના જીલનાર ખેલાડીના ટેબલની ઉપરની સપાટીને અડકે, ત્યારે આ કિયાને સાચી સર્વિસ કરી એમ કહેવાશે.

ટેબલની રમતમાં, સર્વિસ કરાયેલ દડો, સામેના ટેબલવાળાઓના જમણી તરફના અર્ધ ભાગ કે ટેબલ ઉપરથી મધ્યરેખાને અડકેલ દડો, જીલનાર ખેલાડી દ્વારા નેટ ઉપરથી પરત સર્વિસ કરનાર તરફના ટેબલ ઉપર જશે તો તેને સાચી સર્વિસ ગણાશે. મુક્ત સર્વિસ કરતી વખતે મુક્ત હાથમાં દડો એવી રીતે રાખવામાં આવશે કે જેથી મુક્ત હાથનાં આંગળાં બેગાં રહે અને અંગૂઠો છુટો રહે તથા હથેળી ખુલ્લી રહે. દડો ઉછાળતી વખતે મુક્ત હાથ ટેબલની ઉપરની સપાટી કરતાં ઊંચો હોવો જોઈએ.

(3) દડો સાચી રીતે પાછો મોકલ્યો : સર્વિસ કરાયેલ કે રમતમાંનો પાછો મોકલેલ દડો, ખેલાડીએ એવી રીતે ફટકારવો જોઈશે કે જેથી તે નેટ ઉપરથી કે બાજુથી સામેના ખેલાડીના ટેબલ ઉપર પડે. આમ કરતાં જો નેટ સાથે કે તેના આધારસ્તંભ સાથે અથડાઈને સામેના ખેલાડીના ટેબલ ઉપર પડે તો તે દડો સાચી રીતે પાછો મોકલ્યો ગણાશે.

(4) દડો રમતમાં : સર્વિસ માટે દડો હાથમાંથી ઉછળે તે ક્ષાળથી, નીચેની પરિસ્થિતિઓ સિવાયની પરિસ્થિતિઓમાં તે રમતમાં ગણાશે.

(i) એક જ બાજુના ટેબલને દડો, એકની જગ્યાએ બે વખત અડકે.

- (ii) સર્વિસ સિવાય રોકેટ વડે ફટકારાયેલો દડો પોતાના ટેબલને અડકે.
- (iii) ખેલાડી સતત એક કરતાં વધારે વખત દડાને ફટકારે.
- (iv) ખેલાડીના રોકેટ પકડેલા હાથના કાંડા સિવાયના શરીરના કોઈ પણ ભાગને કે તેણે ધારણ કરેલ પોશાકના કોઈ પણ ભાગને અડકે.
- (v) સામેની બાજુએથી ફટકારાયેલ દડો, સામેના ટેબલના બીજા બેટના ભાગની સપાટીને અડકે ત્યાર પહેલાં રોકેટ અથવા રોકેટ પકડેલા હાથના કાંડા સુધીના ભાગને દડો અડકે.
- (vi) નેટ અને તેના આધારસ્તંભ સિવાયના કોઈ પણ વસ્તુને દડો અડકે.
- (vii) ડબલ્સની રમતમાં સર્વિસ કરેલો દડો સર્વિસ કરનાર જીલનાર ખેલાડીના ડાબી બાજુના ટેબલને અડકે.
- (viii) ડબલ્સની રમતમાં ખેલાડી પોતાની વારી સિવાય દડાને અડકે.

(5) લેટ :

નીચેની પરિસ્થિતિઓમાં રેલીને લેટ કહેવામાં આવે છે :

- (i) જ્યારે સર્વિસ કરાવેલ દડો નેટ ઉપરથી પસાર થવાની કિયામાં નેટને કે તેના આધારસ્તંભને અડકે ત્યારે. આ વખતે સર્વિસ અન્ય રીતે સાચી હોવી જરૂરી છે.
- (ii) જ્યારે જીલનાર ખેલાડી કે તેનો સાથી ખેલાડી તૈયાર ના હોય અને સર્વિસ કરવામાં આવી હોય.
- (iii) જ્યારે ખેલાડીના કાબૂ બહારના અક્સમાતના પ્રસંગે તે સાચી સર્વિસ ના કરી શકે કે સાચી રીતે દડાને પાછો ના વાળી શકે.
- (iv) જ્યારે રમતના કમની ભૂલને કારણે દરમિયાનગીરી કરવામાં આવે.

(6) પોઈન્ટ : નીચેની પરિસ્થિતિઓમાં ખેલાડી પોઈન્ટ ગુમાવશે :

- (i) જ્યારે સાચી સર્વિસ ના કરી શકે.
- (ii) જ્યારે સાચી રીતે આવેલ દડો સાચી રીતે પાછો ના વાળી શકે.
- (iii) જ્યારે દડો રમતમાં હોય ત્યારે ખેલાડી તેના રોકેટ વડે કે તેણે ધારણ કરેલા પોશાક વડે નેટ કે તેના આધારસ્તંભને અડકે.
- (iv) જ્યારે દડો રમતમાં હોય ત્યારે ખેલાડી તેના રોકેટ વડે કે તેણે ધારણ કરેલા પોશાક વડે ટેબલને હલાવે કે ખસેડે.
- (v) જ્યારે દડો રમતમાં હોય ત્યારે ખેલાડીનો મુક્ત હાથ ટેબલની ઉપરની સપાટીને અડકે.
- (vi) દડો રમતમાં ના હોય તેવા પ્રસંગે સામેના ખેલાડી દ્વારા મોકલવામાં આવેલો દડો, ખેલાડીની નેટના પોતાની બાજુના રમત વિસ્તારને અડક્યા સિવાય રેખાઓ કે બાજુરેખાઓ પરથી પસાર થઈ ખેલાડીને કે તેણે ધારણ કરેલી ચીજવસ્તુને અડકે ત્યારે.
- (vii) ડબલ્સમાં જ્યારે ખેલાડી પોતાની વારી સિવાય દડાને ફટકારે.

(7) રમત : સિંગલ્સના એક-એક ખેલાડી કે ડબલ્સના બબ્બે ખેલાડીઓની જોડીમાંથી જે ખેલાડી કે ખેલાડીઓની જોડી પહેલાં 11 ગુણ કરશે તે જીતશે. બંને ખેલાડી કે બંને જોડીએ 10 સરખા ગુણ કર્યા હશે તો ત્યાર પછી જે ખેલાડી કે જોડી 2 ગુણનો તફાવત પહેલો મેળવશે તે જીતશે.

(8) સ્પર્ધા : સ્પર્ધા સાત રમતની રહેશે. સાતમાંથી ચાર રમત જીતનાર ખેલાડી કે ખેલાડીઓની જોડી સ્પર્ધામાં વિજયી ગણાશે. રમત સતત ચાલુ રહેશે.

(9) બાજુ કે સર્વિસની પસંદગી : ટેબલની ગમે તે બાજુ કે પહેલી સર્વિસ કરવાનો કે જીલવાનો હક સિક્કા-ઉછાળથી કરવામાં આવશે. સિક્કા ઉછાળમાં જીતનાર સર્વિસની પસંદગી કરશે તો હારનાર બાજુની પસંદગી કરશે અને જીતનાર બાજુની પસંદગી કરશે તો

હારનારને સર્વિસની પસંદગી મળશે. સિક્કા-ઉધાળમાં જુતનાર પોતાની ઈચ્છાથી હારનારને ગમે તે પસંદ કરવાનું કહી શકશે.

અભલ્સમાં કોઈ પણ રમતની પ્રથમ બે સર્વિસ કરવાનો હક મેળવનાર જોડ, પોતાનો કયો જોડીદાર પ્રથમ બે સર્વિસ કરશે તે નક્કી કરશે અને તે જ પ્રમાણે સામેની જોડ પણ આ સર્વિસ તેમનો કયો જોડીદાર જીલશે તે નક્કી કરશે. પછીની રમતો માટે સર્વિસ કરનાર જોડ પોતાનો પ્રથમ સર્વિસ કરનાર નક્કી કરશે અને તેનો પૂર્વ નિયમ સ્પર્ધક આ સર્વિસ જીલનાર રહેશે. એમ આ પ્રમાણે કમ જળવાઈ રહેશે.

(10) બાજુ અને સર્વિસની બદલી : એક ખેલાડી કે જોડીએ જે બાજુએથી પહેલી રમતની શરૂઆત કરી હશે તેની સામેની બાજુએથી ત્યાર પછીની રમત શરૂ કરવામાં આવશે. એમ વારાફરતી સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધી બાજુઓ બદલાશે. છેલ્લી નિર્ણાયક રમતમાં કોઈ પણ ખેલાડી કે જોડી પહેલાં 6 ગુણ મેળવશે કે તરત જ તેમણે બાજુઓ બદલવાની રહેશે.

અભલ્સમાં પહેલી બે સર્વિસ જોડીમાંથી પસંદ કરેલો ખેલાડી કરશે અને સામેની જોડીમાંથી પસંદ કરેલો ખેલાડી દાને જીલશે. પછીની બે સર્વિસ પહેલી બે સર્વિસ જીલનાર સામેની જોડીઓ ખેલાડી કરશે. આમ, વારાફરતી સર્વિસ કરવાનું અને જીલવાનું રમતના અંત સુધી ચાલ્યા કરશે.

જ્યારે બંને પક્ષના 10 સરખા ગુણ થયા હશે ત્યારે સર્વિસ કરવાનો કમ તો તેનો તે જ રહેશે, પરંતુ દરેક ખેલાડી વારાફરતી એક-એક જ સર્વિસ કરશે. આમ, રમતના અંત સુધી ચાલશે.

અભલ્સની નિર્ણાયક રમતમાં ગમે તે જોડી જ્યારે પહેલાં 10 ગુણ મેળવશે ત્યારે સર્વિસનો કમ બદલવામાં આવશે. જીલનાર જોડી તેનો જીલવાનો કમ બદલશે. અભલ્સની સ્પર્ધાની દરેક રમતમાં શરૂઆતની રમતનો દડો જીલવાનો કમ પછીની રમતમાં તેની વિરુદ્ધનો રહેશે. ખેલાડી કે જોડી જે રમતમાં પહેલી સર્વિસ કરશે તે ત્યાર પછીની રમતમાં પહેલો દડો જીલશે.

(11) બાજુ બદલવામાં, સર્વિસ કરવામાં કે દડો જીલવામાં ભૂલ : બાજુ બદલવાની વારી હશે ત્યારે બાજુ નહિ બદલી હોય, પરંતુ ભૂલ જણાઈ હોય ત્યારે તરત જ બદલવામાં આવશે. બાજુ બદલવાની ભૂલ ના શોધવાને કારણે રમત પૂરી થઈ હશે તો તે ભૂલને ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ભૂલ જણાઈ આવતાં પહેલાં જેટલા ગુણ થયા તેટલા ગુણ ગણતરીમાં લેવામાં આવશે.

કોઈ પણ ખેલાડી ભૂલથી તેની વારી ના હોવા છતાં સર્વિસ કરે કે દડો જીલે તો આવી ભૂલ માલૂમ પડતાં તરત જ રમત થંભાવી દેવામાં આવશે અને રમત શરૂ થતી વખતે જે કમ હોય તે કમ ગોઠવવામાં આવશે અથવા 10 ગુણ થયા પછી જે કમ હોય તે કમ નક્કી કરવામાં આવશે. ભૂલ જણાઈ આવતા પહેલાં જે ગુણ થયા હશે તે ગણતરીમાં લેવામાં આવશે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના સંવિસ્તર ઉત્તર આપો :

- (1) ટેબલ ટેનિસની રમતમાં રૈકેટ પકડવા (ગ્રીપ)ના પ્રકાર જણાવી સમજૂતી આપો.
- (2) ટેબલ ટેનિસની રમતમાં ફોર હેન્ડ સર્વિસ અને બેક હેન્ડ સર્વિસની સમજૂતી આપો.
- (3) સ્પિન સર્વિસના પ્રકાર જણાવી, દરેકની સમજૂતી આપો.
- (4) ફોર હેન્ડ એટેક કે ઓફેન્સની સમજૂતી આપો.
- (5) બેક હેન્ડ રિફેન્સની સમજૂતી આપો.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

- (1) ટેબલ ટેનિસ રમતના ટેબલનું માપ અને સમજૂતી આપો.

- (2) ટેબલ ટેનિસ રમતમાં નેટ અને દડાના માપ અને સમજૂતી આપો.
- (3) ટેબલ ટેનિસના રોકેટ (બેટ)ની સમજૂતી આપો.
- (4) ટેબલ ટેનિસની રમતમાં ‘રેલી’ કોને કહેવાય તે સમજાવો.
- (5) ટેબલ ટેનિસની રમતમાં સાચો સર્વિસ કોને કહેવાય તે સમજાવો.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર, તેની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો :

- (1) ટેબલ ટેનિસની રમત ક્યા દેશમાં શોધાઈ હતી ?
 (A) ફાન્સ (B) ઈરબેન્ડ (C) જર્મની (D) જપાન
- (2) ટેબલ ટેનિસની રમતની શોધની શરૂઆતથી અત્યાર સુધીમાં તેનાં જે નામ હતાં તેમાંથી નીચે એક નામ ખોટું છે તે શોધી કાઢો.
 (A) ગાસિમા (B) આસિમા (C) પિંગપોંગ (D) ટેબલ ટેનિસ
- (3) ટેબલ ટેનિસ રમતના ટેબલની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે ?
 (A) 264 સેમી - 142.5 સેમી (B) 290 સેમી - 163 સેમી
 (C) 274 સેમી - 152.5 સેમી (D) 280 સેમી - 155 સેમી
- (4) ટેબલ ટેનિસના ટેબલની ઉપરની સપાટીથી જમીનના તણિયા સુધીનું માપ કેટલું હોય છે ?
 (A) 56 સેમી (B) 66 સેમી (C) 76 સેમી (D) 86 સેમી
- (5) ટેબલ ટેનિસના દડાનો વાસ કેટલો હોય છે ?
 (A) 36.2 મિલિમીટર (B) 37.2 મિલિમીટર (C) 38.2 મિલિમીટર (D) 40.0 મિલિમીટર
- (6) જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમયગાળાને શું કહે છે ?
 (A) રેલી (B) નેટ (C) બેટ (D) નિશ્ચિત સમય
- (7) રેલી દરમિયાન જ્યારે ગુણ આપવામાં આવતા નથી તેને શું કહે છે ?
 (A) ખોટા ગુણ (B) સાચા ગુણ (C) લેટ (D) રેલી
- (8) રેલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે ?
 (A) દડો જીલનાર (B) દડો પાછો મોકલનાર (C) સર્વિસ કરનાર (D) દડો રમનાર
- (9) ટેબલ ટેનિસની રમતમાં ડબ્લ્યુમાં કેટલા ખેલાડી રમતા હોય છે ?
 (A) બે ખેલાડી (B) ચાર ખેલાડી (C) છ ખેલાડી (D) આઠ ખેલાડી
- (10) સિક્કા-ઉછાળમાં અતનાર શાની પસંદગી કરે છે ?
 (A) બાજુ કે સર્વિસની (B) દડાની (C) રોકેટની (D) પંચની
- (11) છોલ્લી નિર્ણાયક રમતમાં કેટલા ગુણ થતાં ખેલાડી કે ખેલાડીઓની જોડીએ બાજુ બદલવાની હોય છે ?
 (A) 5 ગુણ (B) 10 ગુણ (C) 7 ગુણ (D) 12 ગુણ

- (12) સિંગલ્સમાં પહેલા પાંચ ગુણ પછી સર્વિસ કરનાર શું થશે ?
(A) ફટકારનાર (B) જીલનાર (C) રમનાર (D) હારનાર
- (13) ટેબલ ટેનિસની રમત ક્યા વર્ષમાં શોધાઈ હતી ?
(A) 1871 (B) 1880 (C) 1891 (D) 1901
- (14) ભારતમાં ઓંલ ઈન્જિયા ફેડરેશનની રચના ક્યા વર્ષમાં થઈ હતી ?
(A) 1927 (B) 1937 (C) 1947 (D) 1951



કુસ્તી

કુસ્તી શબ્દ ફારસી છે અને તેનો અર્થ ‘બથ્યંબથ્થા’ થાય છે. કુસ્તી એક અથવા બીજા સ્વરૂપે વિશ્વબાપી લોક રમત છે અને વિવિધ દેશોમાં લોક સંસ્કૃતિ આધારિત શૈલી પ્રમાણે શોખથી રમાય છે. વિવિધ દેશોમાં અલગ અલગ નામોથી પ્રચલિત છે. જેમકે જાપાનમાં સુમો, રશિયામાં સામ્બો, ટક્કિમાં ચાગલી, ઈરાનમાં કુસ્તી તથા ભારતમાં મહલ્યુદ્ધ તરીકે પ્રચલિત હતી.

પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મહલ્યુદ્ધ પ્રચલિત હતું. મહાભારત કાળમાં શ્રીકૃષ્ણ, બલરામ, ભીમ, કંસ, ચાણુર વગેરે ઘ્યાતનામ મહલ્યિદ્યા નિષ્ણાતો હતા એ સર્વવિદ્ધિત છે.

આમ છતાં સાંપ્રતકાળમાં કુસ્તીની બે શૈલીઓ (1) ફી સ્ટાર્ટલ (2) ગ્રીકો રોમન વિશ્વ પ્રચલિત અને સર્વમાન્ય છે તથા વિશ્વ તેમજ ઓલિમ્પિક સ્પર્ધાઓમાં આ બે શૈલીઓનો જ સમાવેશ થાય છે. ઓલિમ્પિક રમતોમાં 1896થી કુસ્તીની સ્પર્ધાનો સમાવેશ થયેલો છે તેમ છતાં બીજા વિશ્વયુદ્ધ પછી તે ખરેખર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની રહી છે. અને અનેક દેશો તેમાં ભાગ લે છે.


ફી સ્ટાર્ટલ કુસ્તી સૌથી વધુ લોકપ્રિય અને પ્રેક્ષણિય કુસ્તી શૈલી છે. જેમાં શિષ્ટ પકડો, પદ્ધતો, ચૂકાવટોની જ છૂટ છે અને સર્વ દ્વાંદ્વો આંતરરાષ્ટ્રીય નિયમોથી નિયંત્રિત છે. ગ્રીકો રોમન કુસ્તીમાં ફી સ્ટાર્ટલ કુસ્તી જેવા જ નિયમો છે, પરંતુ મુખ્ય તફાવત એ છે કે તેમાં પ્રતિસ્પર્ધાને નિતંબની નીચેના ભાગે પકડી શકતો નથી કે પગ વડે પકડમાં લઈ શકતો નથી. બંને પ્રકારમાં પ્રતિસ્પર્ધકના વાળ, સ્નાયુ કે ગુમ ભાગ જેંચવા, હાથપગ કે આંગળા પર લાત મારવી, ગળુ દાખવું, નિયમ વિરુદ્ધ ગણાય છે.

નિયમો :

- (1) કોઈ પણ ટીમનો ખેલાડી પોતાના વજન કેટેગરીમાં જ ભાગ લઈ શકે છે.
- (2) સ્પર્ધાના હિવસે હરીકે દાઢી કરેલ હોવી જોઈએ અથવા ઘણા મહિનાઓથી દાઢી વધારેલી હોવી જોઈએ.
- (3) કુસ્તીની રમત ગ્રાન્-ત્રાન્ મિનિટના બે રાઉન્ડમાં રમાય છે. બે રાઉન્ડ વચ્ચે એક મિનિટનો વિરામ હોય છે. આ રાઉન્ડના સમય પહેલાં ખેલાડી વિજય મેળવી લે તો રમત પૂર્ણ થાય છે.
- (4) કુસ્તીના મુકાબલા દરમિયાન કોઈ હરીકે પ્રતિસ્પર્ધિની તેના બંને ખભાના મુઠા મેટને અડકે તે રીતે ચીત કરે અને એક સેકન્ડ સુધી તે સ્થિતિ જાળવે તો પ્રતિસ્પર્ધી હાર્યો ગણાય અને રમતનો અંત આવે છે.
- (5) જે ખેલાડી કાનમાં પ્રોટેક્ટર પહેરવા માંગતો હોય તો મંજૂરીથી ઉપયોગ કરી શકે છે, પરંતુ તે ધાતુના બનેલા હોવા જોઈએ નહિ.
- (6) અન્ય કોઈ પણ દેશના નકશા તેમજ નિશાનીવાળો ડ્રેસ પહેરી શકે નહિ.
- (7) ચોટ લાગવાને કારણે તેમજ ડોક્ટરની સલાહ વગર હાથમાં, એંકલ, કલાઈમાં બેન્ડેજ પહેરવું જોઈએ નહિ.
- (8) શરીરે તેલ અથવા ગ્રીસ કે તેવો પદાર્થ લગાડી શકશે નહિ.
- (9) વારંવાર મેટ્સ પર સ્પર્ધા સમયે આવવું જોઈએ નહિ.
- (10) ખેલાડીએ રિંગ બ્રેસલેટ જેવી કોઈ પણ વસ્તુઓ પહેરવી જોઈએ નહિ કે જેનાથી સામેના ખેલાડીને ચોટ લાગી શકે.
- (11) વજન સમયે રેફશ્રી ખેલાડીની દરેક આવશ્યકતા અનુસાર તપાસ કરવી જોઈએ અને દરેક બાબતો પૂરતી ન હોય તો ચેતવણી આપશે તેમજ સ્પર્ધામાં ભાગ લેવા દેશે નહિ.
- (12) ખેલાડી અપૂરતા ડ્રેસમાં સ્પર્ધા સમયે આવે તો તેને એક મિનિટનો સમય આપવો જોઈએ. જો ઉપર્યુક્ત સમયમાં બધી જ જરૂરિયાતો પૂર્ણ ન થાય તો તેને હારેલો જાહેર કરવામાં આવશે.

- (13) દાકતરી પ્રમાણપત્ર અને વાતીની સંમતિથી જુનિયર ખેલાડી સિનિયર કોટેગરીમાં ભાગ લઈ શકે છે.
- (14) કોઈ પડા મહિલા કે પુરુષ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય સમિતિની મંજૂરી મેળવેલી હોવી જોઈએ.

મેદાનની આકૃતિ



ગણવેશ

સ્પર્ધાનો ગણવેશ (પોશાક) આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર ટાઇટ એક વર્ણીય લંગોટ પહેરવાનો રહેશે. આ લંગોટમાં એકનો રંગ લાલ અને બીજાનો ભૂરો હોય તે જરૂરી છે. ખેલાડીઓ પર્ચી અથવા સ્પોટ બેલ્ટ ડોક્ટરની સલાહ મુજબ બાંધી શકે છે. હલકા ની-કેપ પહેરવાની પરવાનગી હોય છે. બૂટ હલકા અને એરી વગરના સાદા પહેરી શકે છે. ખેલાડી તેલ અથવા ચિકાસવાળા પદાર્થ શરીર પર લગાવી શકતા નથી. નખ પણ કાપેલા હોવા જોઈએ.

સમય

સબજુનિયર વિભાગ : સબજુનિયર વિભાગમાં બે-બે મિનિટના બે રાઉન્ડમાં ફુસી રમાય છે. બે રાઉન્ડ વચ્ચે 30 સેકન્ડનો વિરામ આપવામાં આવે છે.

જુનિયર અને સિનિયર : ત્રણ-ત્રણ મિનિટના બે રાઉન્ડમાં ફુસી રમાય છે. બે રાઉન્ડ વચ્ચે એક મિનિટનો વિરામ હોય છે. પરંતુ જો આ સમય પહેલાં જો કોઈ ખેલાડી વિજય મેળવી લે તો રમત પૂર્ણ થાય છે. સમયપંચ દર મિનિટે સમયની જાહેરાત કરે છે. સમય પૂર્ણ થતાં તે ઘંટી વગાડે છે ત્યારે રેફરી વિસ્તાર વગાડીને રમત પૂર્ણ થયેલી જાહેર કરે છે.

અધિકારીઓ :

આ રમતમાં એક રેફરી, એક મેચ યોરમેન, એક જજ અને એક ટાઈમકીપર મળી કુલ ચાર અધિકારીઓ હોય છે.

ઉમરના વિભાગો :

ખેલાડીની ઉમર ધ્યાનમાં રાખી નીચે પ્રમાણે વિભાગ આપેલા છે :

- | | | |
|-------------------------|---|---------------|
| (1) શાળાના ખેલાડીઓ માટે | : | 14 થી 15 વર્ષ |
| (2) સબજુનિયર માટે | : | 16 થી 17 વર્ષ |
| (3) જુનિયર માટે | : | 18 થી 20 વર્ષ |
| (4) સિનિયર માટે | : | 20 થી વધુ |

વજન વિભાગ :

ઉમર વિભાગોની માફક વજન વિભાગો પણ છે. જેમાં શાળાના ખેલાડીઓ, સબજુનિયર, જુનિયર, સિનિયર ખેલાડીઓ માટે અલગ અલગ વજન ગ્રૂપ છે. અહીં અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શાળાના ખેલાડીઓ માટે, સબજુનિયર અને જુનિયર વિભાગના વજન ગ્રૂપ આપવામાં આવ્યા છે :

શાળાના ખેલાડીઓ માટે વજન (કિલોગ્રામમાં)	સબજુનિયર વજન (કિલોગ્રામમાં)	જુનિયર વજન (કિલોગ્રામમાં)
29 થી 32	39 થી 42	46 થી 50
35	46	55
38	50	60
42	54	66
47	58	74
53	63	84
59	69	96
66	76	96 થી 120
73	85	-
85	-	-

કૌશલ્યો (દાવ)

(1) સલામી : કુસ્તીની શરૂઆત સલામીથી થાય છે. મેદાનની વચ્ચોવચ આવીને પહેલવાનો એકબીજા હાથ મિલાવીને હક્તધૂનન કરે છે. રેફરી આ વખતે તેમના નખ અને અન્ય જરૂરી તપાસ કરે છે. ત્યાર બાદ બંને પહેલવાનો પોતપોતાના ખૂંઝામાં ચાલ્યા થાય છે. ત્યાંથી બંને નજર સામસામી રાખશે, રેફરીની કિલ્સલનો અવાજ સાંભળતાં જ જડપથી અને ચયળતાપૂર્વક આવીને કુસ્તીની શરૂઆત કરશે.

(2) ધકેલ : જ્યારે ખેલાડીઓ સલામીની કિયા પૂરી કરી રહે ત્યાર બાદ તરત જ કુસ્તીની શરૂઆત કરે છે. બંને જણા એકબીજાને મહાત કરવા પ્રયત્ન કરે ત્યારે એકબીજાને આગળપાછળ ધકેલવાની અને બેંચવાની કિયા થાય છે. જે બે પ્રકારે થાય છે :

(i) દંડકી ધકેલ : આ કિયામાં બંને ખેલાડીઓ જમણા પગના પવિત્રે હશે. ગમે તે એક ખેલાડી દંડ ઉપર જોર મારી સામેના ખેલાડીને પાછળ ધકેલશે. સામેનો ખેલાડી પોતાનો આગળનો પગ પાછળ મૂકી પાછળ જશે. જ્યારે તેને બે-ત્રણ પગલાં પાછળ ગયા પછી તક મળશે. ત્યારે તે સામેના ખેલાડીને દંડ પર જોર આપી પાછો ધકેલશે.

(ii) ગરદન કી ધકેલ : બંને ખેલાડી આમનેસામને એકબીજાની ગરદનની પાછળ બંને હાથની આંગળીઓ ભેરવીને પકડ લેશે. ત્યાર બાદ જે ખેલાડી બીજા પર જોર કરવા માંગતો હશે તે પોતાનો આગળનો પગ પાછળ મૂકી ગરદન પર જોર આપી સામેના ખેલાડીને પોતાની તરફ બેંચશે અને ત્રણોક પગલાં પાછળ જરે. તે જ પ્રમાણે સામેનો ખેલાડી પણ કિયા કરશે.

(3) ખડી ઉંકી : જ્યારે ખેલાડી જમણા પગના પવિત્રે ઊભો હોય ત્યારે તેણે પોતાનો ડાબો હાથ પોતાની છાતી પર મૂકવો. ડાબા હાથની કોણી બંને ખભાની સીધમાં રહે તેમ રાખવી. જમણો હાથ પોતાની જમણી બાજુ પર ટેકવવાની સાથે જમણા પગને જમીન પર ધક્કો લગાવી પોતાની જમણી બાજુ પર આખા શરીરનું ચક લેતાં સામેની બાજુએ ડાબા પડાયે પડવું. આખા શરીરને અદ્ધર હવામાં ચકમય ગુલાટ લેવાની કિયાને ખડી ઉંકી કહેવામાં આવે છે. કુસ્તી કરવાની શરૂઆત કરતાં અગાઉ શરીરને સ્કૂર્ટિવાન બનાવવા અને તૈયાર કરવા માટે ખેલાડી 15 થી 20 વાખત ખડી ઉંકીની કિયા કરે છે.

(4) બેઢી ઉંકી : ઉપરની ખડી ઉંકીની કિયા ખેલાડી જ્યારે પોતાના જમણા પગને આગળ રાખી વીર બેઢકની સ્થિતિમાં રહી બેઢા બેઢા જે કિયા કરે છે તેને બેઢી ઉંકી કહેવામાં આવે છે.

(5) બગલી : સામસામે ઊભા રહી સલામી લઈને તરત જ હરીફના ડાબા હાથના કાંકું ડાબા હાથ વડે પકડતાં પોતાના તરફ બેંચી, ડાબી બાજુ ફરી હરીફના જમણા ખભાને આપકું જમણી બગલ નીચે લઈ, જમણા હાથ વડે તેની કોણીની ઉપરનો હાથ પકડી પોતાની ડાબી બાજુ બેંચી ધક્કો મારવો. એટલે હરીફ નીચે જમીન પર ચીત પડશે. આ સમયે તેણે ચપળતાથી બેસી જઈ હરીફ ખેલાડી પર આપણું શરીર નાંખવું.

(6) બગલી કી રોખ : જ્યારે હરીફ પોતાનો જમણો ખભો તેની બગલ નીચે દાબી બગલીનો દાવ લેવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોતાના ડાબા પગને હરીફની ડાબી જાંધ પર બહારની બાજુએથી લપેટી લેશે, જેથી તે બગલીનો દાવ પોતાની પર અજમાવી શકે નહિ.



(7) ખડી ટાંગ : સામેનો ખેલાડી જ્યારે તેને પાછળથી બંને હાથ વડે કમરમાંથી પકડે ત્યારે તે પકડ છોડાવી તેના જમણા હાથનું કાંકું પકડવું તથા પોતાના ડાબા હાથથી હરીફના ડાબા હાથને બહારથી લપેટ આપીને ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે પકડ લેવી. તેના પકડેલા ડાબા હાથને પછી તરત જ પોતાની છાતી પાસેથી ડાબી બાજુ તરફ આંચકો આપી બેંચતા પોતાના ડાબા પગની પિંડીથી તેના ડાબા પગની પિંડી પર જોરથી બહારની બાજુથી ટાંગ મારવી. આમ, તેનો ડાબો હાથ પોતાની જમણી તરફ બેંચવો તથા પોતાના ડાબા પગથી તેના ડાબા પગ પર ટાંગ મારવી. આ બંને કિયાઓ એકસાથે ચપળતાપૂર્વક થતાં હરીફ ખેલાડી ધબ દઈને જમીન પર ચત્તો થઈને પડશે. પોતાનો ડાબો હાથ તેના ગળાની આજુબાજુ વીંટળાયેલો રહેશે અને પોતે હરીફની ડાબી બાજુએ પોતાના ડાબા પડાયે પડેલો રહેશે.

(8) બેઢી ટાંગ : જ્યારે પોતે બેઢેલા હોઈએ અને હરીફ તેને પાછળથી કમરમાંથી પકડે ત્યારે બેઢા ખડી ટાંગ મારવા જેવી જ કિયા કરી હરીફને ચીત કરી શકાય છે.

(9) હાથકા ગલખોડા : જ્યારે હરીફ ઊભો હોય ત્યારે પોતે

તેની સામે જઈ ઊભા રહેવું. પોતાનો જમણો હાથ તેની ડાબી બાજુએથી તેના ગળા પર લપેટવો. તેની ગરદન પોતાની જમણી બગલમાં રહેશે. પોતે લપેટેલો હાથ તેના જમણા ખભા સુધી લંબાવવો અને પછી તરત જ પોતાનો ડાબો હાથ અંદરની બાજુએથી તેની જમણી બગલમાંથી કાઢી તેની જમણી પીઠ પર પોતાના આંગળાં તેની ડાબી તરફ સીધા રહે તે પ્રમાણે દબાવવા.



સ્વાધ્યાય

1. માઝા પ્રમાણે જવાબ આપો :

(1) કુસ્તીમાં ધકેલ એટલે શું ? આ કૌશલ્યની સમજૂતી આપો.

(2) કુસ્તીના મેદાનની આકૃતિ બનાવો.

2. ટૂંક નોંધ લખો :

(1) ખડી ટાંગ (2) બગલી (3) હાથકા ગલખોડા (4) બગલી કી રોખ

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો :

(1) ભારતમાં કુસ્તી કયા નામથી ઓળખાતી ?

(2) શાળાના ખેલાડીનું વયજૂથ જણાવો.

(3) સાંપ્રતકાળમાં પ્રચલિત કુસ્તીની શૈલી જણાવો.

(4) કુસ્તીમાં સલામી એટલે શું ?

4. નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પો શોધો :

(1) કુસ્તીમાં જુનિયર વિભાગના ખેલાડીઓનું વયજૂથ છે.

(A) 20થી 25 વર્ષ (B) 16થી 17 વર્ષ (C) 18થી 20 વર્ષ (D) 14થી 15 વર્ષ

(2) કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડ રમાય છે ?

(A) એક (B) બે (C) ત્રણ (D) ચાર

(3) કુસ્તીની રમતમાં કેટલા અવિકારીઓ હોય ?

(A) એક (B) બે (C) ત્રણ (D) ચાર



જૂડો

પ્રાચીન સમયથી શસ્ત્રવિહીન લડવાની કળાઓ પ્રચલિત છે. આવી કળાઓ રામાયણ અને મહાભારતકાળથી પ્રચલિત બનેલી એક કળા ‘કુસ્તી’ હતી. 19મી સદીના અંત ભાગમાં ઉદ્ભવેલી બીજી એક કળા જૂડો છે. જૂડો કળાનું ઉદ્ભવ સ્થાન જાપાન હોવાનું મનાય છે. જાપાને આ કળા/રમતનો વિકાસ પણ ઘણો કર્યો છે.

જાપાનના બૌદ્ધ સાધુઓના મઠમાં ધનસંપત્તિ રહેતી. આ ધનસંપત્તિ ચોર-લૂંટારાઓ દ્વારા ચોરાઈ જવાનો ભય રહેતો. આ ભયમાંથી મુક્ત થવા માટે બૌદ્ધ સાધુઓએ એવી કળા શોધી કાઢી કે તેના દ્વારા ચોર-લૂંટારાઓનો સામનો પણ કરી શકાય અને ‘અહિંસા પરમો ધર્મ’નો તેમનો સિદ્ધાંત પણ જળવાઈ રહે. આવી કળા તે ‘જૂડો’ની કળા હતી. શસ્ત્રો વગર ચોર-લૂંટારાઓનો સામનો કરવા, ધનસંપત્તિ લૂંટાઈ જતી રોકવા અને સ્વરક્ષણ માટે બૌદ્ધ સાધુઓએ જૂડોની કળા/રમતમાં પ્રાવીષ્ય મેળવ્યું. જેના વડે શસ્ત્રવિહીન આ કળા દ્વારા તેઓ ચોર-લૂંટારાઓને મૂઢ માર મારીને અને શારીરિક પીડાઓ આપીને ભગાડી મૂક્તા. આમ, સમય જતાં સ્વભયાવની ઉત્તમ કળા તરીકે જૂડોની કળા નિયમબદ્ધ થઈ અને સ્પર્ધાત્મક બની.

ઈ.સ. 1870 પહેલાં જાપાનમાં શસ્ત્ર વગરની અને હાથોહાથની જે લડાઈ લડાતી તે ‘યાવારા’ (YAWARA) અથવા ‘જુ-જિત્સુ’ (JU-JITSU) તરીકે ઓળખાતી.


ઈ.સ. 1870માં જાપાનના ડૉ. જિગોરો કાનો (Dr. Jigoro Kano) એ જુ-જિત્સુ જેવા શસ્ત્ર વગર અન્ય પ્રકારોનો પણ અભ્યાસ કર્યો અને શસ્ત્ર વગર લડવાના આ પ્રકારોમાંથી પાશ્વી તત્ત્વો દૂર કરી ઈ.સ. 1882માં આ પ્રવૃત્તિને કોડોકાન (KODOKAN)માં ‘જૂડો’ તરીકે શીખવવાની શરૂઆત કરી.

JUDO શબ્દમાં JUનો અર્થ Gentle or Soft (ઉમદા અથવા મૃદુ) અને DOનો અર્થ WAY (રીત, માર્ગ) કર્યો. આવી આ ‘મૃદુકળા’ અથવા ‘સભ્ય રીત’ની તાલીમ ફક્ત ઉમદા ખમીરવાળી અને જાજરમાન વ્યક્તિઓને જ આપવામાં આવતી. જેમાં બૌદ્ધ સાધુઓનો સમાવેશ થતો. JUDOનો અર્થ ‘Give Way’ થાય છે તે મુજબ પ્રતિસ્પર્ધાના માર્ગમાંથી ખસી જઈને તેના વેગની દિશામાં તેના ઉપર સાધારણ બળ લગાડી તેને મહાત કરી શકાય છે.

ઈ.સ. 1964માં જાપાનના ટોકિયો શહેરમાં યોજાયેલ વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં ‘જૂડો’ રમતની સ્પર્ધાઓ યોજાવાની શરૂઆત થઈ હતી.

મેદાન

નીચેની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જૂડોની રમતની સ્પર્ધા માટે $10 \text{ મીટર} \times 10 \text{ મીટર}$ નું મેદાન હોય છે, પરંતુ સ્પર્ધાપ્રદેશ $16 \text{ મીટર} \times 16 \text{ મીટર}$ નો હોય છે. સ્પર્ધાના મેદાન ($10 \text{ મીટર} \times 10 \text{ મીટર}$)ની બહારના પ્રદેશને સુરક્ષિત પ્રદેશ ‘Safety Area’ કહેવામાં આવે છે.



મેટ્સ

જૂડો રમતની સ્પર્ધા 10 મીટર \times 10 મીટર મેટ્સ ઉપર યોજવામાં આવે છે. આ મેટ્સ સિન્થેટિક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. 10 મીટર \times 10 મીટરની સરંગ મેટ મળવી મુશ્કેલ હોવાથી 2 મીટર લાંબી અને 1 મીટર પહોળી એવી 50 મેટ્સ હોય તો 10 મીટર \times 10 મીટરના માપની ચોરસ મેટ બનાવવી. 16 મીટર \times 16 મીટરનો ચોરસ બનાવવો હોય તો ઉપર્યુક્ત માપની જરૂરી મેટ્સનો ઉપયોગ કરવો.

આ મેટ્સની સપાઈ સમતળ અને સુંવાળી હોવી જોઈએ. જેથી તેના ઉપર સરળતાથી હલનચલન થઈ શકે છે. આવી મેટ્સ હોવાના કારણે ઈજાઓ થવાની શક્યતાઓ નહિવત્તુ હોય છે. આવી મેટ્સ મેલી થાય તોપણ તેને સરળતાથી ધોઈ શકાય છે. આ મેટ્સ ઉપર પ્લાસ્ટિકનું મોટું કવર લગાવેલું હોવું જોઈએ. કવરનો રંગ લીલો અથવા લાલ હોવો જોઈએ. કવર ઉપરથી લપસી પડાય નહિ તેવું અને સખત પ્રકારનું હોવું જોઈએ.

10 મીટર \times 10 મીટર અથવા 16 મીટર \times 16 મીટરની મેટ્સથી તૈયાર થયેલ મેટ્સ મોટા હોવમાં એવી રીતે ગોડવીને પાથરવામાં આવે છે કે જેથી મેટ્સ વચ્ચે જરા પણ જગ્યા ના રહે.

ગાંધેશ

જૂડોની વિશિષ્ટ પ્રકારની કસરતો અને વિશિષ્ટ પ્રકારના દાવને કારણે તેનો ગાંધેશ પણ વિશિષ્ટ પ્રકારનો હોય છે. આ ગાંધેશમાં-

(1) જાકીટ (Jacket) (2) પાયઝામો (Trousers) અને (3) પઢ્ઠો (Belt) હોય છે.

આ ગાંધેશનો રંગ સફેદ અથવા આછો સફેદ હોવો જોઈએ. આ ગાંધેશ સુતરાઉ જાડા કાપડમાંથી બનાવવાનો હોય છે. છોકરીઓ અથવા સ્ત્રીઓએ આ ગાંધેશ ઉપરાંત જાકીટની અંદર ટૂંકી બાંધવાળું લાંબું ટી-શર્ટ પહેરવાનું હોય છે.

(1) જાકીટ (Jacket) : જાકીટ ખુલ્લું અને હરીફના થાપાનો ભાગ ઢંકાય એટલું લાંબું હોવું જોઈએ. જાકીટની બાંધો કોણીથી નીચે સુધી રહે તેટલી લાંબી તથા હાથથી 3થી 5 સેમી જેટલી ખુલ્લી રહે તેવી હોવી જોઈએ. જાકીટના કોલરની પઢ્ઠી 4 સેમી જેટલી પહોળી અને મજબૂત સિલાઈ કરેલી હોવી જોઈએ. જાકીટ ઉપર ગજવાં કે બટન રાખવાના હોતાં નથી.

(2) પાયઝામો (Trousers) : પાયઝામો ખુલ્લો હોવો જોઈએ. તે ઘૂંટણથી સહેજ નીચે આવે તેટલો લાંબો અને પગથી 5થી 8 સેમી જેટલો ખુલ્લો રહે તેવો હોવો જોઈએ. ઘૂંટણ ઉપર ઈજા ના થાય તે માટે પાયઝામાના ઘૂંટણ ઉપરના ભાગ ઉપર જાડું કપું મૂકીને મજબૂત સિલાઈ કરવામાં આવે છે. પાયઝામા પર પણ ગજવું કે બટન રાખવામાં આવતાં નથી.

(3) પઢ્ઠો (Belt) : જાકીટને કમર ઉપર કસીને બાંધવા માટે પહૃણાનો ઉપયોગ કરવામાં આવે છે. પહૃણાની પહોળાઈ 3થી 5 સેમી તથા લંબાઈ 2.40 મીટરથી 2.70 મીટર જેટલી રાખવામાં આવે છે તથા ગાંઠ વાયા પણી પણ પહૃણા બંને છેડા લગભગ 15 સેમી જેટલા લબડતા રહે તેટલા હોવા જોઈએ. જૂડો રમનાર ખેલાડીની સિદ્ધિ કક્ષા તેણે કમરે બાંધેલા પહૃણા ઉપરથી જાણી શકાય છે.

વિદ્યાર્થી કક્ષાની શ્રેણીને KYU અને જ્યારે શિક્ષક કક્ષાની શ્રેણીને DAN કહે છે. વિદ્યાર્થી શ્રેણી ઉત્તરતા કમમાં અને શિક્ષક શ્રેણી ચટ્ટતા કમમાં હોય છે.



જૂડોનો ગાંધેશ

KYU શ્રેણીના રંગ ઉત્તરતા કમમાં

દસમી શ્રેણી	-	પીળો
નવમી શ્રેણી	-	પીળો અને વચ્ચે લાલપણી
આઠમી શ્રેણી	-	કેસરી
સાતમી શ્રેણી	-	કેસરી અને વચ્ચે લાલપણી
છઠી શ્રેણી	-	લીલો
પાંચમી શ્રેણી	-	લીલો અને વચ્ચે લાલપણી
ચોથી શ્રેણી	-	વાદળી
ગીજ શ્રેણી	-	વાદળી અને વચ્ચે લાલપણી
બીજ શ્રેણી	-	બદામી
પહેલી શ્રેણી	-	બદામી અને વચ્ચે લાલપણી

શિક્ષક શ્રેણીમાં 1થી 5 શ્રેણીના પણનો રંગ કાળો હોય છે. જ્યારે 6થી 9 શ્રેણીવાળા પણાઓમાં વચ્ચે લાલપણી હોય છે. 10મી શ્રેણીવાળાઓ પછો લાલ રંગનો હોય છે.

હવે જે-તે કૌશલ્યો વિશેની માહિતી મેળવતાં પહેલાં જાણી લઈએ કે હરીફ ખેલાડીએ જે-તે કૌશલ્યની સમાપ્તિ વખતે તેને ઈજા ના થાય તેની તકેદારીરૂપે તેણે મેટ ઉપર કેવા પ્રકારના બ્રેક ફોલ કરવાના રહેશે.

બ્રેક ફોલના પ્રકાર

બ્રેક ફોલ માટેના ચાર પ્રકાર છે :

- (1) બાજુ પર કે પડાયા પર પડવું (Side fall) (2) પીઠ પર પડવું (Back fall)
- (3) ધાતી પર પડવું (Front fall) (4) ગુલાંટ ખાવી (Rolling fall)

(1) બાજુ પર કે પડાયા પર પડવું (Side fall) : ઘણા ખરા ફેંક પ્રકારના દાવ અથવા કૌશલ્યોમાં મેટ ઉપર બાજુના પડાયે બ્રેક ફોલ કરવામાં આવે છે. આ પ્રકારના ફોલ માટે હરીફ ખેલાડીએ જે બાજુ પર બ્રેક ફોલ કરવો હોય તે બાજુનો હાથ બાજુએ સીધો રાખવો. બીજો હાથ પેટ પર મૂકવો. આ સ્થિતિમાંથી બાજુ પરના સીધા હાથને ગતિ મેળવવા ખભાની ઊંચાઈએ આગળ લાવવો અને ત્યાંથી મેટ ઉપર પડતાં તેને નીચે મેટ તરફ ગતિ આપવી. સાથે તે બાજુ પરના પગને મેટ ઉપરથી સહેજ ઊંચકીને મેટ ઉપર પડવાની બાજુએ નમાવી પડાયે સૂવાની સ્થિતિમાં આવવું.

(2) પીઠ પર પડવું (Back fall) : જ્યારે સામેનો ખેલાડી, હરીફ ખેલાડીને મેટ પર પટકવા માટે ધક્કો મારે ત્યારે મેટ ઉપર પીઠ પર પડવા માટે, પગ વૂંટણમાંથી વાળી, પંજા પર બેઠક લેતાંની સાથે પીઠ પર ગબડવું. મેટ પરથી પ્રત્યાધાત મેળવવા બંને હાથની હથેળી મેટ તરફ આવે તે રીતે બંને હાથના આધારે શરીરને, મેટ ઉપર પીઠ આવે તે રીતે પડવા દેવું.

(3) ધાતી પર પડવું (Front fall) : સામેનો ખેલાડી જ્યારે પીઠ પાછળથી ધક્કો મારે ત્યારે મેટ ઉપર ધાતી આવે તે રીતે પડવું. મેટ ઉપર પડતાં પહેલાં બંને હાથને કોણીમાંથી વાળી, જમીન પર પણાડી પ્રત્યાધાત મેળવવો. આ સમયે શરીરનું વજન બંને પગના પંજા અને બંને હાથ પર રહે છે.

(4) ગુલાંટ ખાવી (Rolling fall) : સામેનો ખેલાડી જ્યારે પીઠ પાછળથી ધક્કો મારે ત્યારે મેટ ઉપર સીધા ના પડતાં, આગળ ઝૂકી એક હાથનો ટેકો લઈ, બીજો હાથ, હથેળી બહાર તરફ રહે તે રીતે બે પગ વચ્ચે મૂકી હાથ પર ગુલાંટ ખાવી અને ટેકાવાળા હાથ વડે બ્રેક ફોલ કરવો. આ કિયા કરતાં માથું મેટને ના અડકે તેનો ઘ્યાલ રાખવો. શરીર દડાની જેમ ગબડવું જોઈએ.

હવે જે-તે કૌશલ્યો વિશે માહિતી મેળવીશું, આ કૌશલ્યો સામાન્ય રીતે ફેંક પ્રકારનાં હોઈ તેમાં બ્રેક ફોલ પડખે કરવાનું દર્શાવવામાં આવે છે.

કૌશલ્યો :

નીચેનાં કૌશલ્યો વિશે માહિતી મેળવીશું :

- | | |
|---|---|
| (1) ફ્લોટિંગ ડ્રોપ (Floating Drop : Uki To Shi) | (2) બોડી ડ્રોપ (Body Drop : Terio To Shi) |
| (3) બેલ્ટ ડ્રોપ (Belt Drop : Obio To Shi) | (4) શૉલ્ડર થ્રો (Shoulder Throw : Seolnage) |
| (5) હિપ થ્રો (Hip Throw : Lift Loin) | (6) શૉલ્ડર ડ્રોપ (Shoulder Drop :) |
| (7) શૉલ્ડર વિલ (સ્કંધ ચક) (Shoulder Wheel) | |

(1) ફ્લોટિંગ ડ્રોપ : આ કૌશલ્ય માટે મેટ ઉપર હરીફ બેલાડી સામે નેચરલ પોશ્ચરમાં ઊભા રહીને હરીફ બેલાડીના જાકીટ પર સીધી પક્કડ લેવી. પછી તેને નીચે પછાડવા માટે સૌપ્રથમ તેને બંને હાથે ઉપર તરફ ઊચકવો, જેથી તે પંજા ઉપર અસ્થિર સમતોલનમાં આવી જાય. આ વખતે તમારા ડાબા પગને સહેજ ડાબી બાજુથી પાછળ તરફ સરકાવો અને તેની સાથે જ હરીફ બેલાડીને તેની જમણી બાજુ ડાબા હાથે નીચે તરફ તથા જમણા હાથે પાછળ તરફ ધકેલતાં તે તમારી ડાબી બાજુએ તેની પીઠ ઉપર પડશે. નીચે પડતા ઈજા ના થાય તે માટે હરીફ બેલાડીએ પોતાના ડાબા હાથે પડખેનો બ્રેક ફોલ કરવો.



ફ્લોટિંગ ડ્રોપ



બોડી ડ્રોપ

(2) બોડી ડ્રોપ : મેટ ઉપર હરીફ બેલાડી સામે નેચરલ પોશ્ચરમાં ઊભા રહીને તેના જાકીટ ઉપર સીધી પકડ લેવી. પછી હરીફ બેલાડીને તમારા બંને હાથની મદદથી ઊંચકી પંજા પર લાવવો. તરત જ તમારા જમણા પગને ઉંઘાવી હરીફ બેલાડીના જમણા પગ પાસે બહારની તરફ મૂકવો. હરીફ બેલાડીને નીચે ગબડાવવા માટે તેને ડાબા હાથે નીચે તરફ અને જમણા હાથે નીચેથી ઉપર તરફ ધકેલવો. જમણો પગ સખત રાખવો જેથી હરીફ બેલાડી તેની જમણી બાજુએ નીચે પડશે. હરીફ બેલાડીને નીચે પડતાં પોતાના ડાબા હાથે બ્રેક ફોલ કરવો.

(3) બેલ્ટ ડ્રોપ : મેટ ઉપર હરીફ બેલાડીની સાથે નેચરલ પોશ્ચરમાં ઊભા રહીને તેના જાકીટ પર સીધી પકડ લેવી. પછી હરીફ બેલાડીના જમણા પગ પાસે ડાબો પગ મૂકવો. તાર બાદ જમણી બાજુ ફરતાં જમણા પગને ડાબા પગની સીધમાં મૂકવો, જેથી હરીફ બેલાડીની જમણી બાજુએ તેની દિશામાં ઊભા રહેવાની સ્થિતિ આવશે. આ સ્થિતિમાં રહીને ડાબા હાથને સીધો રાખી તેની છાતી પર મૂકી, જમણા હાથનાં આંગળાંથી હરીફ બેલાડીની જમણી કમરના પછી નીચેથી પકડ લેવી. પછી ધૂંટણમાંથી સહેજ નીચા નમી પોતાની ડાબી કમરને હરીફ બેલાડીની જમણી કમર નીચે દબાવી સીધા થતાં પછાની પકડથી તેને ઊંચકીને છોડી દો. જેથી હરીફ બેલાડી તમારી ડાબી કમરે કાટખૂશે ઊંચકાઈને નીચી પીઠ પર પડશે. પીઠ પર પડતાં ઈજા ના થાય તે માટે હરીફ બેલાડીએ ડાબા હાથે બ્રેક ફોલ કરવો.



બેલ્ટ ડ્રોપ

(4) શોદર થ્રો : હરીફ ખેલાડી સામે નેચરલ પોશ્ચરમાં તેના જાકીટ પર સીધી પકડ લઈ ઊભા રહેવું. હરીફ ખેલાડીને બંને હાથની પકડથી ઊંચકી જેથી તે તેના પંજા પર ઊંચો થશે. તરત જ તમારા જમણા પગને ઊંચકી હરીફ ખેલાડીના જમણા પગ આગળ તથા ડાબા પગને હરીફ ખેલાડીના ડાબા પગ આગળ ડાબી બાજુ ફરીને મૂકો. હરીફ ખેલાડીની જમણી ભૂજાને તમારા જમણા હાથથી નીચેથી પકડો. પછી કમરમાંથી નીચે ઝૂકી બંને હાથથી હરીફ ખેલાડીને નીચે તરફ બેંચતાં તે તમારા જમણાં ખબા નીચે પડે છે. હરીફ ખેલાડીએ નીચે પડતાં ડાબા હાથે બ્રેક ફોલ કરવો.



શોદર થ્રો



શિપ થ્રો

(5) શિપ થ્રો : હરીફ ખેલાડી સામે નેચરલ પોશ્ચરમાં તેના જાકીટ પર સીધી પકડ લઈ ઊભા રહેવું. પછી જમણો હાથ હરીફ ખેલાડીની કમર પાછળ વિટાળી તથા ડાબી બાજુ ફરી તમારા બંને પગને તેના બંને પગ વચ્ચે એવી રીતે ગોટવો કે જેથી તે તમારી પીઠ પર આવે. ત્યાર બાદ કમરમાંથી આગળ ઝૂકી તમારા ડાબા હાથને હરીફ ખેલાડીની જમણી કમર પર મૂકો. ધક્કો મારો તથા તમારા જમણા હાથની મદદથી તેને કમરમાંથી ઊંચકવા જોર લગાવો. પછી તરત જ તમારા ડાબા હાથની મદદથી તેને આગળ બેંચો. જેથી તે તમારી કમર પરથી ઊંચકાઈને મેટ પર પીઠ આવે તે રીતે પડશે. નીચે પડતાં હરીફ ખેલાડીએ તેના ડાબા હાથે બ્રેક ફોલ કરવો.



શોદર ડ્રોપ

નેચરલ પોશ્ચરમાં તેના જાકીટ પર સીધી પકડ લઈ ઊભા રહેવું. આ કૌશલ્ય માટે હરીફ ખેલાડીની જમણી બાજુના કમરપણ નીચેથી ડાબા હાથનાં આંગળાં પરોવી મજબૂત પકડ લેવી અને જમણા હાથથી હરીફ ખેલાડીના જમણા હાથની બાંધને નીચેથી પકડવી. પછી ડાબા હાથથી હરીફ ખેલાડીને નીચે તરફ બેંચો અને ડાબી બાજુ ફેરવો તથા જમણા પગને ઘૂંટણમાંથી વાળો અને ડાબા પગને સહેજ પાછળ સરકાવી ઘૂંટણ પર તેના શરીરને ડ્રોપ કરવું. જેથી હરીફ ખેલાડી ગાંધલા પર પડશે. હરીફ ખેલાડીએ તેના ડાબા હાથે બ્રેક ફોલ કરવો.



(7) શોદર કુઝશ (સુંધ ચક) : હરીફ ખેલાડી સામે નેચરલ પોશ્ચરમાં તેના જાકીટ પર સીધી પકડ લઈ ઊભા રહેવું. આ કૌશલ્ય માટે જમણા હાથની પકડ છોડી, કમરમાંથી નીચા નમી, જમણો ખલો હરીફ ખેલાડીની ડાબી કમર પર મૂકવો તથા જમણા હાથને તેના બે પગ વચ્ચે લઈ ઊભા થતાં, ડાબા હાથથી હરીફ ખેલાડીને ડાબી બાજુ નીચે તરફ તથા જમણા હાથથી ઉપર તરફ ધકેલતાં, હરીફ ખેલાડી તમારા ખબા પરથી રેંટની જેમ ફરતાં ડાબી બાજુએ નીચે પડશે. હરીફ ખેલાડીએ તેના ડાબા હાથે બ્રેક ફોલ કરવો.

જૂડો રમતના નિયમો :

(1) સ્પર્ધાની શરૂઆત : સ્પર્ધા પ્રદેશની મેટ વચ્ચે, બંને સ્પર્ધકો તેમની વચ્ચે લગભગ 4 મીટર જેટલું અંતર રહે તે રીતે એકબીજાની સામે મૌં રાખીને ઊભા રહે છે તથા એકબીજાને 'નમસ્કાર' (રે) કરે છે. પંચનો શરૂ કરો - હજે (HAJME)નો હુકમ મળ્યા પછી જ સ્પર્ધા શરૂ થાય છે.

(2) સ્પર્ધાનો અંત : સમય પૂરો થતાં પંચ સોરે-માદે (SORE-MADE) બોલશે ત્યારે સ્પર્ધા પૂરી થશે. સ્પર્ધા પૂરી થતાં બંને સ્પર્ધકો શરૂઆતની જેમ સ્પર્ધા પ્રદેશની મેટ વચ્ચે એકબીજાની સામે મૌં રાખીને ઊભા રહે ત્યારે પંચ સ્પર્ધાનો નિર્ણય આપશે અને પરિણામની જહેરાત કરે છે.

(3) બિનહરીફ વિજેતા : જ્યારે એક સ્પર્ધક હાજર હોય અને બીજો ગેરહાજર હોય ત્યારે બિનહરીફ વિજેતા (ફ્લૂસેન ગાચી)નો નિર્ણય આપવામાં આવે છે.

જ્યારે કોઈ સ્પર્ધક પોતાનું નામ સ્પર્ધામાંથી પાછું બેંચી લે ત્યારે તેના પ્રતિસ્પદિનિ (ટીકેન-ગાચી)થી વિજેતા જહેર કરવામાં આવે છે.

(4) ઈજા, માંદગી અથવા અકસ્માત : જ્યારે એક અથવા બંને સ્પર્ધકને ઈજા થઈ હશે ત્યારે પંચ સ્પર્ધા બંધ કરાવશે અને ઈજા પામનાર સ્પર્ધક/સ્પર્ધકને આરામ માટે તથા પાટો બાંધવા અથવા ફરી પાટો બાંધવા પંચ વધુમાં વધુ 5 મિનિટ આપે છે.

જ્યારે સ્પર્ધા દરમિયાન સ્પર્ધકને ઈજા થાય અને ઈજા ગંભીર હોય ત્યારે સારવાર માટે સ્પર્ધા ક્ષેત્રની બહાર જવું પડે તેમ હોય તો પંચ સ્પર્ધા પૂરી થયેલી જહેર કરશે અને આ નિયમની અન્ય જોગવાઈઓ અનુસાર નિર્ણય આપે છે.

જ્યારે કોઈ સ્પર્ધકને ઈજા થાય, માંદો પડે અથવા તેને અકસ્માત થાય અને તેથી સ્પર્ધામાં રહી શકે તેમ ના હોય ત્યારે નિર્ણાયકો સાથે મસલત કર્યા પછી જ નીચેના સંજોગોમાં પંચ 'કાચી માકે' અથવા 'હીકે વાકે' જહેર કરે છે.

ઈજા :

- ઈજા પામનાર સ્પર્ધકને ઈજા પોતાના કારણે થઈ હોય એમ લાગે તો ઈજા પામેલા સ્પર્ધક સ્પર્ધા ગુમાવે છે.
- ઈજા ના થઈ હોય તેવા સ્પર્ધકને લીધે જો તેના પ્રતિસ્પદિનિ ઈજા થઈ હશે તો જેને ઈજા નથી થઈ તે સ્પર્ધક સ્પર્ધા ગુમાવશે અને ઈજા પામનાર વિજેતા ગણાય છે.
- ઈજા કયા સ્પર્ધકને થઈ છે તે જાણી ના શકાય તેવા સંજોગોમાં પંચ 'હીકે વાકે' જહેર કરે છે.

માંદગી :

સામાન્ય રીતે સ્પર્ધા દરમિયાન કોઈ સ્પર્ધક બીમાર પડી જાય અને સ્પર્ધા ના કરી શકે તેમ હોય તો તે સ્પર્ધા ગુમાવે છે.
અકસ્માત : જ્યારે કોઈ બહારના કારણસર અકસ્માત થાય ત્યારે પંચ 'હીકે વાકે' જહેર કરે છે.

(5) જ્યારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેનો સમાવેશ નિયમોમાં ના થયો હોય તેવા સંજોગોમાં પંચ નિર્ણાયકો સાથે મસલત કરી તેનો નિર્ણય આપે છે.

(6) વયજૂથ : શાળાકીય સ્પર્ધાઓ માટે વયજૂથ નીચે પ્રમાણે રહેશે.

- 14 વર્ષથી નીચે (ધોરણ 8 સુધી)
- 17 વર્ષથી નીચે
- 19 વર્ષથી નીચે

(7) લડતની સમય અવધિ :

- 14 વર્ષથી નીચે : ભાઈઓ-ભહેનો - 3 મિનિટ
- 17 વર્ષથી નીચે : ભાઈઓ-ભહેનો - 4 મિનિટ
- 19 વર્ષથી નીચે : ભાઈઓ-ભહેનો - 4 મિનિટ

(8) ગુણ આપવાની પદ્ધતિ :

- (i) એક સ્પર્ધક પોતાનું સમતોલન જાળવીને પ્રતિસ્પર્ધાનિ મેટ પર એવી રીતે પછાડે કે જેથી પ્રતિસ્પર્ધાના શરીરનું કોઈ એક પડખું મેટને સ્પર્શો ત્યારે ‘યુકો’ (YUKO) ગુણ મળશે.
- (ii) સ્પર્ધક પોતાનું સમતોલન જાળવી રાખે અને પ્રતિસ્પર્ધાના શરીરનો કોઈ પણ એક ખબાનો ભાગ મેટને સ્પર્શો ત્યારે ‘વાજા-આરી’ (WAZA-ARI) ગુણ જાહેર કરવામાં આવે છે.
- (iii) પોતાનું સમતોલન જાળવીને પ્રતિસ્પર્ધાનિ એવી રીતે મેટ પર પટકે કે જેથી તેના બંને ખબા મેટને સ્પર્શો ત્યારે ‘ઇંપોન’ (IPPON) ગુણ એટલે કે પૂર્ણ ગુણ મળશે અને સ્પર્ધા પૂરી થયેલી જાહેર કરવામાં આવશે.
- (iv) કોઈ એક સ્પર્ધક પ્રતિસ્પર્ધાનિ મેટ પર પટકી તેને તેની પીઠ પર દબાવી રાખે તો તેને ‘ઓસાઈ કોમી’ (OSAI KOMI) કહે છે. ઓસાઈ કોમીની કિયામાં પ્રતિસ્પર્ધાનિ જેટલો સમય જાળવી રાખે તેટલા સમય માટે નીચે પ્રમાણે ગુણ આપવામાં આવે છે
- (a) 10થી 14 સેકન્ડ માટે પકડી રાખે તો ‘યુકો’ ગુણ (b) 15થી 19 સેકન્ડ માટે પકડી રાખે તો ‘વાજા આરી’ ગુણ
(c) 20 સેકન્ડ સુધી પકડી રાખે પૂર્ણ ‘ઇંપોન’ ગુણ.

(9) શિક્ષાત્મક ગુણ : જો કોઈ સ્પર્ધક નકારાત્મક રમત રમે અને પોતાના પર પકડ ના લેવા હે, યોગ્ય પકડ ના લે, દાવ અજમાવવા પ્રયત્ન ના કરે અને સમય બરાબાદ કરે તથા નિયમ વિશુદ્ધના દાવ અજમાવે તો તેવા ખેલાડીને તેની ભૂલની માત્રા પ્રમાણે નકારાત્મક નીચે પ્રમાણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે :

આવી નકારાત્મક રમત માટે પ્રથમ ત્રણ ભૂલ સુધી પંચ સ્પર્ધકને ‘ચેતવણી’ આપશે અને ચોથી વખત ભૂલ કરશે તો સ્પર્ધામાંથી જે-તે લડત પૂરતો તેને બાકાત કરવામાં આવે છે.

(10) એક વજન જૂથમાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોના ચિઠી-ઉપાડથી ડ્રો કરવામાં આવશે. સામાન્ય રીતે બાતલ પદ્ધતિથી સ્પર્ધા કરવામાં આવે છે. એકવાર હારનારને ફરી એક તક આપવામાં આવે છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :

- (1) જૂડોના ગણવેશમાં શાનો સમાવેશ થાય છે તે સમજાવો.
- (2) જૂડોના ગણવેશમાં ‘KYU’કઈ કક્ષાની શ્રેણી છે અને ‘DAN’કઈ કક્ષાની શ્રેણી છે તેની વિગતો આપો.
- (3) જૂડોની રમતની શરૂઆત અને અંત કેવી રીતે થાય છે તે સમજાવો.
- (4) જૂડોની રમતમાં ઈજા, માંદગી અને અકસ્માત પ્રસંગોએ કેવા નિર્ણયો આપવામાં આવે છે તે જણાવો.
- (5) જૂડોની રમતમાં ગુણ આપવાની પદ્ધતિ સમજાવો.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :

- (1) જૂડો રમતના ‘ફ્લોટિંગ ડ્રોપ’ કૌશલ્યની સમજૂતી આપો.
- (2) જૂડો રમતના ‘શોલ્ડર શ્રો’ કૌશલ્યની સમજૂતી આપો.
- (3) જૂડો રમતના ‘બેલ્ટ ડ્રોપ’ કૌશલ્યની સમજૂતી આપો.
- (4) જૂડો રમતના ‘શોલ્ડર વિલ્લ’ અથવા ‘સ્કંધ ચક’ કૌશલ્યની સમજૂતી આપો.
- (5) શિક્ષાત્મક ગુણ આપવાની પદ્ધતિ સમજાવો.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર તેની સામે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો :

- (1) જૂડો રમવાની શોધ ક્યા દેશમાં થઈ હતી ?
(A) ઉત્તર કોરિયા (B) દક્ષિણ કોરિયા (C) ચીન (D) જપાન
- (2) જૂડોની સ્પર્ધા માટે મેટની લંબાઈ-પહોળાઈ કેટલી હોય છે ?
(A) 5 મીટર x 25 મીટર (B) 10 મીટર x 10 મીટર
(C) 12 મીટર x 12 મીટર (D) 16 મીટર x 16 મીટર
- (3) જૂડોની સ્પર્ધા માટેની મેટ કેવી હોવી જોઈએ ?
(A) જરી (B) પાતળી (C) સમતળ અને સુંવાળી (D) ખરબચચી
- (4) જૂડોની સ્પર્ધા માટેની મેટના કવરનો રંગ કેવો હોવો જોઈએ ?
(A) પીળો અથવા કેસરી (B) લીલો અથવા લાલ
(C) કાળો અથવા ધોળો (D) બદામી અથવા વાદળી
- (5) જૂડોની સ્પર્ધાના બહારનો પ્રદેશ કેવો કહેવાય છે ?
(A) સુરક્ષિત પ્રદેશ (B) અસુરક્ષિત પ્રદેશ
(C) ભયજનક પ્રદેશ (D) આરામદાયક પ્રદેશ
- (6) વિધાર્થી કક્ષામાં પણાની શ્રેણીને શું કહે છે ?
(A) KUR (B) RUK (C) KYU (D) KUY
- (7) શિક્ષક કક્ષાના પણાની શ્રેણીને શું કહે છે ?
(A) NAD (B) AND (C) DAN (D) DAM
- (8) નીચેના કૌશલ્યોમાંથી જૂડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો :
(A) ફ્લોટિંગ ડ્રોપ (B) શોલ્ડર ડ્રોપ (C) બોડી ડ્રોપ (D) સિંગલ ડ્રોપ
- (9) જૂડોના ગણવેશનો રંગ કેવો હોવો જોઈએ ?
(A) પીળો અથવા આછો પીળો (B) સફેદ અથવા આછો સફેદ
(C) બદામી અથવા આછો બદામી (D) સફેદ અથવા કાળો
- (10) જૂડોની સ્પર્ધા શરૂ કરવા માટે ક્યો શબ્દ વપરાય છે ?
(A) સોરે-માટે (B) છિકે-વાકે (C) કાચી-માક (D) હજમે



ઇતિહાસ

આ કળાની શરૂઆત બૌદ્ધ સાધુઓ દ્વારા ભારતમાં થઈ હોવાનું માનવામાં આવે છે. પુરાતન સમયમાં જંગલમાં વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલી પશુઓથી તથા ચોર-ડાઢુઓથી પોતાનું રક્ષણ જીતે કરવા, સામેની વ્યક્તિને ઈજા ન થાય તે રીતે પોતાનાથી દૂર રાખવા અથવા વિરોધી પર તેને ઈજા ન થાય તે રીતે કબજો કરવા (અહિસાના સિદ્ધાંત મુજબ) આ કળાનો વિકાસ કર્યો. આગળ જતા બૌદ્ધ ધર્મ ચીન અને જાપાન જેવા દેશોમાં પ્રચાર અને પ્રસાર પામ્યો. બૌદ્ધ સાધુઓની સાથે સાથે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી આ કળા પણ જાપાન પહોંચ્યી.


કરાટે શબ્દ જેપાનિઝ ભાષાનો છે. ‘કરા’ એટલે ખાલી, ‘ટે’ એટલે હાથ. ખાલી હાથે (હથિયાર વગર) યુદ્ધ કરવાની કળા એટલે કરાટે.

જાપાનના ઓકીનાવા પ્રાંતમાં રાજાએ સતતરમી શતાબ્દિમાં આમજનતા માટે હથિયાર રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો. જેથી રાજાની વિરુદ્ધ બળવો કરી શકે નહિં. આ સ્થિતિમાં સામાન્ય જનતાએ પોતાના સ્વરક્ષણ માટે તથા વિરોધીઓને માત કરવા માટે ખાલી હાથે યુદ્ધ કરવાની કળાનો વિકાસ કર્યો તે કરાટે તરીકે પ્રસિદ્ધ થઈ. ઓકીનાવા પ્રાંતમાંથી આ કળા પૂરા જાપાનમાં ફેલાઈ તથા ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં ફેલાઈ અને વિશ્વમાં 180 કરતાં પણ વધારે દેશોમાં લોકો ઉત્સાહપૂર્વક કરાટે શીખે છે.

જાપાનમાં આ કળાના પ્રાણોત્તા તરીકે ગીયીન ફુનાકોશીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે 18મી સદીના અંતભાગમાં કરાટેનો પ્રચાર તથા પ્રસાર કર્યો. 19મી સદીના શરૂઆતમાં આ કળાને આધુનિક રમતનું સ્વરૂપ આપી પણ્યમના દેશોમાં પ્રસિદ્ધ કરવાનું શ્રેય હાન્સી ગોણીન યામાગુચીને જાય છે.

ભારતમાં આ પ્રકારની લડાઈની કલાનું નિર્દર્શન સૌપ્રથમ શાંતિનિકેતનમાં કરવામાં આવેલ. જાપાનના ટોકિયો ખાતે આવેલી કોડોકાન સંસ્થાના શિન્જો તાગાકી (Shinzo Tagaki) રવીન્દ્રનાથજીના નિમંત્રણને માન આપીને ભારત આવેલા.

મેદાન



મેદાનની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 8 મીટર હોય છે. એટલે કે ચોરસ મેદાનમાં આ રમત રમાડવામાં આવે છે. ખાસ પ્રકારના રબરમાંથી બનેલા ગાઢલા (મેટ) ઉપર આ રમત રમાય છે. મેટનો રંગ બ્લૂ અને લાલ હોય છે. વચ્ચેનો 2 મીટર x 2 મીટરનો વિસ્તાર લાલ અને બહારનો 1 મીટરનો વિસ્તાર લાલ રંગનો હોય છે. બહારની તરફના 1 મીટરના લાલ વિસ્તારને સલામત ક્ષેત્ર કહે છે. સલામત ક્ષેત્ર બહાર આકમણ માટે પોર્ટન્ટ (ગુણા) આપવામાં આવતા નથી. રમત દરમિયાન ખેલાડી સલામત ક્ષેત્રમાં પહોંચી જાય તો મેચ રૈફલી રમત બંધ કરાવી બંને ખેલાડીને મધ્યમાં લાવી રમત ફરીથી શરૂ કરવામાં આવે છે.

સાધનો :

ખાસ પ્રકારના રબરના ગાઢલા, સ્ટોપવોચ, કરાટે ગી

કૌશલ્યો :

કરાટે રમતનાં મુખ્ય કૌશલ્યો નીચે મુજબ છે :

- (1) હાથ દ્વારા પ્રહાર (Punch) જાપાનિઝ શર્જ જુકી (Zuki) (2) પગ દ્વારા પ્રહાર (Kick) જાપાનિઝ શર્જ ગેરી (Geri)
- (3) હાથ દ્વારા બચાવ (Block) જાપાનિઝ શર્જ ઉકે (Uke)

(1) હાથ દ્વારા પ્રહાર (Punch) :

જાપાનિઝ ભાષામાં હાથ દ્વારા પ્રહાર (Punch)ને જુકી (Zuki) કહેવામાં આવે છે. હાથ દ્વારા પ્રહારની ઘણી પદ્ધતિઓ છે. તેમાંની કેટલીક નીચે મુજબ છે :

(a) Choku Zuki - ચોકુજુકી Straight Punch :

આ કૌશલ્યમાં ખેલાડી પોતાના શરીરનું સમતોલન બંને પગ પર રાખીને મજબૂત હાથ વડે પોતાના જ્વાની ઊંચાઈએ સામેની તરફ વિરોધી ખેલાડી ઉપર પ્રહાર કરે છે.



(b) Gedan Zuki Straight upper Punch :

આ કૌશલ્યમાં ખેલાડી પોતાના શરીરનું સમતોલન બંને પગ પર રાખી પોતાના મજબૂત હાથ વડે વિરોધી ખેલાડીના જ્વાની ઊંચાઈએ ઉપરના ભાગ પર હાથથી પ્રહાર કરવામાં આવે છે. આંખ, નાક, મોઢા સિવાયના ભાગ ઉપર આકમણ કરી શકાય છે.



(c) Gedan Zuki (Gedan Zuki) Straight Lower Punch :

આ કૌશલ્યમાં ખેલાડી પોતાના શરીરનું વજન બંને પગ પર સમતોલન રાખીને પોતાના મજબૂત હાથ વડે વિરોધીના કમરથી નીચેના ભાગ પર હાથથી પ્રહાર કરવામાં આવે છે.



(2) પગ દ્વારા પ્રહાર (Kick) ગેરી (Geri) :

કરાટે રમતનું આ એક અગત્યનું કૌશલ્ય છે. વિરોધી ખેલાડી ઉપર પગ દ્વારા અનેક રીતે પ્રહાર કરી શકાય છે. જેમાંના કેટલાક નીચે મુજબ છે :



(a) હીજા ગેરી (Hizageri) Knee Kick :

આ કૌશલ્યમાં ખેલાડી પોતાના મજબૂત પગ ઉપર શરીરનું સંતુલન કરી વિરોધી ખેલાડીના ઘૂંઠણ ઉપર બીજા પગની બાજુની ધાર (Edge) દ્વારા પ્રહાર કરવામાં આવે છે.



(b) માએ ગેરી (Mae Geri) :

આ કૌશલ્યમાં શરીરનું વજન મજબૂત પગ પર લઈને બીજા પગના ઘૂંઠણને કમર સુધી ઉપર લઈ જઈ સામેની તરફ સીધો કરવામાં આવે છે. આ પ્રહારને માએ ગેરી કહે છે.

(c) યોકો ગેરી (Yoko Geri) Side Snap Kick :

આ કૌશલ્યમાં ખેલાડીનું વજન મજબૂત પગ પર લઈને બીજા પગ દ્વારા બાજુ પર પ્રહાર કરવામાં આવે છે. પ્રહાર કરતી વખતે નજર પ્રહાર સ્થાન (બિંદુ) પર રાખવાથી વધારે સારો પ્રહાર થઈ શકે છે.



(3) હાથ દ્વારા બચાવ (Hand Block) :

આ રમતમાં પ્રહારની જેમજ બચાવ કૌશલ્યોનું પણ એટલું જ મહત્વ છે. જેનાથી વિરોધી ખેલાડી દ્વારા કરવામાં આવેલા ગમે તેવા મજબૂત પ્રહારથી બચી શકાય છે. જાપાનિઝ ભાષામાં બચાવને ઉકે (Uke) કહે છે.

(a) (Jodan Uke) જોડાન ઉકે :

આ બ્લોકમાં શરીરના ઉપરના ભાગમાં કરવામાં આવતા પ્રહારથી બચવા હાથને કોણીમાંથી વાળીને કપાળની સહેજ ઉપર સહેજ આગળ રાખીને પ્રહાર રોકવામાં આવે છે.



(b) ચુડાન ઉકે (Chudan Uke) Middle area Block :

આ કૌશલ્યમાં શરીરના ધડ ઉપર કરતાં પ્રહારને રોકવામાં આવે છે અથવા નિષ્ફળ કરવામાં આવે છે.

આ કૌશલ્યમાં કોણીમાંથી હાથને વાળીને નાકની સામે મુશ્કી આવે તે રીતે હાથને રાખવામાં આવે છે.



નિયમો :

- (1) આ રમતના બે પ્રકાર છે : (i) કાતા (ii) લડાઈ.
- (2) કાતા પ્રકારમાં વ્યક્તિગત દેખાવ કરવાનો હોય છે. જેમાં કાલ્યનિક વિરોધી સાથે પહેલેથી ગોઠવણ મુજબના દાવ કરવામાં આવે છે.
- (3) બીજા પ્રકારની રમત સામસામે બે ખેલાડીઓ નિયમની મર્યાદામાં રહીને પ્રહાર કરે છે.
- (4) આ રમતમાં ખાસ પ્રકારના સહેદ ખૂલતો જર્બો તથા સહેદ ખૂલતો પાયજામો (કરાટે ગી) પહેરવામાં આવે છે.
- (5) હાથ અને પગ પર કોઈ પણ બચાવ કે આકમણ માટે મોંજન પહેરી શકાતા નથી.
- (6) ખૂલ્લા પરે રમત રમવામાં આવે છે.
- (7) આ રમતમાં એક મેટ રેફરી તથા ત્રણ સાઈડ જજ હોય છે.
- (8) મેટ રેફરી રમત દરમિયાન મેટ પર રહે છે.
- (9) મેટ રેફરીની ડાબી તરફ ઊભેલા ખેલાડીને 'એઓ' તથા જમણી તરફ ઊભેલા ખેલાડીને 'અકા' કહે છે.
- (10) રમત દરમિયાન આંખ, નાક, મોંજ તથા કમરથી નીચેના ભાગ પર હાથથી વાર કરી શકાતા નથી.
- (11) દરેક રમતનો સમય 3 (ત્રણ) મિનિટનો હોય છે.
- (12) જુનિયર ભાઈઓ તથા મહિલાઓ માટે રમતનો સમય 2 (બે) મિનિટ રાખવામાં આવે છે.
- (13) રમત દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
- (14) જુદા જુદા પ્રકારનાં આકમણ માટે જુદા જુદા ગુણ (પોઇન્ટ) આપવામાં આવે છે. જેમકે,

સનબોન	-	3 ગુણ
નીછોન	-	2 ગુણ
ઈંફોન	-	1 ગુણ

- (15) જુદા જુદા પ્રકારની ભૂલો માટે જુદા જુદા પ્રકારના ફાઉલ અથવા પેનેટ્ટી ગુણ આપવામાં આવે છે. જેમકે,
- (1) કેઈકોકુ - વિરોધી ખેલાડીને 1 ગુણ
 - (2) હસોકુચુઈ - વિરોધી ખેલાડીને 2 ગુણ
 - (3) ઈંઘોન - સ્વર્ધમાંથી બાકાત
- (16) રમત દરમિયાન વિરોધી ખેલાડીના વાળ પકડી શકતા નથી.
- (17) રમત દરમિયાન વિરોધી ખેલાડીને દાંત વડે ઈજા કરી શકતી નથી.
- (18) રમત દરમિયાન ઉત્સાહવર્ધક અવાજ કરવાની છૂટ હોય છે.
- (19) રમત દરમિયાન વિરોધી ખેલાડીને અપશબ્દ બોલનાર ખેલાડીને કેઈકોકુ પોઈન્ટ આપવામાં આવે છે.
- (20) રમત દરમિયાન રેફરી અથવા જજને અપશબ્દ બોલનાર ખેલાડીને હસોકુચુઈ પોઈન્ટ આપવામાં આવે છે.
- (21) રમત દરમિયાન કોઈ પણ ખેલાડી જમીન ઉપર પડી જાય તો તેના ઉપર પ્રહાર કરી શકતો નથી.
- (22) નિયત સમયમર્યાદામાં રમત અનિર્ણિત રહે તો 1 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે.
- (23) રમત શરૂ થયા પછી કોઈ ખેલાડી આકમણ ન કરે તો તે ખેલાડીને પેનેટ્ટી પોઈન્ટ આપવામાં આવે છે.
- (24) કરાટેની રમતમાં વયજૂથની સાથે વજનજૂથ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
- (25) કરાટે રમત રમતી વખતે શરીર ઉપર કોઈ પણ ધાતુનાં ધરેણાં કે ધાતુની વસ્તુ પહેરી શકતી નથી.
- (26) હાલમાં કરાટેમાં શોટોકાન, શિટોરિયુ, બિનોરિયુ, ગોઝોરિયુ, વાગેરિયુ જેવી સ્ટાઇલ ભારતમાં વધુ પ્રચલિત છે.
- (27) રમત દરમિયાન સેઝટી એરિયાની બહાર વિરોધી ખેલાડી પર પ્રહાર કરી શકતો નથી.
- (28) હાલમાં આધુનિક કરાટેમાં કેટલીક સ્ટાઇલમાં સલામતીના ભાગરૂપે હેડગાર્ડ, ચેસ્ટગાર્ડ, સીનગાર્ડ વગેરે સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) હાથ દ્વારા પ્રહારનાં કૌશલ્યોનાં નામ આપો અને તેની સમજૂતી આપો.
- (2) પગ દ્વારા પ્રહારનાં કૌશલ્યોનાં નામ આપો અને તેની સમજૂતી આપો.
- (3) હાથ દ્વારા બચાવ કૌશલ્યનાં નામ આપો અને તેની સમજૂતી આપો.

2. ટૂંક નોંધ લખો :

- (1) કરાટે રમતનું મેદાન
- (2) કરાટે સ્વર્ધમાંનો પોશાક
- (3) કરાટે સ્વર્ધમાંસ સલામતીના ઉપકરણ

3. નીચેના પ્રશ્નોની નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો :

- (1) કરાટે રમતનાં મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો.
 - (A) 8 મીટર \times 8 મીટર (B) 7 મીટર \times 7 મીટર (C) 8 મીટર \times 7 મીટર (D) 7 મીટર \times 8 મીટર
 - (2) નીચેના પૈકી હાથ દ્વારા પ્રહારનું કૌશલ્ય કર્યું છે ?
- | | | | |
|--------------|---------------|---------------|---------------|
| (A) ચોકુઝુકી | (B) હીજા ગેરી | (C) જોડાન ઉકે | (D) ચુડાન ઉકે |
|--------------|---------------|---------------|---------------|

- (3) નીચેના પૈકી પગ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે ?
(A) જોડાન જુકી (B) ગેડાન જુકી (C) માએ ગેરી (D) ચુડાન ઉકે
- (4) નીચેના પૈકી હાથ દ્વારા બચાવનું કૌશલ્ય કયું છે ?
(A) જોડાન જુકી (B) હીજા ગેરી (C) માએ ગેરી (D) જોડાન ઉકે
- (5) કરાટે સ્પર્ધામાં ક્યાં વાર કરી શકતી નથી ?
(A) પેટ પર (B) કમર પર (C) ખભા પર (D) મોઢા પર
- (6) કરાટે સ્પર્ધામાં જુનિયર વિભાગ માટે કેટલો સમય રાખવામાં આવે છે ?
(A) 3 મિનિટ (B) 4 મિનિટ (C) 2 મિનિટ (D) 1 મિનિટ
- (7) ક્યા આક્મણ માટે સ્પર્ધામાં ગુણ 3 મળે છે ?
(A) નીટોન (B) ઈયોન (C) સનબોન (D) કેઇકોક
- (8) ક્યા પ્રકારની ભૂલ માટે પ્રતિસ્પર્ધિને 1 ગુણ આપવામાં આવે છે ?
(A) હંસોકુ સુઈ (B) કેઇકોકુ (C) હંસોક (D) ઈયોન
- (9) કરાટે સ્પર્ધામાં શેનો ઉપયોગ કરી શકતો નથી ?
(A) હેડગાર્ડ (B) એસ્ટગાર્ડ (C) સીનગાર્ડ (D) ધાતુનું કકુ
- (10) કરાટે રમતના કેટલા પ્રકાર છે ?
(A) એક (B) બે (C) ત્રણ (D) ચાર

● ● ●